2012-03-27 -Divya Bhaskar -Bidada -Satpanth Samaj Protest [421]

સુવિચાર

શિક્ષક પ્રથમ પૂજ્ય છે અને મહાન વ્યક્તિઓમાં અગ્રણી છે, કેમકે તે વિદ્યાર્થીનું નહીં, માનવતા અને તેમાં સમાયેલા હિત અને ઉન્નતિનું નિર્માણ કરે છે.

-પંડિત મદનમોહન માલવિય

realpatidar.com

દિવ્ય ભાસ્કર

ભારતનું સૌથી ઝડપી વિકસતું અખબાર

કુલ પાના 14 +12 (મધુરિમા)=26 । કિંમત ₹ 2.50

divyabhaskar.com મંગળવાર ભુજ । 27 માર્ચ, 2012 ચૈત્ર સુદ -5, વિક્રમ સંવત : 2067

આજનું મેગેઝિન **મધુરિમા** નજર ન લાગે સુંદરતાને

સેન્સેક્સ	17 ,052 .78 ↓	
પાછલો 17361.74	તફાવત -308 .96	
નિફ્ટી	5184 .25 ↓	
પાછલો 5278 .20	તફાવત -93 .95	
સોનુ	---	
પાછલો ---	તફાવત ---	
ચાંદી	---	
પાછલો ---	તફાવત ---	
ડોલર	51.27 ↑	
પાછલો 51.17	તફાવત -0 .10	

ન્યૂઝ ઇનબોક્સ

મરાઠી કવિ ગ્રેસનું નિધન

પુણે: મરાઠી કાવ્ય જગતમાં છેલ્લા 45 વર્ષથી આધિપત્ય ભોગવનારા પીઢ કવિ અને લલિત લેખોના ઉસ્તાદ ગણાતા કવિ ગ્રેસ ઉર્ફે માણિક ગોડઘાટેનું પૂણેની દિનાનાથ મંગેશકર હોસ્પિટલમાં 75 વર્ષની વયે નિધન થયું હતું. ગત માસે જ તેમને પ્રતિષ્ઠિત સાહિત્ય અકાદમી એવોર્ડ આપવામાં આવ્યો હતો.

શહીદોનું બાંગ્લાદેશમાં સમ્માન

નવી દિલ્હી: બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામમાં પ્રાણ ન્યોછાવર કરનારા 1400 ભારતીય સૈનિકોનું મંગળવારે બાંગ્લાદેશ સમ્માન કરશે. નવ માસ ચાલેલા 1971ના બાંગ્લાદેશની આઝાદીના જંગમાં ભારતીય યોગદાનને લીધે તેને વધુ ઔપચારિક માન્યતા આપવામાં આવી છે.

સીઆરપીએફ જવાન શહીદ

રાયપૂર: છત્તીસગઢના સુકમા જિલ્લામાં માઓવાદીઓ સાથેની અથડામણમાં સીઆરપીએફનો એક જવાન શહીદ થઇ જવા પામ્યો હતો, જ્યારે અન્ય જવાનને ઇજા થવા પામી હતી.સુરક્ષા પેટ્રોલિંગ માટે નીકળેલી ટીમ સાથે અલ્પલ મિત્તા નીકળ્યો હતો અને માઓવાદીઓએ જવાનોને નિશાન બનાવ્યા હતા.

જાપાનમાં બોટ ડૂબી: 12 લાપતા

ટોક્યો : જાપાનમાં 12 ઇન્ડોનેશિયન ક્રુ મેમ્બર્સને લઇને જઇ રહેલી નાવ ડૂબી જતાં તમામ મુસાફરો લાપતા બની ગયા છે. દુર્ઘટનાનો સંદેશ મળતાં જ કોસ્ટગાર્ડની ટીમ ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવા દોડી ગઇ છે.

અમદાવાદ બ્લાસ્ટના આરોપી જબ્બે

મુંબઇ : ઔરંગાબાદમાં સોમવારે ધોળેદહાડે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને શંકાસ્પદ આતંકવાદીઓ વચ્ચે થયેલી ઝપાઝપીમાં એક ઠાર થયો હતો, જ્યારે અમદાવાદ સિરિયલ ધડાકાના આરોપી સહિત બે જણની શસ્ત્રો સાથે ધરપકડ કરવામાં આવી છે. રાકેશ મારિયાએ આપેલી માહિતી અનુસાર ઔરંગાબાદમાં હિમાયત બાગ વિસ્તારમાં ઉદ્ધવરાવ પાટીલચોક સોમવારે બપોરે 12.30 વાગ્યાના સુમારે થયેલી ઝપાઝપીમાં ખલીલ કુરેશી ઠાર થયો હતો.

સ્વીસ બેંકમાં 180 કરોડ ભરાયા

નવી દિલ્હી : પ્રણવ મુખરજીએ સંસદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સ્વીસ બેન્કમાં ખાતાં ધરાવનારા કેટલાક લોકોએ રૂપિયા 180 કરોડ સુધીનો વેરો ભર્યો છે. જોકે તેમણે આવી વ્યક્તિઓનાં નામ નહોતા આપ્યા. મુખરજીએ જણાવ્યું હતું કે ડબલ ટેક્સેશન એવોઇડન્સ કન્વેન્શન હેઠળ સરકારને ફ્રાન્સ-જર્મની તરફથી માહિતી પ્રાપ્ત થઇ છે.

દિવ્ય ભાસ્કર દ્વારા સોની-મહાજનોની હડતાળ મુદ્દે ટોક શો યોજાયો હતો. અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલા ભાસ્કર હાઉસ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં 1500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

છેવટ સુધી લડાઇનો ટંકાર

અમદાવાદ: સોનાના દાગીનાની બનાવટ પર એક્સાઇઝ, બે લાખની વધુ રોકડ ખરીદી પર ટીડીએસ સહિતની બજેટમાં કરાયેલી જોગવાઈ સામે આંદોલન પર ઉતરેલા સોની-મહાજનોએ જ્યાં સુધી એક્સાઇઝનો કાયદો દૂર નહીં થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો ટંકાર કર્યો છે. 'દિવ્ય ભાસ્કર' દ્વારા આયોજિત ટોક શોમાં રાજ્યભરના અગ્રણી જ્વેલર્સ એસોસિએશન તથા કારીગર સંગઠનોના 1500થી વધુ હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને છેક સુધી લડી લેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ હડતાળથી અત્યાર સુધીમાં ગુજરાતમાં 16 હજાર કરોડનું ટર્નઓવર ઠપ થઈ ગયું હોવાનું પણ કહેવાયું હતું. એસ.જી. હાઇવે પર આવેલા ભાસ્કર હાઉસ ખાતે યોજાયેલા સોની મહાજનોની પ્રચંડ હાજરીવાળા ટોક શોમાં અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ ઝવેરીભાઈ ઝવેરીએ સોની-મહાજનોના પ્રશ્નોને વાચા આપતાં કહ્યું હતું કે, એક્સાઇઝથી ફરી ઇન્સ્પેક્ટર રાજ શરૂ થશે, ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે લવાયેલા કાયદાથી ભ્રષ્ટાચાર વધશે અને દરેક તબક્કે હેરાનગતિ વધશે. આ માત્ર સોનીઓનો જ નહીં, પરંતુ સામાન્ય લોકોનો

...અનુસંધાન પાના નં.6

14 કરોડની લાંચની ઓફર હતી : સૈન્ય વડા

realpatidar.com

600 ટ્રક ખરીદવા અંગેની ફાઈલ આગળ વધારવા લાંચની ઓફર થઈ હોવાના જનરલ સિંહના ઘટસ્ફોટથી ગંભીર વિવાદ

સીબીઆઈને સંરક્ષણ મંત્રાલયનો સત્તાવાર પત્ર સોંપાયો

નેશનલ બ્યૂરો. નવીદિલ્હી

સૈન્યના વડા વી કે સિંહ દ્વારા એક પૂર્વ સૈન્ય અધિકારી દ્વારા રૂા. 14 કરોડની લાંચ આપવાની ઓફરના જાહેર ઘટસ્ફોટથી ભારે ખળભળાટ મચી ગયો છે ત્યારે ભારે દિગ્મૂઢ બની ગયેલા સંરક્ષણ મંત્રી એ કે એન્ટનીએ આ મામલાની તપાસ સીબીઆઇને સોંપી દીધી છે.સીબીઆઇને આ બારામાં સંરક્ષણ મંત્રાલયનો સત્તાવાર પત્ર પણ મળી

...અનુસંધાન પાના નં.6

આક્ષેપો શું છે?

સૈન્યના વડાએ એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યુંમાં સૈન્યના જ એક પુર્વ અધિકારી પર એક ખાસ કંપનીના ઉતરતી કક્ષાના વાહનો ખરીદવાનો સનસનાટી પુર્ણ આક્ષેપ કર્યો છે. તેમનું કહેવું છે કે વર્ષ 2010ની આ ઘટના અંગે તેમણે તત્કાલીન સંરક્ષણ મંત્રીને અવગત કર્યા હતા. જેમને આ માહિતી મળ્યા બાદ ભારે આઘાત અનુભવ્યો હતો. આવા લોકોની દુર રાખવાનું કહ્યું હતું. જોકે લાંચની ઓફર કરનાર અધિકારીના નામનો વી કે સિંહે ઇન્ટરવ્યુંમાં ઉલ્લેખ કર્યો નથી. પરંતુ તેમના સંકેતને સૈન્યના ગુપ્તચર વિભાગના એક નિવૃત્ત જનરલ તરફ અંગુલી નિર્દેશ મનાય છે.

નાની બચતોના વ્યાજદરમાં 0.50% સુધી વધારો

- નવા વ્યાજદર પહેલી એપ્રિલથી અમલી
- સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમોનો વ્યાજદર 9 ટકાથી વધારીને 9.3 ટકા

એજન્સી. નવીદિલ્હી

ટપાલ ખાતાની નાની બચત યોજનાઓમાં વ્યાજદરોમાં અડધા ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વ્યાજદર પહેલી એપ્રિલ 2012થી અમલી બનશે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર એક અથવા

...અનુસંધાન પાના નં.6

વ્યાજદરમાં ફેરફાર

યોજના	જૂનો	નવો
એમઆઇએસ	8.2	8.5
પીપીએફ	8.6	8.8
એનએસસી(5 વર્ષ)	8.4	8.6
એસએસસી(10 વર્ષ)	8.7	8.9

ડિપોઝિટ પરનો વ્યાજદર

મુદત	જૂનો	નવો
1 વર્ષ	7.7	8.2
2 વર્ષ	7.8	8.3
3 વર્ષ	8.0	8.4
5 વર્ષ	8.3	8.5

સસ્તી વીજળી ભૂતકાળ બની ગઈ : ડૉ. અબ્દુલા

વીજળી માટે લોકો વધારે કિંમત ચૂકવવા તૈયાર છે : પ્રમોદ દેવ

બિઝનેસ ભાસ્કર. નવીદિલ્હી

ભાસ્કર જૂથ દ્વારા આયોજિત પાવર વિઝન કોન્ક્લેવ 2012નું ઉદ્ઘાટન કરતા ન્યૂ અને રીન્યૂએબલ એનર્જી મંત્રી ડો. ફારુખ અબ્દુલ્લા, તેમની સાથે ભાસ્કર જૂથના ચેરમેન રમેશચંદ્ર અગ્રવાલ, ડીબી કોર્પના ડાયરેક્ટર ગિરીશ અગ્રવાલ, સીઈઆરસીના ચેરમેન પ્રમોદ દેવ તેમજ ભાસ્કર જૂથના મેનેજિંગ એડિટર યતીશ રાજાવત.

Dainik Bhaskar POWER VISION Conclave 2012 Delhi

કેન્દ્રીય ન્યૂ અને રીન્યૂએબલ એનર્જી મંત્રી ડો. ફારુખ અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે સસ્તી વીજળીનો સમય હવે સમાપ્ત થઈ ગયો છે. લોકોને હવે વીજળી માટે વધારે નાણાં ચૂકવવા પડશે કારણ કે તેનું ઉત્પાદન ખર્ચ સતત વધી રહ્યું છે. સોમવારે નવી દિલ્હીમાં ભાસ્કર જૂથ દ્વારા આયોજિત પાવર વિઝન કોન્ક્લેવ-2012માં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ફારુખ અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે દેશમાં વીજળીની ઘણી ઊણપ છે કારણ કે વસ્તીની વૃદ્ધિના પ્રમાણમાં વીજળીના ઉત્પાદનમાં વધારો થઈ શકતો નથી. આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય વિદ્યુત નિયામક પંચ(સીઈઆરસી)ના

...અનુસંધાન પાના નં.6

ઘણા સરકારી ખાતાં મચ્છરોની જેમ લોહી ચૂસે છે : જયસ્વાલ

પ્રણવ મુખરજીને નિશાન બનાવ્યા

પીટીઆઇ. કાનપુર/નવીદિલ્હી

'ઘણા સરકારી વિભાગો મચ્છરોની જેમ લોહી ચૂસે છે' તેમ કહીને કોલસામંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલે વિવાદ વ્હોરી લીધો છે, પણ તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમની આ ટકોર નાણામંત્રાલય તરફ નથી. ઝવેરાત પર ડ્યૂટી વધારાની બજેટ દરખાસ્તને પાછી ખેંચવા માટેની હજારો વેપારીઓની માગણીને ટેકો આપીને જયસ્વાલે કાનપુરમાં એક સમારંભ ખાતે રવિવારે જણાવ્યું હતું

...અનુસંધાન પાના નં.6

મોદીને સમન્સ માટે નાણાવટી પંચને આદેશ કરવા સુપ્રીમની ના

- » સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જનસંઘર્ષ મંચે તેની અરજી પાછી ખેંચી લીધી
- » દરેક તબક્કે પંચની કામગીરીની દેખરેખ ન રાખી શકાય

પીટીઆઇ. નવી દિલ્હી

સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં 2002ના રમખાણોના કેસમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને તેમની કથિત ભૂમિકા અંગે પૂછપરછ માટે સમન્સ પાઠવવા માટે નાણાવટી પંચને આદેશ કરવાનો સોમવારે ઈનકાર કરી દીધો છે. જસ્ટિસ ડી.કે. જૈન અને એ.કે. દવેની બેન્ચે જન સંઘર્ષ મંચ(જેએસએમ) દ્વારા કરવામાં આવેલી અરજી પાછી ખેંચી લેવાની મંજૂરી આપી હતી, જેને પગલે આ એનજીઓએ અરજી પાછી ખેંચી લીધી છે. જેએસએમે ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. બેન્ચે સ્પષ્ટ કહ્યું હતું કે હાઈકોર્ટના આદેશમાં તે હસ્તક્ષેપ કરશે નહીં. બેન્ચે કહ્યું કે પંચની કામગીરીની તે દેખરેખ ન રાખી શકે અને તે જ્યારે-જ્યારે કોઈ આદેશ પસાર કરે ત્યારે દરેક તબક્કે તે હસ્તક્ષેપ ન કરી શકે. નાણાવટી પંચ છેલ્લાં 10 વર્ષથી ગોધરાકાંડ અને ત્યાર પછીનાં રમખાણોના કેસની તપાસ કરી રહ્યું છે. 2004માં પંચની કામગીરીનો વ્યાપ લંબાવાઈ હતી.



GANDHIDHAM - Pioneer Honda: 9687622338; AHMEDABAD - Landmark Honda: 9327097000; Emerald Honda: Polytechnic: 9714501028; Off Ashram Road: 9714501029; ANAND - Destination Honda: 9099656565; GANDHINAGAR - Emerald Honda: 9714501010; MEHSANA - Landmark Honda: 9825232213; RAJKOT - Landmark Honda: 9377114000; SURAT - Landmark Honda: 9376113000; Dream Honda: 9662526202; VADODARA - Aspen Honda: 9727784924, 9099101000; VAPI - Dream Honda: 9909991284.

Digitially Archived by: www.realpatidar.com/library

Real Patidar Library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format
For Reference See Pages: 1, 11.

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2025.05.05 18:36:37 +05'30'
Real Patidar Unravel Truth

See Page 11

સુવિચાર

શિક્ષક પ્રથમ પૂજ્ય છે અને મહાન વ્યક્તિઓમાં અગ્રણી છે, કેમકે તે વિદ્યાર્થીનું નહીં, માનવતા અને તેમાં સમાયેલા હિત અને ઉન્નતિનું નિર્માણ કરે છે.

-પંડિત મદનમોહન માલવિય

realpatidar.com

કુલ પાના 14 +12 (મધુરિમા)=26 । કિંમત ₹ 2.50

દિવ્ય ભાસ્કર

ભારતનું સૌથી ઝડપી વિકસતું અખબાર

સેન્સેક્સ		17,052.78
પાછલો 17361.74		તફાવત -308.96
નિફ્ટી		5184.25
પાછલો 5278.20		તફાવત -93.95
સોનુ		---
પાછલો ---		તફાવત ---
ચાંદી		---
પાછલો ---		તફાવત ---
ડોલર		51.27
પાછલો 51.17		તફાવત -0.10

divyabhaskar.com મંગળવાર ભુજ । 27 માર્ચ, 2012 ચૈત્ર સુદ -5, વિક્રમ સંવત : 2067

આજનું મેગેઝિન **મધુરિમા** નજર ન લાગે સુંદરતાને

ન્યૂઝ ઇનબોક્સ

મરાઠી કવિ ગ્રેસનું નિધન

પુણે: મરાઠી કાવ્ય જગતમાં છેલ્લા 45 વર્ષથી આધિપત્ય ભોગવનારા પીઢ કવિ અને લલિત લેખોના ઉસ્તાદ ગણાતા કવિ ગ્રેસ ઉર્ફે માણિક ગોડઘાટેનું પૂણેની દિનાનાથ મંગેશકર હોસ્પિટલમાં 75 વર્ષની વયે નિધન થયું હતું. ગત માસે જ તેમને પ્રતિષ્ઠિત સાહિત્ય અકાદમી એવોર્ડ આપવામાં આવ્યો હતો.

શહીદોનું બાંગ્લાદેશમાં સમ્માન

નવી દિલ્હી: બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામમાં પ્રાણ ન્યોછાવર કરનારા 1400 ભારતીય સૈનિકોનું મંગળવારે બાંગ્લાદેશ સમ્માન કરશે. નવ માસ ચાલેલા 1971ના બાંગ્લાદેશની આઝાદીના જંગમાં ભારતીય યોગદાનને લીધે તેને વધુ ઔપચારિક માન્યતા આપવામાં આવી છે.

સીઆરપીએફ જવાન શહીદ

રાયપૂર: છત્તીસગઢના સુકમા જિલ્લામાં માઓવાદીઓ સાથેની અથડામણમાં સીઆરપીએફનો એક જવાન શહીદ થઇ જવા પામ્યો હતો, જ્યારે અન્ય જવાનને ઇજા થવા પામી હતી.સુરક્ષા પેટ્રોલિંગ માટે નીકળેલી ટીમ સાથે અલ્પલ મિત્તા નીકળ્યો હતો અને માઓવાદીઓએ જવાનોને નિશાન બનાવ્યા હતા.

જાપાનમાં બોટ ડૂબી: 12 લાપતા

ટોક્યો : જાપાનમાં 12 ઇન્ડોનેશિયન ક્રુ મેમ્બર્સને લઇને જઇ રહેલી નાવ ડૂબી જતાં તમામ મુસાફરો લાપતા બની ગયા છે. દુર્ઘટનાનો સંદેશ મળતાં જ કોસ્ટગાર્ડની ટીમ ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવા દોડી ગઇ છે.

અમદાવાદ બ્લાસ્ટના આરોપી જબ્બે

મુંબઇ : ઔરંગાબાદમાં સોમવારે ધોળેદહાડે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને શંકાસ્પદ આતંકવાદીઓ વચ્ચે થયેલી ઝપાઝપીમાં એક ઠાર થયો હતો, જ્યારે અમદાવાદ સિરિયલ ધડાકાના આરોપી સહિત બે જણની શસ્ત્રો સાથે ધરપકડ કરવામાં આવી છે. રાકેશ મારિયાએ આપેલી માહિતી અનુસાર ઔરંગાબાદમાં હિમાયત બાગ વિસ્તારમાં ઉદ્ધવરાવ પાટીલચોક સોમવારે બપોરે 12.30 વાગ્યાના સુમારે થયેલી ઝપાઝપીમાં ખલીલ કુરેશી ઠાર થયો હતો.

સ્વીસ બેંકમાં 180 કરોડ ભરાયા

નવી દિલ્હી : પ્રણવ મુખરજીએ સંસદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સ્વીસ બેન્કમાં ખાતાં ધરાવનારા કેટલાક લોકોએ રૂપિયા 180 કરોડ સુધીનો વેરો ભર્યો છે. જોકે તેમણે આવી વ્યક્તિઓનાં નામ નહોતા આપ્યા. મુખરજીએ જણાવ્યું હતું કે ડબલ ટેક્સેશન એવોઇડન્સ કન્વેન્શન હેઠળ સરકારને ફ્રાન્સ-જર્મની તરફથી માહિતી પ્રાપ્ત થઇ છે.

દિવ્ય ભાસ્કર દ્વારા સોની-મહાજનોની હડતાળ મુદ્દે ટોક શો યોજાયો હતો. અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલા ભાસ્કર હાઉસ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં 1500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

છેવટ સુધી લડાઇનો ટંકાર

અમદાવાદ: સોનાના દાગીનાની બનાવટ પર એક્સાઇઝ, બે લાખની વધુ રોકડ ખરીદી પર ટીડીએસ સહિતની બજેટમાં કરાયેલી જોગવાઈ સામે આંદોલન પર ઉતરેલા સોની-મહાજનોએ જ્યાં સુધી એક્સાઇઝનો કાયદો દૂર નહીં થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો ટંકાર કર્યો છે. 'દિવ્ય ભાસ્કર' દ્વારા આયોજિત ટોક શોમાં રાજ્યભરના અગ્રણી જ્વેલર્સ એસોસિએશન તથા કારીગર સંગઠનોના 1500થી વધુ હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને છેક સુધી લડી લેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ હડતાળથી અત્યાર સુધીમાં ગુજરાતમાં 16 હજાર કરોડનું ટર્નઓવર ઠપ થઈ ગયું હોવાનું પણ કહેવાયું હતું. એસ.જી. હાઇવે પર આવેલા ભાસ્કર હાઉસ ખાતે યોજાયેલા સોની મહાજનોની પ્રચંડ હાજરીવાળા ટોક શોમાં અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ ઝવેરીભાઈ ઝવેરીએ સોની-મહાજનોના પ્રશ્નોને વાચા આપતાં કહ્યું હતું કે, એક્સાઇઝથી ફરી ઇન્સ્પેક્ટર રાજ શરૂ થશે, ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે લવાયેલા કાયદાથી ભ્રષ્ટાચાર વધશે અને દરેક તબક્કે હેરાનગતિ વધશે. આ માત્ર સોનીઓનો જ નહીં, પરંતુ સામાન્ય લોકોનો

...અનુસંધાન પાનાનં.6

14 કરોડની લાંચની ઓફર હતી : સૈન્ય વડા

realpatidar.com

600 ટ્રક ખરીદવા અંગેની ફાઈલ આગળ વધારવા લાંચની ઓફર થઈ હોવાના જનરલ સિંહના ઘટસ્ફોટથી ગંભીર વિવાદ

સીબીઆઇને સંરક્ષણ મંત્રાલયનો સત્તાવાર પત્ર સોંપાયો

નેશનલ બ્યૂરો. નવીદિલ્હી

સૈન્યના વડા વી કે સિંહ દ્વારા એક પૂર્વ સૈન્ય અધિકારી દ્વારા રૂા. 14 કરોડની લાંચ આપવાની ઓફરના જાહેર ઘટસ્ફોટથી ભારે ખળભળાટ મચી ગયો છે ત્યારે ભારે દિગ્મૂઢ બની ગયેલા સંરક્ષણ મંત્રી એ કે એન્ટનીએ આ મામલાની તપાસ સીબીઆઇને સોંપી દીધી છે.સીબીઆઇને આ બારામાં સંરક્ષણ મંત્રાલયનો સત્તાવાર પત્ર પણ મળી

...અનુસંધાન પાના નં.6

આક્ષેપો શું છે?

સૈન્યના વડાએ એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં સૈન્યના જ એક પુર્વ અધિકારી પર એક ખાસ કંપનીના ઉતરતી કક્ષાના વાહનો ખરીદવાનો સનસનાટી પુર્ણ આક્ષેપ કર્યો છે. તેમનું કહેવું છે કે વર્ષ 2010ની આ ઘટના અંગે તેમણે તત્કાલીન સંરક્ષણ મંત્રીને અવગત કર્યા હતા. જેમને આ માહિતી મળ્યા બાદ ભારે આઘાત અનુભવ્યો હતો. આવા લોકોની દુર રાખવાનું કહ્યું હતું. જોકે લાંચની ઓફર કરનાર અધિકારીના નામનો વી કે સિંહે ઇન્ટરવ્યૂમાં ઉલ્લેખ કર્યો નથી. પરંતુ તેમના સંકેતને સૈન્યના ગુપ્તચર વિભાગના એક નિવૃત્ત જનરલ તરફ અંગુલી નિર્દેશ મનાય છે.

નાની બચતોના વ્યાજદરમાં 0.50% સુધી વધારો

- નવા વ્યાજદર પહેલી એપ્રિલથી અમલી
- સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમોનો વ્યાજદર 9 ટકાથી વધારીને 9.3 ટકા

એજન્સી. નવીદિલ્હી

ટપાલ ખાતાની નાની બચત યોજનાઓમાં વ્યાજદરોમાં અડધા ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વ્યાજદર પહેલી એપ્રિલ 2012થી અમલી બનશે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર એક અથવા

...અનુસંધાન પાનાનં.6

વ્યાજદરમાં ફેરફાર

યોજના	જૂનો	નવો
એમઆઇએસ	8.2	8.5
પીપીએફ	8.6	8.8
એનએસસી(5 વર્ષ)	8.4	8.6
એસએસસી(10 વર્ષ)	8.7	8.9

ડિપોઝિટ પરનો વ્યાજદર

મુદત	જૂનો	નવો
1 વર્ષ	7.7	8.2
2 વર્ષ	7.8	8.3
3 વર્ષ	8.0	8.4
5 વર્ષ	8.3	8.5

સસ્તી વીજળી ભૂતકાળ બની ગઈ : ડૉ. અબ્દુલા

ભાસ્કર જૂથ દ્વારા આયોજિત પાવર વિઝન કોન્ક્લેવ 2012નું ઉદ્ઘાટન કરતા ન્યૂ અને રીન્યૂએબલ એનર્જી મંત્રી ડો. ફારુખ અબ્દુલ્લા, તેમની સાથે ભાસ્કર જૂથના ચેરમેન રમેશચંદ્ર અગ્રવાલ, ડીબી કોર્પના ડાયરેક્ટર ગિરીશ અગ્રવાલ, સીઈઆરસીના ચેરમેન પ્રમોદ દેવ તેમજ ભાસ્કર જૂથના મેનેજિંગ એડિટર યતીશ રાજાવત.

વીજળી માટે લોકો વધારે કિંમત ચૂકવવા તૈયાર છે : પ્રમોદ દેવ

બિઝનેસ ભાસ્કર. નવી દિલ્હી

Dainik Bhaskar POWER VISION Conclave 2012 Delhi

કેન્દ્રીય ન્યૂ અને રીન્યૂએબલ એનર્જી મંત્રી ડો. ફારુખ અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે સસ્તી વીજળીનો સમય હવે સમાપ્ત થઈ ગયો છે. લોકોને હવે વીજળી માટે વધારે નાણાં ચૂકવવા પડશે કારણ કે તેનું ઉત્પાદન ખર્ચ સતત વધી રહ્યું છે. સોમવારે નવી દિલ્હીમાં ભાસ્કર જૂથ દ્વારા આયોજિત પાવર વિઝન કોન્ક્લેવ-2012માં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ફારુખ અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે દેશમાં વીજળીની ઘણી ઊણપ છે કારણ કે વસ્તીની વૃદ્ધિના પ્રમાણમાં વીજળીના ઉત્પાદનમાં વધારો થઈ શકતો નથી. આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય વિદ્યુત નિયામક પંચ(સીઈઆરસી)ના

...અનુસંધાન પાનાનં.6

ઘણા સરકારી ખાતાં મચ્છરોની જેમ લોહી ચૂસે છે : જયસ્વાલ

પ્રણવ મુખરજીને નિશાન બનાવ્યા

પીટીઆઇ. કાનપુર/નવીદિલ્હી

'ઘણા સરકારી વિભાગો મચ્છરોની જેમ લોહી ચૂસે છે' તેમ કહીને કોલસામંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલે વિવાદ વ્હોરી લીધો છે, પણ તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમની આ ટકોર નાણામંત્રાલય તરફ નથી. ઝવેરાત પર ડ્યૂટી વધારાની બજેટ દરખાસ્તને પાછી ખેંચવા માટેની હજારો વેપારીઓની માગણીને ટેકો આપીને જયસ્વાલે કાનપુરમાં એક સમારંભ ખાતે રવિવારે જણાવ્યું હતું

...અનુસંધાન પાનાનં.6

મોદીને સમન્સ માટે નાણાવટી પંચને આદેશ કરવા સુપ્રીમની ના

- » સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જનસંઘર્ષ મંચે તેની અરજી પાછી ખેંચી લીધી
- » દરેક તબક્કે પંચની કામગીરીની દેખરેખ ન રાખી શકાય

પીટીઆઇ. નવી દિલ્હી

સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં 2002ના રમખાણોના કેસમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને તેમની કથિત ભૂમિકા અંગે પૂછપરછ માટે સમન્સ પાઠવવા માટે નાણાવટી પંચને આદેશ કરવાનો સોમવારે ઈનકાર કરી દીધો છે. જસ્ટિસ ડી.કે. જૈન અને એ.કે. દવેની બેન્ચે જન સંઘર્ષ મંચ(જેએસએમ) દ્વારા કરવામાં આવેલી અરજી પાછી ખેંચી લેવાની મંજૂરી આપી હતી, જેને પગલે આ એનજીઓએ અરજી પાછી ખેંચી લીધી છે. જેએસએમે ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. બેન્ચે સ્પષ્ટ કહ્યું હતું કે હાઈકોર્ટના આદેશમાં તે હસ્તક્ષેપ કરશે નહીં. બેન્ચે કહ્યું કે પંચની કામગીરીની તે દેખરેખ ન રાખી શકે અને તે જ્યારે-જ્યારે કોઈ આદેશ પસાર કરે ત્યારે દરેક તબક્કે તે હસ્તક્ષેપ ન કરી શકે. નાણાવટી પંચ છેલ્લાં 10 વર્ષથી ગોધરાકાંડ અને ત્યાર પછીનાં રમખાણોના કેસની તપાસ કરી રહ્યું છે. 2004માં પંચની કામગીરીનો વ્યાપ લંબાવાઈ હતી.



GANDHIDHAM - Pioneer Honda: 9687622338; AHMEDABAD - Landmark Honda: 9327097000; Emerald Honda: Polytechnic: 9714501028; Off Ashram Road: 9714501029; ANAND - Destination Honda: 9099656565; GANDHINAGAR - Emerald Honda: 9714501010; MEHSANA - Landmark Honda: 9825232213; RAJKOT - Landmark Honda: 9377114000; SURAT - Landmark Honda: 9376113000; Dream Honda: 9662526202; VADODARA - Aspen Honda: 9727784924, 9099101000; VAPI - Dream Honda: 9909991284.

વર્ષ 5 • અંક 263 • કચ્છ | ભાસ્કર જૂથ 13 રાજ્ય • 64 આવૃત્તિ | દિવ્ય ભાસ્કર ગુજરાત • મહારાષ્ટ્ર | दैनिक भास्कर મધ્યપ્રદેશ • છત્તીસગઢ • રાજસ્થાન • હરિયાણા • નવી દિલ્હી • ચંદીગઢ • પંજાબ • હિમાચલપ્રદેશ • ઉત્તરાખંડ • ઝારખંડ • જમ્મુ-કાશ્મીર । दिव्य मराठी મહારાષ્ટ્ર | DNA મુંબઇ • બેંગલુરુ • પુણે • જયપુર • ઇંદોર | 94.3 MY FM 7 રાજ્ય • 17 સ્ટેશન

Digitially Archived by: www.realpatidar.com/library

2012-03-27 -Divya Bhaskar -Bidada -Satpanth Samaj Protest [421]

દિવ્ય ભાસ્કર ભુજ : જાહેરખબર વિભાગ : ફોન. 02832-308223, ફેક્સ. 02832-255181, સમાચાર વિભાગ : ફોન. 02832-308238, ફેક્સ. 02832-255180, સરક્યુલેશન વિભાગ : 02832-308222 । ગાંધીધામ : ફોન 02836-226688, ફેક્સ. 02836-230300

કચ્છમાં સુવર્ણકારોનો રોષ જારી : ધરણા-રેલી દ્વારા વિરોધ



ગાંધીધામમાં બાઇકરેલી, ભુજ, અંજાર, મુન્દ્રામાં ધરણા યોજાયાં હતાં. **પ્રકાશ ભટ્ટ, મનોજ રાઠોડ, રાહુલ દાવડા, ભાવેશ ગોર**

માંડવીના બંગાળી કારીગરોએ મમતા બેનરજીને પત્ર લખ્યા : વેપારી મંડળોનો ટેકો

ભાસ્કર નેટવર્ક ભુજ

કેન્દ્રના બજેટમાં લદાયેલા ટેક્સના મામલે છેલ્લા સપ્તાહ કરતાં વધુ સમયથી ચાલતી હડતાળ અંતર્ગત આજે ભુજ અને ગાંધીધામ સહિત જુદા જુદા શહેરમાં ધરણા અને રેલીના કાર્યક્રમ સાથે વિરોધ નોંધાવાયો હતો.

ભુજના જ્વેલર્સ દ્વારા વિરોધ માટે ખાસ સમિતિ રચવામાં આવી છે, ત્યારે સોમવારે કંસારા બજારમાં સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી પ્રતીક ઉપવાસ અને ધરણા યોજાયા હતા. સમિતિના કન્વીનર જગદીશ ઝવેરીએ આ અંગે કહ્યું હતું કે, 20 સોનીભાઇ પ્રતિક ઉપવાસમાં જોડાયા હતા. દિલીપભાઇ તથા પ્રદીપભાઇ, ચંદુભાઇ, અશોકભાઇ વગેરે સભ્યોના માર્ગદર્શન સાથે 150 જેટલા સુવર્ણકાર ધરણામાં જોડાયા હતા. દરમિયાન કચ્છ ચેમ્બરના પ્રમુખ રાજેશ ભટ્ટ અને મંત્રી અશોક વોરાએ હડતાળને ટેકો જાહેર કરી સહકાર આપવા ખાતરી આપી હતી. પૂર્વ ધારાસભ્ય મુકેશ ઝવેરીએ છાવણીની મુલાકાત લીધી હતી.

અંજાર બુલિયન મરચન્ટ એસોસિયેશન દ્વારા આજે આવેદનપત્ર તથા ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. હરિભાઇ સોની, ફોરમ સોની, દિલીપ સોની, કિશોર ઠક્કર, મનસુખભાઇ સોની જોડાયા હતા. માંડવી બુલિયન એસોસિયેસન દ્વારા આઝાદ ચોકમાં પ્રમુખ દિનેશ સોનીના અધ્યક્ષસ્થાને યોજાયેલાં ધરણામાં 100 દુકાનદાર અને 200 જેટલા કારીગર જોડાયા હતા. શહેરના અન્ય વેપારી મંડળોએ ટેકો જાહેર કર્યો હતો. અગ્રણીઓ એવા પૂર્વ સાંસદ અનંતભાઇ દવે, ચેમ્બરના વાડીલાલ દોશી, જયકુમાર સંઘવી, ડો. મલ્લી, દિલીપ જૈન, વસંત દોશી, શૈલેશ મડૈયાર, મહેશ સોની, ભરત ડગાળાવાલા વગેરેએ છાવણીની મુલાકાત લીધી હતી. બંગાળી કારીગરોએ મમતા બેનરજીને પત્ર લખ્યા હોવાનું જણાવાયું હતું. બુલિયન એસોસિયેશનના સુનીલ શાહ, શૈલેશ મામતોરા, જયેશ શાહ, નરેન સોની વગેરેએ જહેમત ઉઠાવી હતી. ભચાઉમાં સોના-ચાંદીના તમામ વેપારીઓએ ધરણા યોજ્યાં હતાં. પ્રમુખ વિશનજી સોની અને સહમંત્રી પ્રફુલ્લભાઇએ માર્ગદર્શન આપ્યું હતું.

ગાંધીધામમાં યોજાઇ બાઇકરેલી

ગાંધીધામમાં સાંજે બાઇકરેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાપારી એસોના પ્રમુખ રાજુ ચંદનાની, રમેશ પરમાર, ગાંધીધામ ગ્રેઇન સીડ્ઝ મર્ચન્ટ એસોના પ્રમુખ જગદીશ ઠક્કર, ટ્રસ્ટી પવન કેલા, ક્લોથ મરચન્ટ એસો.ના ભગવાનદાસ નાનકાની, રેડિમેઇડ ક્લોથ મરચન્ટ એસો.ના પ્રમુખ ગોરધન ધવન, મેટલ મરચન્ટ એસો.ના પ્રમુખ દિનેશ ગોયલ વગેરેએ લડતને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો

આજે ભુજમાં હવન, કેન્ડલ પ્રોસેશન

પ્રણવ મુખરજીને સદબુદ્ધિ આવે તે માટે ભુજ બુલિયન મરચન્ટ એસોસિયેશન દ્વારા સવારે 10:30 વાગ્યે ગાયત્રી હવન તથા એક્સાઇઝના કાયદાને શ્રદ્ધાંજલિ આપવા માટે સાંજે સાત વાગ્યે કેન્ડલ લાઇટ રેલી યોજાશે, જે કંસારા બજાર, શરાફ બજાર, બસ સ્ટેશન, વિસ્તારમાં ફરશે.

દિવ્ય ભાસ્કર
Happy Birthday
મારા ભાસ્કરમાં મારી છબી

માહી ત્રિવેદી - ભુજ
માતાઃ નૂતનબેન
પિતાઃ વિવેકભાઇ

સ્નેહ રાઠોડ - ભુજ
માતાઃ નમ્રતાબેન
પિતાઃ જયેશભાઇ

દૃષ્ટિ હિરાણી - આદિપુર
માતાઃ નિલાબેન
પિતાઃ જયરામભાઇ

નીલ નાનકાની -ગાંધીધામ
માતાઃ આંચલબેન
પિતાઃ પ્રકાશભાઇ

હેપ્પી બર્થ ડે
ફોટોગ્રાફ ફક્ત રૂા. ૧૦૦/-
★ ૧૦ વર્ષથી નીચેની ઉંમરના બાળકોના જ ફોટા પ્રસિદ્ધ કરવામાં આવશે. ★ બાળકનો પાસપોર્ટ સાઇઝનો કલર ફોટોગ્રાફ (પરત મળશે નહીં), જન્મ તારીખના દાખલાની નકલ સાથે મોકલવાનો રહેશે. ★ આ કોલમમાં ફેરફાર કરવાના તમામ હક્ક દિવ્ય ભાસ્કરને આધિન રહેશે. ભુજ : સ્વામિનારાયણ સંકુલ, હોસ્પિટલ રોડ. ગાંધીધામ : સ્ક્વેર એપાર્ટમેન્ટ, એલ.આઇ.સી.બિલ્ડીંગની બાજુમાં, ખાતે સવારે ૧૦ થી ૬, દરરોજ સ્વીકારવામાં આવશે.

ભુજમાં એકાએક આંકડાનો જુગાર ગેરકાયદે બની ગયો : 3 સ્થળે દરોડા

₹ 6300 સાથે ત્રણ બુકી ઝડપાયા

ભાસ્કર ન્યૂઝ. ભુજ

ભુજમાં ઠેકઠેકાણે લાંબા સમયથી દિવસ રાત કાયદાની રીતે કોઇ ગુનો ન હોય એ પ્રમાણે ચાલતો આંકડાનો જુગાર જાણે એકાએક ગેરકાયદે બની ગયો હોય એમ પોલીસે ત્રણ સ્થળે દરોડા પાડ્યા હતા. અત્યાર સુધી આંખ આડા કાન કરીને બેઠેલી પોલીસે સોમવારે સાંજે પાડેલા આ દરોડામાં ત્રણ બુકીને રૂ.6300ની રોકડ સાથે ઝાલી લેવાયા હતા.

ભુજ સિટી પોલીસમાં નોંધાયેલી વિગતો પ્રમાણે તા. 26 માર્ચે સાંજે 7 વાગ્યા દરમિયાન સૌ પહેલાં સરપટ નાકા પાસેના બગીચા પાસે દરોડો પડ્યો હતો. જેમાં અનવર અબ્દુલ્લા આરબને રૂ.2250 સાથે ઝાલી લેવાયો હતો. ત્યાર બાદ ભીડ નાકા નજીકના મેમણ જમાત ખાના પાસેની કેબિન પર દરોડો પડ્યો જ્યાંથી ઇમરાન અબ્દુલ્લા સમેજા નામના શખ્સને 2550ની રોકડ સાથે પકડવામાં આવ્યો હતો. તો આભા હોટલની પાછળની ગલીમાં આંકડાનો ધંધો ચલાવતો મુસ્તાક હુસૈન ખત્રી 1500 સાથે ઝલાયો હતો. હજી હમણા જ સિટી પોલીસમાં બદલી પામેલા ઇન્સ્પેક્ટર વી. એમ. ગોહિલની સૂચનાથી સ્ટાફ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ધરપકડ થયાના ગણતરીના સમયમાં જ આરોપીઓ જામીન પર મુક્ત થયા હતા !

આ કેબિન તો જાહેરમાં જ ખુલ્લી હતી

ભીડ નાકા નજીકના મેમણ જમાતખાના પાસે જે કેબિન પર દરોડો પડ્યો ત્યાં તો રાહદારીઓ પણ સરળતાપૂર્વક નિહાળી શકે એ રીતે આંકડાનો જૂગારી લેવાતો અને પાટી પર શેરડીના રસના ગ્લાસનો ભાવ લખાય એમ ભાવ પણ લખાતા હતા.

સૌથી વધુ પરિણામ મેળવતી ગુજરાતની નં.1 એકેડમી
માધ્યમિક શિક્ષક યોગ્યતા કસોટી TAT | નવી બેચ 29 માર્ચથી | નાયબ મામલતદાર & Dy.SO મુખ્ય પરીક્ષા GPSC
100% સફળતા માટે જરૂરી છે અનુભવી ફેકલ્ટીઝ વિસ્તૃત સ્ટડી મટીરીયલ રેગ્યુલર ટેસ્ટીંગ
પ્રશ્નપત્ર-1ની તૈયારી માટે | ગુજરાતી + અંગ્રેજી + જનરલ સ્ટડીઝ પરીક્ષા વર્ણાત્મક છે, શબ્દોની મર્યાદા માટે વિષય નિષ્ણાત ફેકલ્ટી દ્વારા જ માર્ગદર્શન મેળવો.
લિબર્ટી કેરિઅર એકેડમી 2nd Flr, સિદ્ધનાથ કોમ્પ્લેક્સ, જીવનજ્યોત સ્કૂલની સામે, યુનિવર્સિટી રોડ, રાજકોટ 2570261/9727752016 અમદાવાદ 26560456

સૂરજબારી ચેકપોસ્ટ પાસેના અકસ્માતમાં પાંચ ઘવાયા

realpatidar.com

ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ

સૂરજબારી ચેકપોસ્ટ પર રાખવામાં આવેલા પિલ્લરમાં સોમવારે એક ટ્રક અથડાતાં ટ્રકમાં સવાર ત્રણ મુસાફરની સાથે એક પોલીસ કર્મચારી સહિત કુલ પાંચ લોકોને ઇજા પહોંચી હતી.

આ અંગે સામખિયાળી પોલીસે જણાવ્યું હતુ કે, સૂરજબારી ચેકપોસ્ટ પાસે રાખવામાં આવેલા પિલ્લર પર સોમવારે જીજે 1 સીયુ 1418 નંબરની ટ્રક ચડી ગઇ હતી. જેના પગલે ટ્રકમાં સવાર મહોમ્મદ અનવર મકબુલ પઠાણ, ચેકપોસ્ટની પાસે ઊભેલા જીવાભાઇ નામના પોલીસ કર્મચારી સહિત કુલ પાંચ લોકોને ઇજા પહોંચી હતી. ઘવાયેલા મહોમ્મદભાઇ અમદાવાદથી મોટી ચીરઇ ખાતે મોટાપીરના મેળામાં આવી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

કાસેઝની કંપનીમાં મશીનમાં આવી જવાથી કામદારનું મોત

માંડવીમાં મસ્જિદ સામેથી અજાણ્યા યુવાનની લાશ મળી

ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ, ભુજ

કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી એક કંપનીમાં રવિવારે બપોરના ભાગે કામ કરતી વખતે મશીનમાં આવી જવાથી ગંભીર રીતે ઘવાયેલા મૂળ ઉત્તર પ્રદેશના કામદારનું સોમવારે સવારના ભાગે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, જ્યારે માંડવી ગામમાં મસ્જિદની સામે જ એક અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ આગળ ધપાવી હતી.

આ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે, કાસેઝની અંદર આવેલી કચ્છ પોલીમર નામની કંપનીમાં રવિવારે બપોરે 2:30 વાગ્યાના અરસામાં મૂળ યુપીનો અને હાલે ગાંધીધામના ગણેશનગર વિસ્તારમાં રહેતો 29 વર્ષીય યુવાન વિનયકુમાર સૂરજપાલ આરખ મશીનમાં આવી જવાથી શહેરની એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં સોમવારે સવારે તેનું મૃત્યુ થઇ ગયું હતું. જ્યારે માંડવીના સલાયા વિસ્તારમાં આવેલી ફારૂક મસ્જિદની સામે તા. 26 માર્ચે સાંજે 5 વાગ્યા પહેલાં મૃત્યુ પામી ગયેલા એક યુવાનની લાશ મળી આવી હતી. ધાર્મિક રીતે હિન્દુ અને 30થી 35 વર્ષની વય ધરાવતો આ યુવાન એ વિસ્તારમાં ભિક્ષા માગીને પેટ ભરતો હોવાનું સ્થાનિક લોકો પાસેથી પોલીસને જાણવા મળ્યું હતું.

12 વર્ષમાં 37 હજાર કરોડની સહાય મળી હોવાની સરકારની કબૂલાત

અબજોની સહાય મળે છે, તોય મોદી શા માટે બૂમો પાડે છે ?

કચ્છ લડાયક મંચે માહિતી અધિકાર હેઠળ માગેલી વિગતોમાં થયેલો સ્ફોટક ખુલાસો

ભાસ્કર ન્યૂઝ. ભુજ

12 વર્ષના ગાળામાં કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને 36 હજાર કરોડથી પણ વધુ સહાય મળી હોવા છતાં પોતાની વાહ વાહ અને તાળીઓના ગડગડાટ સાંભળવા ટેવાયેલા રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વારંવાર બૂમો શેની પાડે છે ? તેવો વેધક પ્રશ્ન કચ્છ લડાયક મંચે પૂછયો છે. મુખ્યમંત્રી મોદી દ્વારા વારંવાર તેમના ભાષણોમાં કેન્દ્ર સરકાર ઉપર ગંભીર સ્વરૂપની ધમકીઓ આપતા હોવાથી કેન્દ્ર ખરેખર ગુજરાત પ્રત્યે સાવકું વલણ દાખવે છે કે કેમ તે જાણવા માટે કચ્છ લડાયક મંચે માહિતી અધિકાર હેઠળ એવી વિગતો માગી કે, કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને કેટલી સહાય કરવામાં આવી છે? આશ્ચર્યજનક રીતે રાજ્યના નાણા વિભાગે મુખ્યમંત્રી મોદીના નિવેદનોથી તદ્દન વિરુદ્ધ એવો પ્રત્યુત્તર આપ્યો કે, નાણાકીય વર્ષ 1999-2000થી તા. 31/12/2011 સુધી એટલે કે, 12 વર્ષના ગાળા દરમિયાન કેન્દ્રની સરકારે જુદી જુદી યોજનાઓ હેઠળ ગુજરાત રાજ્યને કુલ રૂ. 36459.08 કરોડ એટલે કે, 37 હજાર કરોડ રૂપિયાની સહાય કરેલી છે. રૂપિયા લઇ લીધા પછી રાજ્ય સરકારે તેને ક્યાં વાપર્યા તેનો જવાબ ખુદ નાણાં વિભાગ પાસે નથી, તેવો જવાબ તેના સચિવે આરટીઆઇ હેઠળ આપ્યો છે. માત્રને માત્ર કેન્દ્ર સરકારને બદનામ કરી ગુજરાતના ભોળા લોકોની સહાનુભૂતિ મેળવવા માટે મુખ્યમંત્રી મોદીભાઇ વારંવાર કેન્દ્ર ઉપર આક્ષેપ કરે છે એમ કચ્છ લડાયક મંચના પ્રમુખ રમેશ જોષીએ તેમની અખબારી યાદીમાં જણાવ્યું છે.

વિધાનસભાની આગામી ચૂંટણીમાં પણ માણસાવાળી કરો

કેન્દ્ર દ્વારા કોઇપણ જાતનો અન્યાય ન થયો હોવા છતાં માત્ર પોતાની વાહ વાહ માટે જાહેરમાં કેન્દ્ર સરકારને ભાંડનારા મુખ્યંત્રી નરેન્દ્રભાઇ મોદીએ લાખો ગાયોની અનેક એકર ગૌચર જમીન તથા ભૂમિહિનોની હજારો એકર સરકારી પડતર જમીન તેમના માનીતા ઉદ્યોગપતિઓને પાણીના ભાવે વેચી દઇ ગુજરાતની છ કરોડ ભોળી પ્રજા અબોલ પશુઓ સાથે માત્ર અન્યાય નહી, પરંતુ સાથે સાથે તેમણે અધર્મ પણ કર્યો છે આથી જેમ વિધાનસભાની પેટા ચૂંટણીમાં માણસાના મતદારોએ જે રીતે માણસાઇ દેખાડી છે તેવી જ રીતે વિધાનસભા માટેની આગામી ચૂંટણી દરમિયાન પણ રાજ્યના મતદારો ભાજપ અને નરેન્દ્ર મોદીને માણસાઇ બતાવી દે તેવી અપીલ કચ્છ લડાયક મંચના પ્રમુખ રમેશ જોષીએ કરી છે.

સૂરજબારી ટોલગેટના સિક્યોરિટી કર્મચારીઓની દાદાગીરી બંધ કરો

હાજીપીર જતા યાત્રિકો પર હુમલો કરનારા આરોપીઓને તાત્કાલિક પકડવા માટે ભચાઉ મામલતદારને આવેદનપત્ર પાઠવાયું

ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ

બે દિવસ અગાઉ સૂરજબારી ટોલગેટ પર હાજીપીર જતા યાત્રિકો પર ટોલગેટના સિક્યોરિટી કર્મચારીઓએ કરેલા હુમલા બાદ આ ઘટનાને કડક શબ્દોમાં વખોડી ભચાઉ તાલુકાના મુસ્લિમ આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં ટોલગેટના સિક્યોરિટી કર્મચારીઓની દાદાગીરી બંધ કરાવવા તથા આરોપીઓને તાત્કાલિક પકડવાની માંગ કરાઇ હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ટોલગેટના સંચાલકો ગુંડા જેવું વર્તન કરે છે. તેઓ પર આધોઇ પોલીસ મથકે અનેક ફરિયાદો પણ નોંધાય છે તેમ છતાં તેઓ પર કોઇ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે હાલમાં જે પાર્ટીને કોન્ટ્રાક્ટ અપાયો છે તે પાર્ટીનો કોન્ટ્રાક્ટ રદ્દ કરવામાં આવે. બીજી બાજુ આ મારામારીમાં જે કર્મચારીઓ સંડોવાયેલા છે તેઓની પણ તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે.

ભાસ્કર classified

TOP SPOT
SOFTEL GREAT KITCHEN CONCEPTS
નવીનત્તમ યુરોપીયન સ્ટાઇલ સોડા મેકર સ્વચ્છ-સુરક્ષિત-સરળ

સોડા મેકર
સોફ્ટલની અન્ય પ્રોડક્ટસ જેવી કે આઇસ્ક્રીમ મેકર, ટોસ્ટર, ઇન્ડક્શન સ્ટવ, સેન્ડવીચ મેકર મસાલા ગ્રાઇન્ડર, મીક્ષર ગ્રાઇન્ડર, ઘરઘંટી વિ. ઉપર પણ ભારે છૂટ
પૂર્વ કચ્છના ડિલર્સ :- અંજાર : ઠક્કર મુરજી પરષોત્તમ એન્ડ સન્સ ફો.૨૪૩૯૨૦, સરલ માર્કેટીંગ ફો.૯૯૧૩૬૪૯૪૦૦, આરતી ઇલેક્ટ્રોનીક્સ ફો.૨૪૦૬૬૨ ગાંધીધામ : મુલચંદ રામાવતાર ફો.૨૩૪૩૩૦, શંકર બરતન સ્ટોર ફો.૨૩૮૪૫૯, બિભુમલ ફો.૨૩૪૫૭૫, શ્રીરામ બરતન સ્ટોર ફો.૨૨૧૨૪૧, રોયલ સેલ્સ ફો.૨૩૫૯૧૭ આદિપુર : શાંતિલાલ ટોકરશી ફો.૨૬૦૦૧૩, કષ્ટભંજન વાસણ ભંડાર ફો.૨૬૦૧૩૯ ભચાઉ : કુબડીયા ચંદ્રકાંત નેમચંદ ફો.૯૪૨૮૦૮૫૧૮૮, ઉત્સવ ઇલે. ફો.૨૩૦૨૭૭, કુબડીયા રમેશચંદ્ર નેમચંદ ફો.૯૭૨૭૭૧૯૪૬૮, વોરા વિનશજી ખીમજી ફો.૯૮૭૯૬૧૩૮૫૬, ગાયત્રી રેડીયો સર્વિસ ફો.૯૮૨૪૪૩૨૯૫૦ સામખીયારી : કાંતિ મેટલ સ્ટોર ફો.૨૮૩૩૫૬

TOP SPOT
SOFTEL GREAT KITCHEN CONCEPTS
ભારતનું સર્વશ્રેષ્ઠ હેન્ડ બ્લેન્ડર

હેન્ડ બ્લેન્ડર
રૂા.૪૦૦ સુધીની એક્સચેંજ ઓફર
સોફ્ટલની અન્ય પ્રોડક્ટસ જેવી કે આઇસ્ક્રીમ મેકર, ટોસ્ટર, ઇન્ડક્શન સ્ટવ, સેન્ડવીચ મેકર મસાલા ગ્રાઇન્ડર, મીક્ષર ગ્રાઇન્ડર, ઘરઘંટી વિ. ઉપર પણ ભારે છૂટ
પશ્ચિમ કચ્છના ડિલર્સ :- ભુજ : મહેન્દ્ર ટ્રેડીંગ કું. ફો.૨૨૧૧૯૦, પ્રાણ મેટલ્સ ફો.૨૨૧૧૨૧, સ્વાદ કેશ એન્ડ કેરી ફો.૨૨૨૩૦૦, શીતલ મેટલ્સ ફો.૨૬૨૫૧૦, પ્રકાશ ટ્રેડીંગ ફો.૨૨૦૨૬૬, કુણાલ સેલ્સ ફો.૨૨૦૭૨૧ માધાપર : ભક્તિ મેટલ્સ ફો.૨૪૧૪૪૭, વિનોદ સ્ટીલ ફો.૨૪૦૮૨૧ માંડવી : લબ્ધી ફો.૨૩૦૨૭૭, અપુર્વ ફો.૨૩૦૬૫૦ મુન્દ્રા : ડિવાઇન ઇલેક્ટ્રોનીક્સ ફો.૯૯૭૮૭૯૧૯૮૮, પાર્થ ઇલે. ફો.૨૨૩૧૫૩, કરન એન્ટ. ફો.૨૨૨૮૧૦, મહાવીર સુપર માર્કેટ ફો.૨૨૩૨૫૯

1KV થી 125KV સુધીના જનરેટર ભાડે મળશે
સત્યમ જનરેટર
M. 99254 54588
M. 9558949723

Vaishali Beauty Care
Specialist in Skin & Hair Treatment
७०० में 7 चीजे करके दी जायेगी !
- Eye Brow
- Bleach (Natural)
- Fruit Facial (Natural)
- Full Wax - Hair SPA
- Hair Cut - Manicure
Shop No. 5, Krupa Complex, Ward 12/C, Gandhidham
8401782824

દિવ્ય ભાસ્કર હવે આપની કલાસિફાઇડ ડિસ્પ્લે જાહેરાત કલરમાં
સમગ્ર કચ્છમાં પ્રસિદ્ધ કરાવો અને સાથે સ્કીમ પણ મેળવો...
ફક્ત રૂા. ૧૦૦ પ્રતિ કોલમ સે.મી.
સાઇઝ
3 x 1 : 300
4 x 1 : 400
5 x 1 : 500
6 x 1 : 600
7 x 1 : 700
8 x 1 : 800
9 x 1 : 900
10 x 1 : 1000
11 x 1 : 1100
12 x 1 : 1200
13 x 1 : 1300
14 x 1 : 1400
15 x 1 : 1500
16 x 1 : 1600
17 x 1 : 1700
18 x 1 : 1800
19 x 1 : 1900
20 x 1 : 2000
૩ સે.મી. થી ૨૦ સે.મી. સુધીની સાઇઝમાં પ્રસિદ્ધ કરાવો
સ્પે. સ્કીમ ઉપલબ્ધ
૨ + ૧, ૫ + ૩, ૮ + ૫, ૧૪ + ૧૦ ૧૮ + ૧૪, , ૩૦ + ૨૪, ૪૦ + ૪૦
વધુ વિગત માટે સંપર્ક :
: ભુજ : ૦૨૮૩૨-૩૦૮૨૨૩ મો. ૯૯૨૫૦ ૦૦૩૬૫
: ગાંધીધામ : ૦૨૮૩૬-૨૨૬૬૮૮ મો. ૯૬૮૭૩ ૧૭૩૫૧

રોલીંગ શટર્સ
બનાવતા પહેલા મુલાકાતમાં ફાયદો
વિશ્વકર્મા આયર્ન પ્રોડક્સ
૨૬, જી.આઇ.ડી.સી., અંજાર
(o)242984, M.98255 52987

પોતાનો લઘુ ઉદ્યોગ શરૂ કરો
CFL બલ્બ બનાવો અને મહીને રૂા ૨૦ હજાર કે તેથી વધુ કમાવો
મો.૯૭૨૭૨૮૪૬૮૧, ૯૦૩૩૦૮૮૭૬૪

ગો...ગોવા
પેકેજ : ૩ રાત્રી/૪ દિવસ ૩*/૪*/૫* હોટલ
ભુજ 9898569811 | માંડવી 9825751533

જોઇએ છે
સેલ્સમેન - ૫
આકર્ષક પગાર તથા કમીશન સાથે ફક્ત મુન્દ્રા માટે
સંપર્ક : વોડાફોન કંપનીના CSA ઇ.કોમ. 204, રત્નકલા આર્કેડ, ઝીરો પોઇન્ટ, મુંદરા-કચ્છ.
M: 9925446663

વેચવાના છે
2 BHK મકાન
માધાપર-નવાવાસ જલારામનગર, સર્વે નં.૨૦૫
Mo : 99099 61241
Mo : 90990 73777

BHUDIA ભુડિઆ કેસર ફાર્મ
પલ્પ : કેસર કેરી, કેસર કેરી કટકી
જ્યુસ : કેસર કેરી-જામફળ-દ્રાક્ષ-જાંબુ મૌસંબી-ઓરેન્જ-તરબુચ-સીતાફળ દાડમ-ખારેક-ચણીબોર-નાળીયેર પાઇનેપલ-લીંબુ-આમળા
૧. ભુડિયા કેસર ફાર્મ : ભુજોડી રેલ્વે ફાટક પાસે, ભુજ-અંજાર હાઇવે રોડ
૨. માધવ જ્યુસ સેન્ટર : ઓમ કોર્નર, ગાંધીધામ
૩. સંતુષ્ટ : દાદા-દાદી પાર્કની સામે, ભુજ
પ્રણવ ઉપાધ્યાય Mo. 84010 84104

વજન વધારો ઘટાડો
માત્ર 3 મહિનામાં 10-15 KG વજન ઘટાડો 100% ગેરેન્ટેડ રીઝલ્ટ
Fitness Center
M. 9978732868, 9925025478
ગાંધીધામમાં મળવાનો સમય : બુધવાર સવારે ૧૦ થી ૧૨.૩૦
બાકીના દિવસોમાં ભુજમાં રાબેતા મુજબ મળશે
સ્થળ : કિલ્લોલ હોસ્પિટલ પ્લોટ નં. ૧૩૨ સે-૧ A, કચ્છ કલા પાછળ, ગાંધીધામ.

જોઇએ છે
હોટલ માટે માણસની જરૂર છે રહેવા જમવાની સગવડ સાથે જેન્સ - બે, લેડીસ - એક, સફાઇ કામ માટે
હોટલ આદિત્ય-આદિપુર
સંપર્ક : 94262 31982

A To Z Travels Gandhidham
Delhi – Shimla – Kullu – Manali - Chandigarh
7 Day Trip with Car, Meals, Hotels,.....
Standard @ 13499/-
Deluxe @ 15999/-
S. Deluxe @ 17499/-
Luxury @ 22999/-
www.atoztravelhub.com
Pinank Joshi : 99256 33215
Mahesh Maheshwari : 98790 14345

મેમરી કાર્ડ
(હોલસેલ તથા રીટેલ)
કચ્છ માં સૌથી ઓછા ભાવ
2GB | 4GB | 8GB
16GB | 32GB
(ભાવ જાણવા માટે એક વખત અવશ્ય ફોન કરો)
સંસ્કૃતિ ટેલીકોમ પોલીસ સ્ટેશન રોડ ગાંધીધામ
9825749449

ઓફિસ / ડિલેવરી બોય
આદિપુર ઓફિસ માટે ૧૮ થી ૩૦ વર્ષના યુવાનો
સમય ૮.૩૦ થી ૫.૩૦
પગાર : ૪૫૦૦ રૂપિયા
રવીન્દ્ર સબરવાલ ૯૩૭૪૪૧૫૧૦૦

ઉનાળા વેકેશન પ્રવાસો
ચારધામ | કાશ્મીર
વૈષ્ણોવદેવી | સીમલા-મનાલી
ડેલહાઉસી | ગોવા
મહાબલેશ્વર | કેરલા
શ્રી રાધેશ્યામ ટુરિઝમ
ગાંધીધામ 98254 44378
ભુજ 94262 74056

VINAY CINE COMPLEX
NR POST OFFICE ADIPUR KUTCH
MOB:- 9978996131 TEL. 260885,262836

SATYAM	SHIVAM	SUNDARAM
10.15AM PIYU TARA VINA EKLU LAGE	10.30AM AGENT VINOD	10.30AM JEEVAN SATHI(SINDHI)
12.45PM THE HUNGER GAME(HINDI)	1.20PM AGENT VINOD	1.00PM TERE NAAL LOVE HO GAYA
3.45PM KAHANI	4.15PM AGENT VINOD	3.45PM TERE NAAL LOVE HO GAYA
6.45PM THE HUNGER GAME(HINDI)	7.00PM AGENT VINOD	6.45PM KAHANI
9.45PM THE HUNGER GAME(HINDI)	10.00PM AGENT VINOD	10.00PM KAHANI

Digitially Archived by: www.realpatidar.com/library

2012-03-27 -Divya Bhaskar -Bidada -Satpanth Samaj Protest [421]

કારના ગડથોલિયાં

તસવીર પ્રકાશ ભટ્ટ

ભુજના કોલેજ રોડ પર સવારે બોલેરો સિંઘમ સ્ટાઇલમાં પલટી ખાઇ ગઇ હતી. જોકે આ અકસ્માતનું મુખ્ય કારણ બે રાહદારીને બચાવવા જતાં કાબૂ ગુમાવ્યો હોવાનું રૂબરૂ જોનારાઓએ કહ્યું હતું.

ફૂટપાથ પર દબાણે સર્જેલો અકસ્માત

ભુજમાં ફિલ્મી સ્ટન્ટની જેમ કાર ચાર ગલોટિયાં ખાઇ ગઇ

રાહદારીને બચાવવા ગયેલો ચાલક બાલ બાલ બચ્યો

ભાસ્કર ન્યૂઝ. ભુજ

ભુજમાં આવેલી અનેક ફૂટપાથ પર વેચાણકારોના દબાણને લીધે રાહદારીઓએ નાછૂટકે વાહનોથી ધમધમતા રોડ પર ચાલવું પડે છે. સોમવારે શહેરના કોલેજ રોડ પર બનેલા અકસ્માતમાં આ સમસ્યા ગંભીર રીતે સામે આવી હતી. ફૂટપાથ પરના દબાણને લીધે રોડ પર ચાલતા બે રાહદારીને બચાવવા જતા એક કાર ચાર ગલોટિયાં ખાઇને ક્યાંય સુધી ઢસડાઇ હતી, જોકે એના ચાલકને ખાસ ઇજા થઇ નહોતી.

સોમવારે સવારે 9:30 વાગ્યાના અરસામાં શહેર તરફથી પૂરઝડપે આવતી કાર એકાએક પલટી ખાઇને ત્રણથી ચાર જેટલા ગલોટિયા ખાઇ ગઇ હતી. આ દૃશ્ય જોઇને સિંઘમ જેવી એક્શન ફિલ્મોમાં જોવા મળતા સીન યાદ આવી ગયાં હતાં. ચાલીસેક ફૂટ દૂર સુધી પહોંચી ગયેલી કારમાં એના ડ્રાઇવરને શું થયું હશે એ જોવા માણસો ટોળે વળ્યાં ત્યારે ચાલક જિગર પવાણી સહી સલામત કારમાંથી બહાર આવતા લોકો પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. ચાલકના જણાવ્યા પ્રમાણે પગપાળા જતા બે માણસ રસ્તામાં આવી જતા તેને બચાવવાની કોશિશ કરી અને કાબૂ ગુમાવી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે, લાલન કોલેજથી શિવકૃપાનગર વચ્ચેની ફૂટપાથ પર ફૂલછોડવાળાના દબાણથી રાહદારીઓએ મજબૂરીથી વાહનોથી ધમધમતા રસ્તે ચાલવું પડે છે, જ્યાં જીવલેણ અકસ્માત સર્જાવાની ભીતિ રહે છે.

ભુજમાં ગરમી 39.5: દિવસ-રાતના તાપમાનમાં 20 ડિગ્રીનો તફાવત

ભાસ્કર ન્યૂઝ. ભુજ

ભુજમાં ટોપીબજારમાં પણ ગરમી આવી ગઇ છે. -મયૂર ચૌહાણ

ભુજમાં ઉનાળો પોતાનો અસલ મિજાજ બતાવી રહ્યો હોય એમ આજે પણ ગરમીનો પારો બરકરાર રહેતાં 39.5 ડિગ્રી તાપમાન નોંધાતાં લોકો અકળાયા હતા, જ્યારે દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચે 20 ડિગ્રી વિષમતા અનુભવાઇ હતી, જ્યારે નલિયામાં હજુ પણ સામાન્ય ઠંડક અનુભવાઇ રહી છે.

ગઇકાલે ભુજમાં સીઝનમાં પહેલીવાર પારો 40 ડિગ્રીને સ્પર્શી જતાં લોકો શેકાઇ ગયા હતા. આજે પણ તે સ્થિતિ જારી રહેતાં મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી રહેતાં બફારો અનુભવાયો હતો, તો બીજીતરફ રાત્રિનું તાપમાન 19.5 નોંધાતાં ગરમીમાંથી આંશિક રાહત વર્તાઇ હતી.

બીજી બાજુ નલિયામાં હજુયે રાત્રિના સામાન્ય ઠંડક પડી રહી છે. અહીં લઘુત્તમ 15 તથા મહત્તમ 32.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કંડલામાં મહત્તમ 32.1 અને લઘુત્તમ 20 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે માંડવીમાં અનુક્રમે 32, 18.7 નોંધાયું હતું. પવનની ઝડપ સરેરાશ 6થી 12 કિમી રહી હતી. આગામી દિવસોમાં તાપ વધે તેવી ભીતિ સેવાઇ રહી છે.

માધાપરમાં થયેલી ચોરીના બીજા દિવસે પણ તસ્કરો લાપતા

ભંગારના ધંધાદારીએ સંતાનના જન્મ પ્રસંગે મળેલી સોગાદ પણ ગુમાવી

ભાસ્કર ન્યૂઝ. ભુજ

ભુજ તાલુકામાં થયેલી મોટા ભાગની તસ્કરીનો ભેદ ઉકેલાયો નથી. એ પરંપરા જાણે બરકરાર રહેતી હોય એમ માધાપરમાં ભંગારના ધંધાદારીના ઘરમાં થયેલી તસ્કરીનો ભેદ પણ બીજા દિવસેય ઉકેલાયો નથી. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ભુજની ભાગોળે એટીએમ ચોરી અને સૂરજપરના મંદિરમાં થયેલી મૂલ્યવાન આભૂષણની ઉઠાંતરીનો કોયડો પણ પોલીસ હજુ સુધી ઉકેલી શકી નથી.

માધાપરમાં રહેતા ગનીભાઇ કુંભાર હાજીપીરની સલામ કરવા પરિવાર સાથે તા. 23થી 25 માર્ચ સુધી ગયા હતા.

એ દરમિયાન તાળું મારેલું મકાન રેઢું પડ્યું હતું, ત્યારે એમાંથી સોના-ચાંદીના દાગીના અને રૂ.30 હજારની રોકડ મળીને કુલ 41 હજારની મત્તા ઉપડી ગઇ હતી. આ અંગે રવિવારે પોલીસમાં ફરિયાદ નોંધાતા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં હતાં.

આ અંગે તપાસ ચલાવતા સબ-ઇન્સ્પેક્ટર આર.ટી. તલસાણિયાએ કહ્યું કે, જેના ઘરમાંથી ચોરી થઇ એ ભંગારનો ધંધાદારી હોવાથી ઘરમાં મોટી રકમ રાખી હતી.

વળી, તેના સંતાનના જન્મ પ્રસંગે સગાસંબંધીમાંથી ભેટ રૂપે મળેલા દાગીના પણ આ તસ્કરીમાં ઉપડી ગયા હતા. જોકે, તપાસના પ્રારંભિક દોરમાં હજી સુધી કોઇ સગડ મળ્યા નથી.

ઉલ્લેખનીય છે કે ભુજના આરટીઓ સર્કલ પાસે આવેલા આઇસીઆઇસીઆઇના એટીએમની ફેબ્રુઆરી માસમાં થયેલી ચોરીનો ભેદ હજી વણઉકેલ્યો છે. વળી, સૂરજપરમાં તો સ્વામિનારાયણ મંદિરમાં દર્શને આવતી યુવતી જ 2.7 લાખના ઘરેણા ચોરી ગઇ હતી, એમાં પણ કોઇ પગેરું મળ્યું નથી.

બે કોપી કેસ સાથે કચ્છ યુનિ.ની પરીક્ષાઓ શરૂ

લાલન કોલેજમાં એફવાય-ટીવાયના છાત્રોએ કસોટી આપી હતી - પ્રકાશ ભટ્ટ

બોર્ડની પરીક્ષા બાદ હવે કસોટી કોલેજિયનો કી

ભાસ્કર ન્યૂઝ. ભુજ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ એક પણ કોપીકેસ વિના કચ્છમાં પૂરી થઇ છે, ત્યારે ઉચ્ચ શિક્ષણ મેળવતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કોપી કેરવાની તક જતી નથી કરી, કચ્છ યુનિવર્સિટીની એફવાય અને ટીવાયની વાર્ષિક પરીક્ષાઓ આજથી શરૂ થઇ હતી, જેમાં આદિપુરની તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાંથી બે નકલખોરને પકડી લેવાયા હતા.

મળતી વિગતો અનુસાર આજે પ્રથમ વર્ષ અને તૃતીય વર્ષના વિવિધ અભ્યાસ ક્રમોની કસોટીઓ શરૂ થઇ હતી. પરીક્ષા નિયામક ડો.જી.એમ.બુટાણીએ જણાવ્યું હતું કે, પરીક્ષાઓ રાબેતા મુજબ શરૂ થઇ ગઇ છે. પ્રથમ દિવસે આદિપુરની કોલેજમાં બે પરીક્ષાર્થીને કોપી કરતાં જબ્બે કરાયા હતા. જેમાં એક ટીવાય બીએ અને એક ટીવાય બીબીએના છાત્રનો સમાવેશ થાય છે.

'હેલ્લો.. નવ લાખ રૂપિયા ભરી જાવ'

ભુજ નગરપાલિકાએ ટેલિફોન ઓફિસને પાઠવી નોટિસ, લાલટેકરી પાસે ઢોલ પણ વગાડયા

ભાસ્કર ન્યૂઝ. ભુજ

ભુજ પાલિકાની વેરા વસૂલાત ઝુંબેશ તેની પરાકાસ્ટાએ પહોંચી રહી છે, ત્યારે સોમવારે લાલટેકરી સ્થિત ટેલિફોન ઓફિસના બાકી નવ લાખ ઉઘરાવવા ઢોલ વગાડાયા હતા અને માસના અંત સુધી રૂપિયા ભરી જવા જણાવાયું હતું.

સત્તાવાર વિગતો મુજબ લાલટેકરી પાસે ભારત સંચાર નિગમના મુખ્ય બિલ્ડિંગના લાંબા સમયથી નાણાં ભરાયાં નથી, જેની રકમ નવ લાખને આંબી ગઇ છે. વેરાની રકમ અંગેની નોટિસ છેક ડિસેમ્બરમાં અપાઇ હતી, પરંતુ નિગમ તરફથી કોઇ કાર્યવાહી ન થતાં પાલિકાની ટુકડી આજે જનરલ મેનેજરને મળી હતી. જેણે આ અંગે યોગ્ય કરવા ખાતરી આપી હતી. દરમિયાન આજે કનેકશન કપાય તેવી શકયતા છે.

હરિપર રોડવાળી કચેરીની તો આકારણી જ બાકી

પાલિકાના ટેક્સ વિભાગના અરવિંદસિંહ જાડેજાના જણાવ્યા મુજબ હરિપર રોડ સ્થિત નિગમનું પરિસર કે જે 13મા વોર્ડમાં આવે છે તેની આકારણી જ બાકી છે, જે નિગમ દ્વારા વેળાસર કરાવી લેવાય તેવી વિનંતી કરાઇ છે.

ભુજની RTO રિલો. પાસે એસટી બસ સ્ટેન્ડ ખુલ્લું મુકાયું

ભાસ્કર ન્યૂઝ. ભુજ

ભુજના પ્રવેશદ્વારે આર.ટી.ઓ. રિલોકેશન સાઇટ ખાતે એસ.ટી. બસના લોકલ તેમજ એક્સપ્રેસ બસ સ્ટોપ માટેનું સ્ટેશન લોકાર્પણ કરાયું છે. રિલોકેશન ખાતે એસ.ટી.પીકઅપ સ્ટેન્ડ વિનય રેલોનના હસ્તે ખુલ્લું મુકયું હતું. આ પ્રસંગે પૂર્ણેન્દુ બી. અંતાણી, કિશોર પરમાર, નગરસેવકો ઘનશ્યામ સી.ઠક્કર, કીર્તિભાઇ જોષી, મંજુલાબેન ઉપાધ્યાય, હિતેન્દ્ર ગોસ્વામી, કિશોર વોરા તેમજ રાજગોર જ્ઞાતિના અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા. નટવરલાલ સોલંકી, કમલેશ ગજ્જર, ભાવેશ, ધીરુભા જાડેજા, હરિલાલ સોનીએ જહેમત ઉઠાવી હતી. વિભાગીય નિયામક સંજય જોષીનો આભાર મનાયો હતો.

For further information, please contact: Tata Motors Ltd.: Authorised Dealers: Bhuj: Cargo: 94292 47079, 97265 40336.
*Conditions apply. Offers cannot be clubbed together. **Mileage certified by ARAI # Whichever is earlier
Rediffusion-Y&R/Mum/TM/0667 GJ

Digitially Archived by: www.realpatidar.com/library

2012-03-27 -Divya Bhaskar -Bidada -Satpanth Samaj Protest [421]

આજનું પંચાંગ

વિક્રમ સંવત : 2068
શાલિવાહન સંવત : 1934
ખ્રિસ્તી સંવત : 2012
રાષ્ટ્રીય દિનાંક : 07
યુગાબ્દ : 5114
જૈન સંવત : 2538
ઈસ્લામિક સંવત : 1433
પારસી વર્ષ : 1381

(કુંડળી: 8 રા., 7 શ., 6, 5 મં., 4, 9, 10, 11, 1 શુ. ગુ., 12 સૂ. બુ., 2 ચં. કે., 3)

તિથિ : ચૈત્ર સુદ - 5 **ખ્રિસ્તી તિથિ :** 27 માર્ચ, મંગળવાર
પારસી : 12 **ઈસ્લામિક :** 03 - જમાદી-ઉલ-અવ્વલ

આજનો તહેવાર છ વૃદ્ધિ તિથિ

સૂર્યોદય-સૂર્યાસ્ત :

શહેર	સૂર્યોદય	નવકારશી	સૂર્યાસ્ત	ચંદ્રોદય	ચંદ્રાસ્ત
સુરજબારી	06-44	07-32	19-01	9-28	23-08
ગાંધીધામ	06-46	07-34	19-03	9-30	23-10
ભુજ	06-48	07-36	19-05	9-32	23-12
નખત્રાણા	06-49	07-37	19-06	9-33	23-13

ગ્રહોની ચાલ : સૂર્ય : મીન **નક્ષત્ર :** કૃતિકા **યોગ :** પ્રીતિ **કરણ :** બવ
રાહુકાલ : 15-00થી 16-30 સુધી
દિશાશૂલ : વાયવ્ય (તે દિશામાં પ્રવાસ ન કરવો.)
ગોચર ગ્રહ 1 મેષ 2 વૃષભ 5 સિંહ 7 તુલા 8 વૃશ્ચિક 12 મીન
સ્થિતિ : શુ.ગુ. ચં.કે. મં. શ. રા. સૂ.બુ.
આજની ચંદ્રરાશિ : વૃષભ **નામાક્ષર :** બ, વ, ઉ
શુભ ચોઘડિયાં : સવારે 9.32થી 10.59 ચલ, 10.59થી 12.26 લાભ, 12.26થી 13.53 અમૃત, બપોરે 15.20થી 16.47 શુભ.

આજનું રાશિફળ

કંદર્પભાઈ ત્રિવેદી

મેષ (શુભ રંગ : લાલ, શુભ અંક : 1-8) **નામાક્ષર - અ, લ, ઈ** I સટ્ટાકીય બાબતોમાં કાળજી રાખવી. વેપાર ક્ષેત્રે ભાગીદારીમાં સંભાળવું. લગ્નજીવન સુખમય રહે. અટકેલા કાર્ય પૂર્ણ થતા જણાય.

વૃષભ (શુભ રંગ : સફેદ, શુભ અંક : 2-7) **નામાક્ષર - બ, વ, ઉ** I કોર્ટ-કચેરીના કાર્ય ઝડપથી પૂર્ણ થતા જણાય. સામાજિક ક્ષેત્રે પ્રતિષ્ઠા-પદમાં વૃદ્ધિ થઇ શકે. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું રહે. એકંદરે સમય સાનુકૂળ.

મિથુન (શુભ રંગ : લીંબુ, શુભ અંક : 3-6) **નામાક્ષર - ક, છ, ઘ** I જૂના મિત્રો-સ્નેહીજનોને મળવાનું થઇ શકે. વડીલોનું માર્ગદર્શન ઉપયોગી સાબિત થાય. વાહન-મકાનની ખરીદીમાં સાવચેતી રાખવી. આરોગ્યની કાળજી રાખવી.

કર્ક (શુભ રંગ : દૂધિયો, શુભ અંક : 4) **નામાક્ષર - ડ, હ** I આર્થિક સ્થિતિ મજબૂત બનતી જણાય. વેપાર-ધંધામાં નવું રોકાણ થઇ શકે. અટકેલા કાર્ય પૂર્ણ થતા જણાય. દિવસ આનંદમય પસાર થાય.

સિંહ (શુભ રંગ : સોનેરી, શુભ અંક : 5) **નામાક્ષર - મ, ટ** I ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રૂચિ વધતી જણાય. લાંબા ગાળાનું આયોજન થઇ શકે. વેપારમાં મોટા સાહસ થઇ શકે. રોજગારીની નવી તક મળી શકે.

કન્યા (શુભ રંગ : લીલો, શુભ અંક : 6-3) **નામાક્ષર - પ, ઠ, ણ** I અભ્યાસ-સ્પર્ધા ક્ષેત્રે સફળતા મળતી જણાય. ધીરજનો ગુણ અપનાવવો. લાંબા ગાળાનું આયોજન થઇ શકે. નવી તક પ્રાપ્ત થઇ શકે.

તુલા (શુભ રંગ : સફેદ, શુભ અંક : 7-2) **નામાક્ષર - ર, ત** I આર્થિક બાબતે ચિંતા હળવી બનતી જણાય. અભ્યાસ ક્ષેત્રે ધાર્યું પરિણામ મેળવવા વધુ મહેનત કરવી પડે. આરોગ્યની સુખાકારી જળવાઇ રહે. પ્રગતિદાયક સમય રહે.

વૃશ્ચિક (શુભ રંગ : લાલ, શુભ અંક : 8-1) **નામાક્ષર - ન, ય** I માતા-પિતા, વડીલોનું માર્ગદર્શનથી ગૂંચવાયેલા પ્રશ્નો દૂર થાય. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું રહે. માનસિક ચિંતા હળવી બને. એકંદરે સમય સાનુકૂળ.

ધન (શુભ રંગ : પીળો, શુભ અંક : 9-12) **નામાક્ષર - ભ, ધ, ફ ઢ** I નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જણાય. વડીલોનું માર્ગદર્શન ઉપયોગી સાબિત થઇ શકે. દિવસ આનંદમય પસાર થાય. મિત્રો-સ્નેહીજનોને મળવાનું થઇ શકે.

મકર (શુભ રંગ : વાદળી, શુભ અંક : 10-11) **નામાક્ષર - ખ, જ** I રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઇ શકે. ધીરજથી કાર્ય કરવું. આનંદમય વાતાવરણ રહે. રોજગારીની નવી તક પ્રાપ્ત થઇ શકે.

કુંભ (શુભ રંગ : વાદળી, શુભ અંક : 11-10) **નામાક્ષર - ગ, સ, શ, ષ** I વાહન ચલાવતા સંભાળવું. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું રહે. નાણાકીય સ્થિતિ સુધરતી જણાય. એકંદરે સમય પ્રગતિદાયક.

મીન (શુભ રંગ : પીળો, શુભ અંક : 12-9) **નામાક્ષર - દ, ચ, ઝ, થ** I વિદેશના અટકેલા કાર્ય પૂર્ણ થતા જણાય. સંતાન સંબંધી પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. યાત્રા-પ્રવાસનું આયોજન થઇ શકે. આવકના સ્રોતમાં વૃદ્ધિ થઇ શકે.

માહિતી અધિકાર હેલ્પલાઇન નંબર : 99240 85000
ભવિષ્ય જાણવા મોબાઇલ પર DB ASTRO લખીને 7333 પર SMS કરો

ક્રોસવર્ડ-2700

ભૂપેન્દ્ર શાહ 'શંભુ'

1		2	3		4	5		
		6		7				8
				9	10		11	
	12		13					
14		15		16				
	17		18				19	20
21				22		23		
24			25			26	27	
		28			29			

આડી ચાવી

1. સાઉથની સ્વ. અભિનેત્રી જેના પરથી બની ધ ડર્ટી પિક્ચર (4)
4. ઝડપ, વેગ, ઉતાવળ (3)
6. ખેદાનમેદાન, ફના (3)
9. પવનથી ચાલતું ચક્રવાળું યંત્ર (5)
12. બગીચો, વાડી (3)
14. ગરમ પવનનો ઝપાટો (1)
15. જૂની ફિલ્મોમાં સાસુનો રોલ કરતી અભિનેત્રી (6)
18. આજનું કામ ..... પર ન છોડો (2)
19. રોષ, ગુસ્સો (2)
21. સાજનની પ્રિયા (3)
22. શ્રાવણી પૂનમ, રક્ષાબંધન (3)
24. ..... ચકડોળે ચડવું (2)
25. ચોખ્ખું, પવિત્ર, સ્વચ્છ (2)
26. સ્થિતિ, અવસ્થા (3)
28. ભગવાન વિષ્ણુનું હથિયાર (2)
29. ચોખાના ભાંગેલા દાણા (3)

ઊભી ચાવી

1. ખર્ચ જતાં બાકી વધેલી રકમ (3)
2. રાજ બબ્બરની પત્ની, સ્વ. અભિનેત્રી (5)
3. આકાશમાં રાત્રે ટમટમે (2)
5. પવિત્ર, શુદ્ધ (3)
7. એક મજબૂત મોટરગાડી (2)
8. અવશ્ય, ચોક્કસ, સ્યોર (2)
10. વરસાદ પછી જમીનનું સુકાવવું (3)
11. નાની ચિઠ્ઠી, કાપલી (4)
13. ચંડિકા, એક માતા (3)
16. સંગીતમાં તાલ પ્રમાણે (4)
17. હસતાં ગાલમાં પડતો નાનો ખાડો (3)
20. એક ધાતુ, ગેલ્વેનાઈઝ (3)
21. એક પક્ષી, ચીલ (3)
23. મોટો મછવો, શિપ (3)
25. એક ગ્રહ (2)
27. ભાગ્યશાળી, નસીબદાર (2)

જવાબ ક્રોસ વર્ડ 2699

અ	નુ	પ	જ	લો	ટા		પ્ર	જા
	ક	દ	મ		વ		વા	ન
મા	સા		નો	ક	ર	શા	હી	
વ	ન		શ્રી	સ		બા		વે
ડિ		સો		ર	વે	શ		ર
યો	ગિ	ની		ત	લ		છા	ણ
	રિ		વિ		ણ			છે
પ	રા	વ	લં	બી		પા	દ	ર
	જ		બ	ના	ર	સ		ણ

કચ્છની નોંધપોથી

હોમગાર્ડ્ઝમાં ભરતી કરાશે

ભુજ શહેર હોમગાર્ડ્ઝ યુનિટ તરફથી મહિલા તેમજ પુરુષોની ભરતી હોવાથી ઈચ્છુક ઉમેદવારોએ રાશનકાર્ડ તથા સાત ધોરણ પાસના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની ઝેરોક્ષ સાથે શહેર યુનિટ કચેરી મહાદેવ ગેટ પાસે સાંજે 4થી 6 વચ્ચે ઉપસ્થિત રહેવું.

આર.એસ.એસ.ના સંપર્ક વિભાગની બેઠક

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સંપર્ક વિભાગના સ્વયંસેવકોની બેઠક તા.૨૭/3ના સાંજે 7 વાગ્યે જાદવજીનગર કાર્યાલય મધ્યે.

કચ્છ જિલ્લા પેન્શનર્સ એસોસિયેશન

કચ્છ જિલ્લા પેન્શનર્સ એસોસિયેશન આયોજિત એક મેડિકલ કેમ્પ તા.29/3ના સવારે સંસ્થાના કાર્યાલય મધ્યે 10થી 12 દરમિયાન ડાયાબિટીસ, બ્લડપ્રેસર તથા હિમોગ્લોબીન ચેકઅપ થશે.

ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ

તા.5/4ના લેવાનારી ગુજકેટ પરીક્ષાના ઓલ્ફ્રેડ હાઇસ્કૂલના ઉમેદવારોએ તેમની પરીક્ષા રસીદ તા.27/3ના સવારે 10થી 12:30 દરમિયાન શાળામાંથી મેળવી લેવી.

મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ, મોઢેશ્વરી મહિલા મંડળ

જ્ઞાતિની અનાથ, નિરાધાર, વિધવા બહેનોએ સહાય મેળવવા માટે સમસ્ત બ્રહ્મસમાજ માતા રેણુકા ટ્રસ્ટના મંજુલાબેન ઉપાધ્યાય 255219 તથા પ્રમોદબેન ભટ્ટ 290166નો સંપર્ક કરવો તેમજ જ્ઞાતિની 'વસતીપત્રક બૂક'ના ફોર્મ તા.31/3 સુધી ભરીને પહોંચતા કરવા.

રોટરી કલબ ઓફ વોલસિટીની બેઠક

રોટરી વોલસિટી ભુજની સાપ્તાહિક મીટિંગ ૨૭/3ના 8:30 વાગ્યે ક્લોઝ મીટિંગ રોટરી હોલ, હોસ્પિટલ રોડ મધ્યે.

તારે જમીન પે આકાશદર્શન

રોડ સાઇડ એસ્ટ્રોનોમી ચંદ્ર, ગુરુ, શુક્ર, મંગળનું ટેલિસ્કોપ દ્વારા દર્શન તા.27/3 સાંજે 8થી 9 હમીરસર લોન, રાજેન્દ્ર પાર્ક સામેના સ્થળે, જેમાં રાજીલાલ ઉમરાણિયા ફિલ્મ નિર્માતા ઉપસ્થિત રહેશે 94282 20472 ઉપરકરવો.

આર્ટ ઓફ લિવિંગ ભુજ

બેઝિક કોર્સ તા.૨7થી 1 એપ્રિલ રિપીટર્સ માટે (નિ:શુલ્ક) ભાગ લેવા માટે સાંજે 6થી 9 વાગ્યે માતૃછાયા સ્કૂલમાં ઉપસ્થિત રહેવું.

ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલ

ગુજકેટ માર્ચ-૨૦૧૨ની પરીક્ષાની પ્રવેશિકા માટે આ શાળાની નિયમિત તથા રીપીટર વિદ્યાર્થિનીઓએ તા. ૨7/3ના 11થી 1૨:30 વચ્ચે સંપર્ક કરવો.

લોહાણા મહિલા મંડળ

મંડળની માત્ર કારોબારી તથા કથા સમિતિની બહેનોની અગત્યની મીટિંગ તા.૨7/3ના સાંજે 5 વાગ્યે કતિરા પાર્ટીપ્લોટ મધ્યે.

ગાંધીધામમાં ડો. જિતેન્દ્ર અઢિયાનું પ્રવચન

ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે તા. 31/3ના સાંજે 6:30 વાગ્યે માઇન્ડ પાવર નિષ્ણાત ડો. જિતેન્દ્ર અઢિયાના વાર્તાલાપનું આયોજન.

અબડાસા મેઘવંશી મારૂ સમાજ જોગ

સમાજની કારોબારી મીટિંગ તા.1/4ના સવારે 10:30 કલાકે ખીરસરા (નેત્રા) મધ્યે.

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ડુમરા

જવાહર નવોદય વિદ્યાલય-ડુમરામાં ધો.9, વર્ષ ૨૦૧૨-13 માટે ખાલી પડેલી 18 જગ્યા માટેની પ્રવેશ પરીક્ષાના અરજી પત્રકો બહાર પાડેલા છે. આચાર્ય જવાહર નવોદય વિદ્યાલય-ડુમરા. જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી કચેરી ભુજ તથા www.navodaya.nic.in પાસેથી મેળવી શકાશે. અંગ્રેજી પત્રક ભરવાની છેલ્લી તા.16/4 રહેશે. વધુ માહિતી માટે 02831-283234નો સંપર્ક કરવો.

પુનડીમાં વાંકોલ માતાજીના મંદિરે હવન

પુનડીમાં વાંકોલ માતાજીને નમતા નાગુ પરિવાર દ્વારા તા.31/3ના સવારે માતાજીના હોમહવન તથા બપોરે મહાપ્રસાદ મસ્કાના રામજી મહારાજ હવનવિધિ કરાવશે.

વાંઢાયમાં ઉમાપતિ મહાદેવના મહોત્સવની ચાલતી તૈયારીઓ

realpatidar.com

રામનવમીએ યોજાશે પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ

ભાસ્કર ન્યૂઝ. દેશલપર (વાંઢાય)



જીણોદ્ધાર પામી રહલો ઉમાપતિ મહાદેવનો મંદિર. - ચેતન માવાણી

તપોભૂમિ વાંઢાયમાં ઉમિયા માતાજીની પ્રાણપ્રતિષ્ઠા પછી બાજુમાં જ ઉમાપતિ મહાદેવ મંદિરનું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. બંસી પહાડપુરના પથ્થરમાંથી કંડારીને શિલ્પકળાથી સુશોભિત શિવ મંદિરનું નિર્માણ કરવામાં પચાસ લાખ જેટલો ખચે થયો છે. તા. 30/3થી તા. 1/4 દરમિયાન પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે, જેની હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

કન્વીનરો અને સહ કન્વીનરોની મીટિંગમા કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરાઇ હતી. તા. 30/3ના સવારે યજ્ઞ અને પદયાત્રીઓના સામૈયું કરવામાં આવશે. સવારે 9 વાગ્યે સ્વામીધર્મબંધુજી (પ્રાંસલા), હરિદાસજી મહારાજ (હરિદ્વાર) તથા અન્યો સંતો, મહંતો આશીર્વચન આપશે. બપોર બાદ ઉમાપતિ મહાદેવ પ્રાણપ્રતિષ્ઠા તેમજ એ પ્રસંગે આવતી વિવિધધાર્મિક વિધિઓના યજમાનો દ્વારા ચડાવા લેવામાં આવશે. બીજા દિવસે વિવિધ ઝાંખીઓ સાથે શોભાયાત્રા નીકળશે. બપોર બાદ રવિલાલ કેસરા રામજિયાણીના પ્રમુખસ્થાને સામાજિક સભા યોજાશે, જેમાં પુરુષોત્તમ રૂપાલા, ગંગારામ સાંખલા, જેઠાભાઇ ચોપડા, અનીલભાઇ પટેલ, નરોત્તમ પટેલ, નિતિન પટેલ, વાસણભાઇ આહિર, ઓધવજીભાઇ પટેલ, ધનજીભાઇ સેંઘાણી ઉપસ્થિત રહેશે. રાત્રે 9 વાગ્યે કસુંબલ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા દિવસે (રામનવમી) સવારે બ્રહ્મલીન સંત લાલરામજી મહારાજ અને સંત ઓધવરામજી મહારાજની ભાવવંદના કરવામાં આવશે, સાથે ઉમિયા માતાજી મંદિરમાં પાટોત્સવ પૂજન અને ધ્વજારોહણ કરવામાં આવશે. દાતાઓના સન્માન કરવામાં આવશે.

સાર સમાચાર

ગાંધીધામના ગ્રાહકોને લૂંટનારા 18 વેપારી દંડાયા

ભુજ : તોલમાપખાતાએ હાલે ગ્રાહકો સાથે છેતરપિંડી કરનારા વેપારીઓ પર ધોંસ બોલાવી છે. તાજેતરમાં સુખપરમાં દરોડા પાડી 12 જેટલા વેપારીઓને સાણસામાં લીધા બાદ તોલમાપખાતાએ ગાંધીધામ ખાતે દરોડા પાડી ગાંધીધામના વેપારીઓમાં ફફડાટ ફેલાવી દીધો હતો. તપાસ દરમિયાન 18 વેપારી છેતરપિંડી કરતા પકડાયા હતા. જાણવા મળતી વિગતો મુજબ ગાંધીધામમાં તોલમાપખાતાની મોબાઇલ ડ્રાઇવમાં 18 વેપારીઓ વજનમાપ તથા પેકેજ કોમોડિટીના નિયમોનો ભંગ કરતા પકડાયા હતા જેમાં 6 વેપારી પર વજનમાપના તથા 12 વેપારીઓ પર પેકેજ કોમોડિટી કેસ કરી ગ્રાહકો સાથે છેંતરપીંડી કરનારા 18 વેપારીઓને 8850નો દંડ ફટકારાયો હતો.

ભુજમાં ચાખ ટાપુના સૌંદર્ય અંગે ખાસ સેમિનાર

ભુજ : ભુજમાં વન ચેતના કેન્દ્ર મધ્યે એરિડ કોમ્યુનિટીસ એન્ડ ટેક્નોલોજીસ (એ.સી.ટી.) અને કચ્છ જે કારાયલ જો કેકારાવના સંયુક્ત ઉપક્રમે તા.31/3ના શનિવારે સાંજે 6થી 7 દરમિયાન મુન્દ્રા તાલુકાના ચાખ ટાપુના સૌંદર્ય અંગે ખાસ સેમિનાર યાજાશે. જેમાં મુન્દ્રાના પત્રકાર અશ્વિન ઝીંઝુવાડિયા વિવિધ માહિતી આપશે, જ્યારે ફોટોગ્રાફ સાથે અશોક ચૌધરી સહયોગ આપશે તેવું યોગેશ જાડેજા, અખિલેશ અંતાણી, નવીન બાપટની યાદીમાં જણાવાયું છે.

ભુજમાં 15મીએ એક્સ સર્વિસમેનની રેલી

ભુજ : અત્રેના કોન્ટોમેન્ટ વિસ્તારમાં 15મી એપ્રિલે એક્સ સર્વિસમેન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સેનાના અધિકારીઓ, નિવૃત્ત જવાનો, બેંકના અધિકારીઓ સાથે મળીને એક્સ સર્વિસમેનની સમસ્યાઓ જાણી હલ કરાશે. રેલીનો પ્રારંભ આરટીઓ રિલોકેશનની બાજુમાં આર્મિકેમ્પમાં સવારે 9:30 વાગ્યે થશે. આ રેલીમાં લાવવા લઇ જવા માટે સવારે સાત વાગ્યાથી ગાંધીધામ 401 એડી.રેજીમેન્ટ અંજાર બસ સ્ટેશન, ભુજ રેલવે સ્ટેશન, ભુજ બસ સ્ટેશન અને ભદ્રેશ્વરમાં વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવાયુ છે.

રંગભૂમિની ગઇકાલ-આજ ઉપર વાર્તાલાપ

ભુજ : આકાશવાણી ભુજ પરથી ભુજના રંગકર્મી નાટય નિર્માતા જગદીશ ભટ્ટનો રંગભૂમિની ગઇકાલ અને આજ પર વિસ્તૃત વાર્તાલાપ વિશ્વ રંગભૂમિ દિને તા. 27/3ના સવારે 7:30 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે, જેમાં કચ્છની રંગભૂમિ પર પણ પ્રકાશ પાડવામાં આવશે.

જોધપુરની ટ્રેન હવે મોકલસર પણ ઊભશે

ગાંધીધામ : ગાંધીધામ-જોધપુર વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ દોડતી ટ્રેનને મોકલસર સ્ટેશન પર સ્ટોપેજ આપવાની ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની માગણી રેલવે તંત્ર દ્વારા સંતોષવામાં આવી છે. ચેમ્બરના માનદ્મંત્રી મુરલીધર જગાણીના જણાવ્યા મુજબ મોકલસર એક અગત્યનું સ્ટેશન હોવાથી તેમજ રાજસ્થાનના અન્ય શહેરો માટેના જોડાણ માટે કડીરૂપ હોવાથી ચેમ્બર દ્વારા રેલવેમંત્રી અને રેલવે બોર્ડ સમક્ષ સ્ટોપેજ આપવા રજૂઆત કરવામાં આવી હતી. જેના પ્રતિસાદરૂપે 10મી એપ્રિલથી જોધપુર આવતી-જતી ટ્રેન મોકલસર ઊભી રહેશે. ટ્રેન બે કલાક મોડી ઉપાડવા તેમજ ટ્રાફિકનું ભારણ વધતાં આ ટ્રેન દૈનિક ધોરણે દોડાવવાની રજૂઆત રેલવે દ્વારા કરવાની રજૂઆત કરી હતી.

ગેડીમાં શિક્ષણ સુધારણા અંગે શિબિર

ભુજ : કચ્છ જિલ્લા પંચાયત સમાજ કલ્યાણ અને કચ્છ વિકાસ ભારતી ગેડી આયોજિત અનુસૂચિત જાતિ સમાજ શિક્ષણ સુધારણા અને જનજાગૃતિ શિબિર તા. 28/3ના બુધવારે બપોરે બે વાગ્યે અનુસૂચિત જાતિ છાત્રાલય ગેડીમાં યોજાશે. શિબિરનું ઉદ્ઘાટન વિનોદભાઇ ચાવડાના હસ્તે કરાશે, આ તકે મહાદેવભાઇ એચ. જોગુ, ગાભાભાઇ એચ. ગોહિલ, કે.એચ.ઝાલા, કે.એ.પ્રજાપતિ ઉપસ્થિત રહેશે.

નખત્રાણામાં ડોકટર પર હુમલો કરનારા સામે પગલાં ભરો

ભુજ : તાજેતરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર નખત્રાણાના મેડિકલ ઓફિસર્સ ડો. મદનજી પ્રસાદ અને ડો. નૂપુર કુમારી ઉપર જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન પ્રદ્યુમનસિંહ જાડેજાએ ફરજ દરમિયાન મારા મારી, ધાકધમકી કરી હતી. આવા કૃત્યને ગુજરાત ઇનસર્વીસ ડોક્ટર્સ એસોસિયેશનના પ્રમુખ ડો. એસ.કે. મોડે સખત શબ્દોમાં વખોડી પગલાં ભરવા માંગ કરી છે. ગુજરાત ઇનસર્વિસ ડોકટર્સ એસોસિયેશનની કરોબારીમાં આ બાબતની ગંભીર નોંધ લઇ કચ્છ કલેકટર તથા ડીએસપીને આવેદનપત્ર આપી આ શખ્સ સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાશે.

ગાગોદરમાં મહિલાઓને યોજનાની માહિતી અપાઇ

જૂના કટારિયા : જાગૃત્તિ મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા ગાગોદર ગામે મહિલા સભ્યો સાથેની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 60 જેટલા સભ્યે હાજર રહી વિધવા સહાય, સ્વસહાય જૂથની કામગીરી, ગૃહઉદ્યોગની જુદી જુદી તાલીમો અંગેની ચર્ચા કરી હતી. ઉપરાંત, બી.પી. એલ. કુટુંબના બહેનોને મળતી યોજનાઓ, ફોર્મ ભરવા અંગેની પણ વિચારણા કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ રૂડીબેન બી.પટેલે મહિલાઓને જાગૃત કરવા તેમજ સ્વનિર્ભર કરવા માટે પ્રયત્ન કરવા અંગે સમજ આપી હતી.

સુખસાણથી જડેશ્વર મહાદેવમંદિરનો માર્ગ બિસમાર

સાંયરા(યક્ષ) : નખત્રાણા તાલુકામાં આવેલાં પ્રાચિનતીર્થ એવા જડેશ્વર મહાદેવનો માર્ગ લાંબા સમયથી બિસમાર હાલતમાં ફેરવાતાં યાત્રિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, જેનું મરંમતકામ સત્વરે કરાવવા ભાવિકોમાં માંગ ઉઠી છે. પ્રાપ્ત માહિતી મુજબ સુખસાણથી જડેશ્વર મહાદેવમંદિર સુધીના માર્ગમાં ઠેરઠેર ખાડા પડી ગયા છે, તેને યોગ્ય મરંમત કરવા મોસુણા, ગંગોણ, સુખસાણ, સાંયરા, આણંદપર, નારણપર, વિભાપરે માંગ કરી છે.

અવસાન નોંધ

ગાંધીધામ (ગળપાદર) : મૂળ મંજલના ગં.સ્વ. રતનાબેન નારાણભાઇ(લાંબા) ગઢવી (ઉ.વ.75) તે સ્વ. નારાણભાના પત્ની, ઈશ્વરભા, બળદેવભા તથા લક્ષ્મીબેનના માતા, રમીલાબેનના સાસુ, સુરેશ, જયા, કિરણના દાદીમા તા. 26/3ના અવસાન પામ્યાં છે. તેમની સાદડી તા. 29/3ના સાંજે ૫:30થી 6:30 યોગેશ્વરનગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગળપાદર, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : ઠા. હરિલાલ ચમનલાલ દક્ષિણી (ઉ.વ.૬૨) તે સ્વ. ચમનલાલ કુંવરજી (મૂળ કુંભારડી, તા.ભચાઉ) ના મોટા પુત્ર, સ્વ. હરજીવન (મુંબઇ)ના ભત્રીજા, વિજયાબેનના પતિ, સ્વ. કનૈયાલાલ, સ્વ. પ્રવીણભાઇ, પ્રતાપભાઇ, ભવાનીબેન અમીચંદભાઇ, દમયંતી ધીરજલાલ, સુશીલાબેન રાજેશકુમારના મોટા ભાઇ, વિનોદ, સ્વ. કૈલાસ, સ્વ. પ્રવીણાબેનના પિતા, ઉર્વિ, ખુશીના દાદા, ઠા. ગણેશ ધનજી મીરાણી (રામવાવ) ના દોહિત્ર, સ્વ. નારાણજી રામજી (મીઠીરોહર)ના મોટા જમાઇ તા.૨૫/3ના અવસાન પામ્યા છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.૨7/3ના મંગળવારે સાંજે 5થી 6 નૂતન લોહાણા મહાજનવાડી, ભારતનગર, ગાંધીધામ મધ્યે.

આદિપુર : કચ્છી સારસ્વત બ્રાહ્મણ ગં.સ્વ. રાધાબેન (ઉ.વ.70) તે સ્વ. જોષી જેષ્ટારામ નારાયણજી બલભદ્રના પત્ની, સ્વ. વિશનજી નારાયણજી બલભદ્રના નાના ભાઇના પત્ની, સ્વ. બચુબેન વિશનજી બલભદ્રના દેરાણી, વાલજીભાઇ, સ્વ. તુલસીદાસભાઇ, રમેશભાઇ, શાંતિલાલભાઇ, ગૌરીબેનના કાકી, વિનોદ, વિજય, હસમુખ, કલ્પેશ, પ્રકાશના દાદી તા.૨૫/3ના અવસાન પામ્યાં છે. તેમની પ્રાર્થનાસભા/ઉઠમણું તા.૨૮/3ના સાંજે 4થી ૫ લોહાણા મહાજનવાડી, આદિપુર મધ્યે.

અંજાર : શ્રીમાળી બ્રાહ્મણ શાંતાબેન દવે (ઉ.વ.80) તે સ્વ. શશિકાંત દોલતરાય દવે (નિવૃત્ત શિક્ષક) ના પત્ની, સ્વ. વસંતભાઇ, સ્વ. મહેન્દ્રભાઇના ભાભી, નિરંજનભાઇ (બેંક ઓફ ઇન્ડિયા, નિરોણા), ભગવતીપ્રસાદ (પ્રમુખ બ્રાહ્મીન સોશ્યલ કલબ અંજાર), સ્વ. કીર્તિભાઇ, યોગેશભાઇ, સુરેશભાઇ (સીન્ડિકેટ બેંક, ગાંધીધામ), અનિલ (એમ.આઇ.સી.ટી. મુન્દ્રા), ઉષાબેન સુરેશભાઇ, પ્રવીણાબેન ધર્મેન્દ્રભાઇના માતા, રીટાબેન, વિશાખાબેન (શિક્ષિકા અં.ન.પ્રા. શાળા નં.3), માયાબેન, ઈલાબેન, સોનલબેનના સાસુ, શૈલેશ (ગેટકો, ભીમાસર (ભુ.)), સતિષ, પંકજ, ભરતના મોટા બા, પાર્થ, કવન, જિગર, હર્ષ, મીત, મોહિત, પ્રણાલી નિરજકુમાર (મુન્દ્રા), ઇરા દિવ્યેશકુમાર (અમદાવાદ), વૃતિ, વિભૂતિ, આયુષિ, ધાત્રીના દાદી, પ્રેક્ષાના પરદાદી તા.૨૫/3ના અવસાન પામ્યાં છે. તેમની પ્રાર્થનાસભા (ભાઇઓ તથા બહેનોની સાથે) તા.28/3ના સાંજે ૫થી 6 દરમિયાન ભાટિયા મહાજન કોમ્યુનિટી હોલ, ટેલિફોન એક્સચેન્જ પાછળ, અંજાર મધ્યે.

મુન્દ્રા : મૂળ ડુમરા રાજગોર મમીબાઇ (ઉ.વ.10૨) તે સ્વ. કલ્યાણજી વીરજી ભટ્ટના પત્ની, સ્વ. શંભુલાલ, દયારામ, મૂળજી (સિટી સર્વે), રૂક્ષ્મણિબેન, મોઘીબેન, લખમીબેન, ઉર્મિલાબેન, નવલબેનના માતા, સ્વ. ગુલાબ, ભાવિકા, લતા, નીતાના દાદી, સ્વ. મેઘજી વેલજી માલાણી (ભોજાય)ના બહેન, સ્વ. ધનજી મેઘજી ભટ્ટ (ડુમરા)ના કાકી તા.૨૫/3ના અવસાન પામ્યાં છે. તેમની પ્રાર્થનાસભા તા.૨૮/3ના સાંજે 4થી ૫ દરમિયાન ગિરિનારાયણ બ્રહ્મસમાજની સમાજવાડી, કાંઠાવાળા નાકા, મુન્દ્રા મધ્યે.

માંડવી : મોઢવણિક સાવિત્રી (ઉ.વ.32) તે નિલેશ હિંમતલાલ મણિયાર (દીપા ઇલેક્ટ્રીક એન્ડ રેફ્રીજરેશન) ના પત્ની, હિંમતલાલના પુત્રવધૂ, ભુવનેશ (કાગદી ખેતશી વેલજી), ગીતા દીપકકુમાર દોશી (વાંકાનેર) ના ભાભી, લક્ષ્મીદાસ (જામનગર), પુષ્પકાંત (મુંબઇ), ઉરેશ (જામનગર), અશ્વિન (કાગદી ખેતશી દેવજી) ના ભત્રીજાવધૂ, દક્ષના કાકી તા.૨6/3ના અવસાન પામ્યાં છે. તેમની પ્રાર્થનાસભા તા.૨૮/3ના 4:30થી 5:30 દરમિયાન રાજપૂત સમાજવાડી મધ્યે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

માંડવી : જોગી મંથન (ઉ.વ.4) તે સગુણાબેન શિવજીના પુત્ર, રજનીબેન પ્રદીપભાઇના પૌત્ર, પ્રેમજી જેસાના દોહિત્ર, નરેન, જયોતિ, પ્રીતિબેન ભરત જોગી, જયોતિબેન કિશન જોગીના ભત્રીજા, અશોક પ્રેમજી, મયૂર જોગીના ભાણેજ તા.૨૫/3ના અવસાન પામ્યા છે.

માધાપર (ભુજ) : ચંપાબેન પ્રેમજી ભુડિયા (ઉ.વ.43) તે સ્વ. માવજી પરબત ભુડિયા તથા ગં.સ્વ. કાનબાઇ માવજી ભુડિયાના પુત્રવધૂ, પ્રેમજી માવજી ભુડિયાના પત્ની, જગદીશ, અશોક, નંદુ, દમયંતીના માતા, નંદુબેન જગદીશ, કાંતિ, દિનેશના સાસુ, રિયા, ખુશીના નાની તા.૨6/3ના અવસાન પામ્યાં છે. તેમનું બેસણું તા. ૨૮/3ના સવારે 8થી 9 કલાકે લોકલ બોર્ડ હોસ્પિટલ સામે, ભુડિયા બજાર, નંબર-3, માધાપર મધ્યે.

ખંભરા (અંજાર) : દેવુંબા દેવાજી ચૌહાણ (ઉ.વ.90) તે પોપટસિંહ, ગગુભા, જટુભાના માતા, મયૂરસિંહ, જસુભા, જયેન્દ્રસિંહ, રામદેવસિંહના દાદી, વજુભા, વખતસિંહ, વનરાજસિંહ, મહેન્દ્રસિંહ, અજયસિંહના નાની તા.૨૫/3ના અવસાન પામ્યાં છે. તેમની સાદડી/ઉત્તરક્રિયા ખંભરા તેમના નિવાસસ્થાને.

સિનુગ્રા (અંજાર) : નિઝારઅલી જાફરઅલી હીરજી કેશવાણી (ઉ.વ.૫7) તે જાફરઅલી હીરજી કેશવાણીના પુત્ર, બદરૂદીન (પા.પુ.બોર્ડ), અમીન (મુંબઇ), મલીક (રિક્ષાવાળા), યાસ્મીનબેન, શહેનાઝ, અજમીના, ફરીદા, સલીમાના મોટા ભાઇ, મોસીનભાઇ (મુંબઇ), અમીરઅલી, રફીક, સુલેમાન (ગાંધીધામ)ના સાળા, મુખી કબીરૂદીન કે. દામાણી (નાગલપર)ના ભાણેજ તા.૨6/3ના અવસાન પામ્યા છે. તેમની જિયારત તા.૨૮/3ના સવારે 11 કલાકે ખોજા જમાતખાના સિનુગ્રા ખાતે તથા સાદડી સાંજે 4થી ૫ દરમિયાન ખોજા સમાજવાડી સિનુગ્રા મધ્યે.

દેવપુર(ગઢ) (માંડવી) : મહેશ્વરી સમાજ ભોઇયા આશબાઇ તેજશીભાઇ (ઉ.વ.7૫) તે સ્વ. તેજશી થાવરભાઇના પત્ની, નરશીભાઇ (ગાંધીધામ), મોહન (ગાંધીધામ), ચાંપશી, કાંતાબેન લાલજી હેંગણા (દરશડી), ધનબાઇ જુમા ફુફલ (ગાંધીધામ)ના માતા, લક્ષ્મણ, સ્વ. ખીમજી બુદ્ધા ડુંગરખિયા (માંડવી)ના બહેન, વાલબાઇ, સ્વ. શાંતાબેન, નાનાબાઇના સાસુ, પપ્પુ, પરેશ, દિનેશના ફઇ, રંજન, હંસા, કલ્પના કિરણ, પ્રિયંકા, પારૂલ, ભાવના, ગીતા, અશ્વિન, મોહન, ધીરજ, હર્ષના દાદી તા.૨૫/3ના અવસાન પામ્યાં છે. તેમની ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે.

ભુજપુર (ભચાઉ) : નિતિન નારણભાઇ સથવારા (ઉ.વ.18) તે નારણભાઇ તથા સામાબેનના પુત્ર, રમેશ, જયાબેન, રતનબેન, દક્ષાબેન, હેતલબેન, મીનાબેનના ભાઇ, કાંતાબેનના દિયર, મેહૂલ, જિગર, રાહુલના કાકા તા.૨૫/3ના અવસાન પામ્યા છે.

નાના અંગિયા (તા.નખત્રાણા) : કડવા પાટીદાર સમાજ હાલે ભુજ વાલજીભાઇ માવજીભાઇ પારસિયા (ઉ.વ.8૨) તે ગં.સ્વ. વાલુબેનના પતિ, ઘનશ્યામ, ચંપકલાલ (બન્ને ભુજ), ગીતાબેન (સુરત), લીલાબેન (બેંગ્લોર), ભગવતીબેન (પિંપલગાંવ-નાશિક), ઉર્મિલાબેન (વિથોણ)ના પિતા, કમલેશ તથા કાર્તિકના દાદા તા.૨6/3ના અવસાન પામ્યા છે. તેમની સાદડી નાના અંગિયા ખાતે તેમના નિવાસસ્થાને.

કોકલિયા (માંડવી) : હાલે નલિયા જાડેજા દિલુભા રાયબજી (ઉ.વ.44) તે અનુભા જટુભાના ભત્રીજા, પ્રવીણસિંહ, પ્રભાતસિંહના ભાઇ, રાજેન્દ્રસિંહ, પ્રિયરાજના પિતા, ધર્મદીપસિંહ, પ્રવીણસિંહના મોટા બાપુ તા.૨4/3ના અવસાન પામ્યા છે. તેમની ઉત્તરક્રિયા તા.4/4ના નિવાસસ્થાન કોકલિયા ખાતે.

બિટ્ટા (અબડાસા) : અ.સૌ.ઠા. રાધાબેન રતનશીભાઇ (ઉ.વ.80) (મોટી ધુફીવાળા હાલે બિટ્ટા)તે ઠક્કર રતનશી વીરજીના પત્ની, ઠા. રણછોડદાસ કરસનદાસ તન્ના (બિટ્ટાવાળા)ના પુત્રી, ઠા. કાનજીભાઇ વીરજી, પ્રવીણભાઇ વીરજીના ભાભી, સ્વ. મહેન્દ્રભાઇ, સ્વ. મંજુલાબેન, પ્રતાપભાઇ, ભરતભાઇ (સીન્ડિકેટ બેંક), હરેશભાઇ, જગદીશભાઇ, નીતાબેન રસિકભાઇ અનમ (ભુજ)ના માતા, રાજેશ, અનિલ, નિતિન, રૂપેશ, જીતેશ, ધીરેન, વિવેક, ડોલી, ઉમંગ, ભક્તિ, મૈત્રી, ઉર્વિના દાદી તા.૨6/3ના અવસાન પામ્યાં છે. તેમની પ્રાર્થનાસભા તા.૨૮/3ના સાંજે 4થી ૫ કલાકે તેમના નિવાસસ્થાન બિટ્ટા મધ્યે.

અમદાવાદ : શ્રીમાળી સોની હરિલાલ વિઠ્ઠલદાસ પારડિયા (ઉ.વ.૬૨) તે મૂળ વાંઢિયા હાલે અમદાવાદના સોની વિઠ્ઠલદાસ માનસંગના પુત્ર, સ્વ. રતિલાલ, સ્વ. કાશીરામ, સ્વ. શંકરલાલના નાના ભાઇ, ગં.સ્વ. લખમીબેનના પતિ, કલ્પના, બીના, જશ્મીન, મનીષાના પિતા, જિતેન્દ્ર, અશોક, ગાયત્રીના સસરા, સ્વ. ગુણવંત, રજનીકાંત, સ્વ. નવીન, દેવબાળાબેન, અશ્વિન, હસમુખ, સંજયના કાકા, ઝીંઝુવાડિયા ઇંદરજી ગણેશ (અંજાર)ના જમાઇ, નિમેષ, અમિત, ચિરાગ, વંશ, ઝીલના દાદા તા.૨4/3ના અવસાન પામ્યા છે.

સિક્કા : જનકરાય પ્રતાપશંકર દેસાઇ (ઉ.વ.8૨) નિવૃત્ત કર્મચારી જી.ઇ.બી ભાવનગર તે નવીનચંદ્ર પી. દેસાઇ (ધુવારણ)ના લઘુબંધુ, ચંદ્રેશભાઇ (મોરબી), અમિતભાઇ (થર્મલ પાવર સ્ટેશન સિક્કા) તથા વિજયભાઇ (ભાવનગર)ના પિતા તા. 25/3ના સિક્કા ખાતે અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. 27/3ના સાંજે 4.30 થી 5.30 દરમિયાન સિક્કા થર્મલ પાવર સ્ટેશન કોલોની, તૃપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે.

મુંબઇ મરણનોંધ

છસરાના સ વૈભવ (ઉં.વ.21) 24-3-12ના બેંગલોર મધ્યે અવસાન પામેલ છે. રમીલા ધીરજ ગંગરના પુત્ર. સ્વ. ધનજી માલસીના પૌત્ર. (અમૃતબાઈ) મ.સા. લક્ષ્મીબેનના પૌત્ર. સ્વ. હાર્દિક સ્વ. અખીલ, ફોરમના ભાઈ. ગુંદાલાના ધવલ વસંત છાડવાના સાલ. ગં.સ્વ. મણીબેન મગન છેડાના દોહિત્ર. વડાલાના ગં.સ્વ. શાંતા દામજી છસરાના રંજન ચંદ્રકાંત સ્વ. કુસુમ, જયશ્રી પ્રફુલ સં.પ. અમિતજ્યોતિજી (મીના)નો ભત્રીજો. વડાલાના રીંકુ વિજયના મામાઈ દીયર. પ્રા. ક.વી. ઓ. જૈન સ્થાનક, તુલીંજ, નાલાસોપારા (ઈ), સ્થળ: એ-103, ગુલનાર તળાવપાડી, આચોલે, નાલાસોપારા (ઈ), મુંબઈ.

કપાયાના : સૌ. ઉર્મિલા ધનજી દેઢિયા (ઉં.વ.67) 24-3-12ના અવસાન પામ્યા છે. ધનજીના પત્ની. નાનબાઈ (ભચીબાઈ) લાલજી ખીંયશીના પુત્રવધૂ. વર્ષા, મનીષા, કાજલ, અર્ચનાના માતાજી. બેરાજાના પ્રદીપ પ્રેમજી, કોટડા (રોહા)ના તરુણ નાનજી, વડાલાના દીપને કાનજીના સાસુ. ડુંગરશી, રાઘવજી, મુંબઈ લક્ષ્મી ડી. શા, કપાયાના પ્રભા ધીરજ, સાડાઉના નૂતન વસંતના ભાભી. શાંતાના દેરાણી. રેખાના જેઠાણી. પ્રાર્થના રાખેલ નથી. ઠે: સુમતી નિવાસ, 2જે માળે, રામનગર, ડોમ્બિવલી (ઈ), થાણા.

લુણીના : ગં.સ્વ. વાસંતી તલકશી દેઢિયા અવસાન પામેલ છે. (ઉં.વ.64) સ્વ. ગંગાબાઈ માલશી કાંઈઆના પુત્રવધૂ. સ્વ. તલકશીના પત્ની. કલ્પના, સ્વ. પરાગ, પલ્લવી, દિપાના માતુશ્રી. બુદ્ધિબાઈ વસનજીના ભત્રીજા વહુ. સમાઘોઘાના મનોજ કાંતિલાલ, ભોજાયના રમેશ કલ્યાણજીના સાસુ. પાર્થ, દિપ, તિર્થના નાની. કંચન, શૈલેષ, પ્રકાશના ભાભી. સરલા, પ્રફુલ્લાના જેઠાણી. રતાડીયા ગ. ના રમણીકલાલ પ્રેમજી ફુરિયાના સાલના ઘરેથી. પ્રા. શ્રી. વર્ધ, સ્થા. જૈન શ્રા. સંઘ-દાદર. કરસન લધુ નિસર હોલ, ઠે: એ-13, પદમાકર સોસા., ડોમ્બિવલી (પૂ), મુંબઈ.

રતાડિયા (ગ.)ના : રામજી વીરજી (ઉં.વ.92) અવસાન પામેલ છે. ખીમઈબેન વીરજી કોરશીના પુત્ર. લક્ષ્મીબાઈના પતિ. સ્વ. ચંચળ (હસુમતી), સ્વ. દમયંતી (નીલમ), રસીક, ચંદ્રિકા, સુરેશ, શીલા, સુરેન્દ્રના પિતા. પ્રેમજી, ગં.સ્વ. પાનબાઈ જાધવજી, કપાયા સ્વ. સુંદરબેન દેવજી, સાડાઉ સ્વ. લીલબાઈ કુંવરજી, વડાલા સ્વ. કુંવરબાઈ રામજી, ગં.સ્વ. ઉમરબાઈ મેઘજી, ભોરારા ગં.સ્વ. વેલબાઈ મગનલાલના ભાઈ. પ્રા. શ્રી. વ.સ્થા. જૈન શ્રા. સં.સં. કરશન લધુ નિસર હોલ, (દાદર) ઠે: 3-અંબર, બી.જે.પી. રોડ, મલાડ.

નલિયાના કાલિકા મંદિરના પૂજારીની ચિર વિદાય

નલિયા : નલિયામાં કાલિકા માતાજી મંદિરના પૂજારી દિલુભા રાયબજી જાડેજાનું નિધન થતાં શોકની લાગણી ફેલાઇ છે. તેમને દિનેશભાઇ મૈડેયાર, નરેન્દ્રસિંહ જાડેજા, રામજીભાઇ અબોટી, મૂલચંદભાઇ લુહાર, તખુભા જાડેજાએ અંજલિ આપી હતી.

નખત્રાણા સોની સમાજના પ્રમુખના માતા શાંતાબેનના નિધનથી શોક ફેલાયો

નખત્રાણા : નખત્રાણા સોની સમાજના પ્રમુખ અને માજી સરપંચ હિરાલાલ મોહનલાલના માતા શાન્તાબેનનું અવસાન થતાં સોની સમાજમાં શોકની લાગણી ફેલાઇ છે. તેમની પ્રાર્થનાસભામાં ઓલ ઇન્ડિયા સોની સમાજના પ્રમુખ પ્રભુદાસભાઇ, ભુજ સમાજના કિશોરભાઇ, અંજાર સોની સમાજના પ્રમુખ શિવલાલભાઇ, નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઇ સોમઝિયાણી, સરપંચ ડાયાભાઇ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મમુભાઇ આયર સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો તેમજ ભાઇઓ અને બહેનોએ શ્રદ્ધાંજલિ આપી હતી.

અવસાનનોંધ : વિનામૂલ્યે આપવા માટે તમારા વિસ્તારના પ્રતિનિધિ અથવા દિવ્ય ભાસ્કર ભુજ અને ગાંધીધામ કાર્યાલયનો સંપર્ક કરવા વિનંતી. ભુજમાં મો. સંપર્ક : 96876 17688/94262 51974

Digitally Archived by: www.realpatidar.com/library

2012-03-27 -Divya Bhaskar -Bidada -Satpanth Samaj Protest [421]

બંધાણી બૂલબૂલ!

તસવીર **નૂરમામદ કાસમ**

'ચા વિના મને ચૈન ના પડે, મન મારું મુંઝાય છે', યા તો કારાણી બાપાવાળી 'ચાય-છાયજી તકરાર'માં ચા વિશે રમૂજ પ્રેરક કાવ્ય પંક્તિઓ ચિંતરંજન કરતી રહી છે. મનુષ્ય જીવનમાં 'મા' નામના એકાક્ષરી શબ્દની સાથે ચા પણ ઓતપ્રોત છે! ચા જે કોઇ વ્યસન નથી ગણતું શિષ્ટાચાર છે! પણ અહીં પક્ષી જગતમાં ચાનો પ્રવેશ વિચિત્ર રીતે જોઇ શકાય. છે. ગણેશપર(ખડીર)ના સવા ડોસાની વાડીએ રકાબીઓના અવાજની સાથે જ બુલબુલ નામનું પક્ષી ચાની ચૂસ્કી લેવા પહોંચી આવે છે, જ્યાં સુધી ચા ન મળે ત્યાં સુધી સતત અવાજ દ્વારા પોતાની હાજરી બોલાવતું રહે છે. બંધાણી બૂલબૂલની સાથે લેલી નામનું પક્ષી પણ અહો વૈચિત્ર્યમ!ની અદામાં જાણે કે બુલબુલને પૂછી રહ્યું છેઃ 'શું પીવો છો હુડિયાભાઇ!' સ્થાનિકે બૂલબૂલને હુડિયો કહે છે !

અંજારના હંગામી ટીડીઓને હટાવાયા

ભાસ્કર ન્યૂઝ. ભુજ

કરાર આધારિત કર્મચારીઓને સરકારની સૂચના વિના નોકરી પર ન રાખવા તેવા આદેશના પગલે અંજાર તાલુકાના તાલુકા વિકાસ અધિકારીને ફરજ પરથી મુક્ત કરાયા છે. તેમનો ચાર્જ ભચાઉના ટીડીઓને આપવામાં આવ્યો છે.

જિલ્લા પંચાયતના સત્તાવાર વર્તુળોએ આપેલી વિગતો અનુસાર રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર મુજબ કરાર પર કોઇ પણ કર્મચારીને સરકારની મંજૂરી વિના રાખવાના નથી. અંજારના ટીડીઓ એન. કે. શ્રીમાળી નિવૃત્ત હોવા ઉપરાંત કરાર આધારિત હોવાના લીધે તેમની ફરજ પૂરી કરવામાં આવી છે. તેમનો ચાર્જ ભચાઉના તાલુકા વિકાસ અધિકારી એલ. એમ. તળવીને સોંપવામાં આવ્યો છે.

પહાળી પ્રદેશના ગરીબ બાળકોના શિક્ષણ માટે ફંડ ભેગું કરવા અનોખો પ્રયાસ : માધાપરથી કર્યું પ્રસ્થાન

UKના યુવાનો રિક્ષામાં મનાલી જવા રવાના

કેર એજ્યુકેશન ટ્રસ્ટે નવચેતન અંધજન મંડળને 3.55 લાખનો ચેક અર્પણ કર્યો

ભાસ્કર ન્યૂઝ. માધાપર

મનાલી ખાતે ગરીબ બાળકો માટે આકાર લેતાં શિક્ષણ સંકુલમાં વધુ સુવિધા માટે જરૂરી ફંડ એકઠુ કરવાના હેતુથી યુ.કે.થી કચ્છ આવા માધાપર નવચેતન અંધજન મંડળથી રિક્ષા દ્વારા મનાલીની યાત્રાનો આજે લંડનના યુવાનોએ પ્રારંભ કર્યો હતો. યાત્રાના પ્રારંભે યુવાનોએ 3.55 લાખનો ચેક સંસ્થાના લાલજીભાઇ પ્રજાપતિને અર્પણ કર્યો હતો. ડેપ્યૂટી કમાન્ડર કર્નલ વી.એચ.યાદવ, હરીભાઇ ચાવલા, મહેશભાઇ ગુપ્તા, આર.જી.ભાલારા, ભરત સોલંકી, વિમલ ગુજરાલ, મહેશ ગુપ્તા, કરસન વરસાણી હરીભાઇ હાલાઇ લાલજી વરસાણીએ સ્ટાર્ટ આપ્યો હતો.

રિક્ષાઓ પણ દાનમાં આપી દેવાશે : ડીઝલ ઓટોરિક્ષાની પ્રવાસમાં પસંદગી કરી રાજકોટ-માધાપરની ફૂલુ-મનાલી પહોંચીને ત્યા બાળકોના વિકાસ માટે રિક્ષાઓ પણ દાન કરી દવાશે.

પ્રવાસમાં જવા સજ્જ થયેલી યુવતી. - ભૂપેન્દ્ર મહેશ્વરી

યુવતીઓ રિક્ષા ચલાવે તે લોકોને નવાઇ લાગે છે

ઘણી જગ્યાએ અમે સફર કરીએ છીએ ત્યારે લોકોને રિક્ષા,l યુવતિઓને ચલાવતાં જોઇ નવાઇ લાગે છે. તેઓ કહે છે કે, યુવતિઓ આવડી લાંબી સફર જાતે રિક્ષા ચલાવી શકે છે તે ઘણુ કહેવાય.

કોણ છે આ યુવક અને યુવતીઓ

મૂળ ગુજરાત-મુંબઇના અને હાલે યુ.કે.માં વિવિધક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કરવા સાથે ગરીબ બાળકોનો ઉત્થાન માટે સફર ખેડનારા છાત્રો છે. નિષિદ, ભાવિક, ચાંદની, દિલીશા, નિરવ, રવિના, અવની, આરતી, ઉત્થાન અને તેમની સોને તેમના માર્ગદર્શક પણ જોડાયા છે.

ગુજરાતની જનતાને ધન્યવાદ-થેંક્સ

ગુજરાતમાં આવ્યા બાદ અમને ઘણુ બધું ગાઇડન્સ અને માર્ગદર્શન તેમજ ખાસ તો રિક્ષાઓ શીખવાનો મોકો પણ મળ્યો. તેમજ વિવિધ જગ્યાઓ પર લોકોનો સારો અવો સહયોગ સાંપડ્યો છે કે, ક્યારે ભૂલાશે નહીં જેથી ગુજરાતની જનતાને ધન્યવાદ આપીએ છીએ થેંક્સ.

લોકોને અપીલ....

યુ.કે.કેર એજ્યુકેશન ટ્રસ્ટના યુવાઓએ ગરીબ બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે લોકોને અપીલ કરી હતી કે, અમે આ બાળકોના ઉત્થાન માટે લંડનથી ગુજરાત આવી કાર્યો કરીએ છીએ. તો અહીંના લોકો પણ આવા કાર્યોમાં જોડાય તો કોઇ પણ ગરીબ બાળક શિક્ષણ વગરનું નહીં રહે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આવાં બાળકોના ઉત્થાન માટે દેશ વિદેશમાં પ્રોગ્રામો કરી ફંડ જમાં કરી આવા કાર્યોમાં વાપરીએ છીએ અને બાળકોને મદદરૂપ થઇ પ્રશંસા અનુભવીએ છીએ.

ખાનાય રેપ કેસમાં આરોપીના જામીન રદ્ ફરમાવતી સેશન્સ કોર્ટ

છેડતીનો ગુનો નોંધાયા બાદ બળાત્કાર હોવાનું ખૂલ્યું હતું

ભાસ્કર ન્યૂઝ. ભુજ

અબડાસા તાલુકાના ખાનાય ગામમાં જબરદસ્તીથી પ્રેમી બનેલા શખ્સે એક તરુણીની શારીરિક છેડછાડ કરીને તેની ઉપર બળજબરીથી વાસના સંતોષી હતી.

જેમાં જેલહવાલે થયા બાદ આરોપીએ કરેલી જામીન પર મુક્ત થવાની અરજીને ભુજની સેશન્સ કોર્ટે રદ્ ફરમાવી હતી.

ખાનાયમાં ગત તા.3 માર્ચે એક તરુણી લગ્નપ્રસંગે મહેંદી મૂકાવીને ઘેર જતી હતી ત્યારે એક હવસખોર શખ્સે રાત્રે અંધારાનો લાભ લઇને તેની ઉપર બળજબરી કરી વાસના સંતોષી હતી. બીજા જ દિવસે આ અંગે નલિયા પોલીસમાં આરોપી મહંમદરફીક ઉર્ફે લોગ નૂરમામદ નોડે સામે પહેલાં છેડતીનો ગુનો નોંધાયો હતો. પછી તબીબી રિપોર્ટમાં રેપ થયાનું બહાર આવતાં આઇપીસી 376નો ઉમેરો થયો હતો. ધરપકડ પછી આ આરોપીને કોર્ટમાં રજૂ કરાયા બાદ તેને જેલહવાલે કરાયો હતો.

જામીન પર મુક્ત થવા માટે તેણે ભુજના છઠ્ઠા એડિશનલ સેશન્સ જજ એન.એમ. કરોવડિયાની કોર્ટમાં કરેલી અરજીની સુનાવણી થઇ જતાં આ અરજીને ન્યાયમૂર્તિએ ફગાવી દીધી હતી. આ કેસમાં સરકાર તરફે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર ચંદ્રકાંત ગુજરાતીએ હાજર રહી દલીલો કરી હતી.

અરજીને રદ ફરમાવતા જજે એવી ટકોર પણ કરી હતી કે, આરોપી ખુદના ભાવિની ચિંતા કરે છે, પણ ગુનો આચરતાં પહેલા તરુણીના ભવિષ્યની ચિંતા કરી નહોતી.

31 કરોડની વસૂલાત મુદ્દે કેડીસીસીની આજે બેઠક

ભાસ્કર ન્યૂઝ. ભુજ

કે.ડી.સી.સી. બેંકની બોર્ડ ઓફ ડાયરેક્ટરની આજે યોજાનારી બેઠકમાં કોઠારા, માંડવી બ્રાન્ચ પર બાકી નીકળતા 30 કરોડના લેણા મુદ્દે તડાપીટ થાય તેવા એંધાણ છે.

કોઠારા અને માંડવી બ્રાન્ચ ખાતેથી સ્થાનિક ખેડૂત મંડળીઓ દ્વારા 37 કરોડના રકમ લોન પર લેવાઇ હતી પરંતુ તેના ભરણામાં કોઇ ઠેકાણા નથી પરિણામે રિઝર્વ બેંકના નિયમા પ્રમાણે જો આ રકમની ભરપાઇ 31 માર્ચ સુધી કરવામાં નહીં આવે તો બેંકના લાઇસન્સ કેન્સલ થવાની નોબત આવી શકે છે 37 કરોડ પૈકી 6 કરોડ ભર્યા બાદ બાકીની 31 કરોડની રકમ માટે ૨૦/3/12 સુધીની મુદ્દત મગાઇ હતી પરંતુ તે મુદ્દત પૂરી થવાને આજે 7 દિવસ થયા છતાં એક પણ રૂપિયાની વસૂલાત થઇ નથી.

આજે યોજાનારી બેઠકમાં બાકી રહેતા 31 કરોડ લેણાની વસૂલાત મુદ્દે નવાજૂની થવાના એંધાણ છે.

WALK-IN-INTERVIEW
HD MICRONS LIMITED
HD Microns Ltd. is a leading Industrial Mineral Process Industry & having our large setup in over all India. We require,
Lab Chemist
B.Sc. / M.Sc./LACP (Any Stream) with at least 1-2 years lab testing experience with computer literacy.
Interested candidate may walk-in-with update Resume & latest pay slip on 29/03/2012 & 31/03/12 at 10:00 am to 1:30 pm & 3:30 pm to 6:00 pm at.
HD Microns Ltd. Pooja "A", Above ICICI Bank, Station Road, Bhuj-Kutch 370 001. Ph : (02832) 251135, 250972



Digitially Archived by: www.realpatidar.com/library

દેશલપર પાસે હાજીપીરથી પરત જતા પાંચ યાત્રિક અકસ્માતે ઘવાયા

realpatidar.com

લાકડિયા પાસે ટ્રેઇલર અને ટ્રેક્ટરના અકસ્માતમાં બે ઘવાયા

ભાસ્કર ન્યૂઝ. ભુજ, લાકડિયા

લાકડિયા અકસ્માતમાં ઘવાયેલો યુવાન, અને દેશલપર પાસે થયેલી ટક્કર - કેશવ મચ્છોયા, ચેતન માવાણી

ભુજ તાલુકાના દેશલપર(વાંઢાય) પાસે હાજીપીરથી પરત ફરતા જામનગરના પાંચ યાત્રિક માર્ગ અકસ્માતમાં ઘવાયા હતા. જ્યારે લાકડિયા નજીક મઢી ત્રણ રસ્તા પાસે સોમવારે સવારે એક ટ્રેઇલર આગળ જઇ રહેલા ટ્રેક્ટર પર ચડી જતાં ટ્રેક્ટરની ટ્રોલી ઉંધી વળી ગઇ હતી. આ અકસ્માતમાં ટ્રેક્ટરમાં સવાર બે મજૂરને ઇજા પણ પહોંચી હતી.

પોલીસ સૂત્રોએ કહ્યું કે, જામનગરના અયુબ સુલતાન ઠેબી(26), નૂરમામદ જુમા ઠેબી(25), ફકીર ઇબ્રાહીમ(55), સદામ હુસૈન ઠેબી(15), યુસુફ બાબી ખત્રી(35) હાજીપીરના દીદાર કરીને છકડામાં બેસીને પરત જતા હતા ત્યારે દેશલપર પાસેની ગોલાઇ પર સામેથી એક ડમ્પરના ચાલકે ઠોકર મારી હતી. પાંચેયને ઇજા થતાં સારવાર માટે જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા.

લાકડિયા પોલીસે જણાવ્યું હતું કે, સવારે 10:30 વાગ્યાના અરસામાં સિમેન્ટના બ્લોક ભરીને જઇ રહેલા ટ્રેક્ટર નં. જીજે 12 એએન 9103 પર પાછળથી પૂરઝડપે આવી રહેલા ટ્રેઇલર ફરી વળ્યું હતું. આ ટ્રેઇલરના નં. આરજે 01 જીએ 6245 હતા.

આ અકસ્માતમાં ટ્રેક્ટરની ટ્રોલી ઉંધી વળી જતાં ટ્રેક્ટરમાં સવાર બે મજૂર રામજી ભચુ બુચિયા (ઉ.વ.38) તથા ચેતન વિશા કારિયા (ઉ.વ.17)ને ઇજાઓ પહોંચતાં મુકેશભાઇ દાનાભાઇ મહેશ્વરી પોતાની કાર વડે આ બન્ને મજૂરોને લોહીલુહાણ હાલતમાં લાકડિયા સરકારી દવાખાને ખસેડી ગયા હતા. પોલીસે ટ્રેઇલરચાલક સામે ગુનો નોંધી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

માંડવીમાં યુવાનને સગા ભાઇએ પાઇપ ઝીંકી દીધો

ભાસ્કર ન્યૂઝ. ભુજ

માંડવીના સલાયામાં એક યુવાન પર તેના સગા ભાઇએ જ લોખંડના પાઇપ વડે હુમલો કરી તેને લોહી લુહાણ કર્યો હતો. ઘાયલને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો. આ અંગેની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધ્યો હતો.

પોલીસ સૂત્રોએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સલાયાના ધાસુરા ચોકમાં રહેતા અનવર હાસમ શીરૂ(ઉ.વ.35)ને તેના ભાઇ જૂણસે પાઇપથી માર માર્યો હતો.

રવિવારે રાતે જૂણસ પાણીની ટાંકી લઇ ગયો હતો, એ પરત આપવાતેના ભાઇ અનવરે વાત કરી હતી, જે બાબતે ઉશ્કેરાઇને જૂણસે લોખંડનો પાઇપ માર્યો હતો. શરીર પર ગંભીર ઇજા થવાથી અનવરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે તેની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગ્રામજનોએ અદાણીના સૂચિત રસ્તા માટે આવેદન આપ્યું

ધ્રબ પાસે વૈકલ્પિક માર્ગ બનાવી ખારેક-ચીકુનો સોથ અટકાવો

ભાસ્કર ન્યૂઝ. ભુજ



સમાહર્તા પાસે વિરોધ વ્યક્ત કરવા જઇ રહેલા કોંગ્રેસના અગ્રણીઓ

ઔદ્યોગિક હબ બની ગયેલા મુન્દ્રા તાલુકામાં પ્રાગપર ચોકડીથી અદાણી બંદર સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ આઠ એ સામે ધ્રબના ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. બાયપાસ રોડના લીધે ફળાઉ ઝાડ તથા ધાર્મિ સ્થાનોનો સોથ વળી રહ્યો છે, તેવી ફરિયાદ સાથે આજે કલેકટરને આવેદનપત્ર અપાયું હતું.

મુન્દ્રા તાલુકાના ધ્રબના ગ્રામજનોએ બાયપાસ રોડને લઇને ઊભી થયેલી સમસ્યાઓ અંગે રેલી સ્વરૂપે જઇને ભુજમાં કલેકટર ઓફિસરમાં રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારના ગ્રામીણો ખેતી અને પશુપાલન વ્યવસાયથી આજીવિક મેળવી રહ્યા છે. હાલમાં અદાણી કંપની દ્વારા પ્રાગપર ચાર રસ્તાથી મોટા-નાના કપાયાના સીમાડામાંથી રસ્તો પસાર બનનારો છે.

આ જમીન બિનપિયત છે, જ્યારે ધ્રબના સીમાડામાંથી પસાર થતા માર્ગમાં 100 એકર જેટલો વિસ્તાર પિયત જમીનવાળો અને બાગાયતી છે, જેના માટે વાંધા અરજીઓ મગાવાયા છતાં અસરગ્રસ્તોને સાંભળવામાં આવતા નથી. સૂચિત રસ્તાના લીધે રહેણાક મકાન ઉપરાંત ખારેક, ચીકુના ફળાઉ વૃક્ષોનો સોથ વળી જાય એમ છે, તો બોરવેલને પણ નુકસાન થાય તેમ છે. હાલમાં જ્યાંથી રસ્તો બનાવવામાં આવી રહ્યો છે,ત્યાં આશાભાપીરની દરગાહને નુકસાની પહોંચાડી ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડાઇ છે.

આ સૂચિત રસ્તા માટે માપણી પૂર્વે કોઇને પણ જાણ નથી કરાઇ, વારંવાર માપણી કરીને રોડ તબદિલ કરવાની તજવીજ પણ જોવા મળી છે. રસ્તો બનાવવામાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તથા મિલકત ધારકોની યોગ્ય વ્યવસ્થા થાય તેવી માગણી કરાઇ હતી.

કેન્દ્રના નાણાં વાપરી ગુજરાત સરકાર યશ ખાટે છે : કોંગ્રેસ

રણોત્સવમાં પ્રવાસનની હંગામી વ્યવસ્થા પાછળ બીએડીપીના રૂપિયા 515 લાખ ખર્ચી નાખ્યાનો આક્ષેપ

ભાસ્કર ન્યૂઝ. ભુજ

આ કામો થયાં કેન્દ્રની બીએડીપી ગ્રાન્ટમાંથી : કોંગ્રેસનો દાવો

વર્ષ 2009-10માં ટુરિઝમ માટે 45 લાખ, 2010-11માં 120 લાખ, 2011-12માં 350 લાખ. કુલ રૂપિયા 515 લાખનો ખર્ચ જુદા જુદા કામોમાં કરાયો છે, તે અહીં દર્શાવાયા છે. કાળા ડુંગરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા રૂપિયા 30 લાખ, ધોરડો સફેદરણ માટે 30 લાખ, લખપત કિલ્લા, ભૂંગા, ગુરુનાનકજીની બેઠક અને પીવાના પાણીની ગ્રાન્ટ 30 લાખ, ધોરડોમાં ડાયનિંગ સ્પેસ, ઇન્ટરપ્રિટેશન સેન્ટર, ક્રાફ્ટ બજાર અને વીજળીકરણ માટે 30 લાખ, ધોરડોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા 40 લાખ, ધોબાણા, કાળો ડુંગર ઇકો ટુરિઝમ માટે 70 લાખ, લખપતના કિલ્લાને રિસ્ટોરેશન તથા રિટ્રોફિટિંગ માટે 100 લાખ, ધોળાવીરા- ભચાઉમાં પ્રવાસન સુવિધાઓ તથા ગ્રીન રૂમ ઊભા કરવા 20 લાખ, ધોરડોમાં દૂરસંચાર માટે 20 લાખ, રાપર તાલુકાના ગઢડા રાસાજીના સંપર્ક રોડ માટે 25 લાખ

જુદી જુદી યોજનાઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવાતી ગ્રાન્ટ્સનો કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં ઉપયોગ કરીને રાજ્યની ભાજપ સરકાર યશ ખાટી રહી છે જેની સામે ભારત સરકારના નાણાનો હિસાબ મગાશે એમ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જાહેર કરાયું છે.

રાજ્યની મોદી સરકાર કેન્દ્ર સરકારના અનુદાનની રકમનો ઉપયોગ કરી લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. સરહદી વિસ્તારના કાર્યક્રમો તળે ગામડાનો વિકાસ થાય એ માટે બી.એ. ડી.પી. અંતર્ગત કરોડો રૂપિયાનું ભંડોળ ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે, પરંતુ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં પાયાની સુવિધાઓ ઊભી કરવા કે વધારવાના બદલે ટુરિઝમના નામે ખર્ચી નાખવામાં આવે છે. કોંગ્રેસ પ્રમુખ વી. કે. હુંબલની યાદીમાં કરાયેલા આક્ષેપ મુજબ મોદી પોતાની સુખ સુવિધામાં આવી રકમ વાપરી નાખે છે. ધોરડો ખાતે રણોત્સવની ઉજવણી પાછળ જેટલો ખર્ચો કરાય છે તે નાણાં બીએડીપી યોજનામાંથી આવે છે.

માર્ગદર્શિકાથી બહારના કામો થયા હશે તેની તપાસ કચ્છ જિલ્લા કોંગ્રેસ તરફથી શરૂ કરવામાં આવી છે. જે અંગેની વિગતો પણ સમયાંતરે પ્રજા સમક્ષ મૂકવામાં આવશે એમ કોંગ્રેસ પ્રમુખની યાદીમાં જણાવાયું હતું.

રિયલ હીરો એવોર્ડ જીતેલા કચ્છના ભરત પટેલનું સન્માન

માછીમારોને માર્કેટિંગમાં મદદરૂપ થવા બદલ મુંબઇમાં અભિવાદન કરાયું

ભાસ્કર ન્યૂઝ. ભુજ



ટ્રોફી સાથે ખુશખુશાલ ભરતભાઇ

ગઇ કાલે મુંબઇમાં રિયલ હિરો એવોર્ડ આમીર ખાન, હેમા માલિની તથા અન્ય 22 વ્યકિતાને આપવામાં આવ્યો હતો, જેમાં કચ્છ માટે એવોર્ડ જીતનારાઓમાં કચ્છના ભરત પટેલ પણ સામેલ હતા. ગુજરાતમાંથી પસંદ કરાયેલી બે વ્યકિત પૈકી તેઓ એક હતા.રિયલ હીરો એવોર્ડ ભારતમાં 24 જેટલા લોકોને આપવામાં આવે છે અને તેમાં અલગઅલગ સેકટર પ્રમાણે પસંદગી થતી હોય છે, તેમાંથી ગુજરાતમાંથી બે વ્યકિતને પસંદ કરવામાં આવી હતી, જેમાં ભરત પટેલ અને મીત્તલ પટેલ બન્નેની સોશ્યલ વેલ્ફેરના સેકટરમાંથી પસંદગી કરવામાં આવી હતી,જેમાં કચ્છના માછીમારોને સંગઠિત કરીને અલગ અલગ રીતે માછીમારોને મદદ કરવા ઉપરાંત માછીમારોને અધિકારના મુદ્દે સંગઠિત કર્યા બાદ તેમને માર્કેટિંગ વ્યવસ્થામાં મદદરૂપ થવા બદલ આ એવોર્ડ આપવામાં આવેલો હતો.

આ એવોર્ડ નેટવર્ક 18એ આપે છે તેમાં સી.એન.એન. આઇ.બી. એન. દ્વારા પસંદગીની કામગીરી કરવામાં આવી હતી. આ એવોર્ડ વર્ષ 2008માં સુષ્માબેન આયંગરને આપવામાં આવેલો અને 2012માં ભરત પટેલને મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ એવોર્ડ અનીલ અંબાણીના હસ્તે આપવામાં આવેલો અને તેમાં નીતા અંબાણી, અમિર ખાન, સચિન તેંડુલકર, હેમા માલિની વગેરેની હાજરી આ કાર્યક્રમમાં હતી.

ભચાઉ તા.પં નું 2.92 કરોડની પૂરાંતવાળું બજેટ મંજૂર

ભાસ્કર ન્યૂઝ. ભચાઉ

તા. પ. ભચાઉની સામાન્યસભામાં વર્ષ 2011-2012નું સુધારેલું અને વર્ષ 2012-2013નું રૂા.બે કરોડ બાણુ લાખની પૂરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું હતું.

તા.પં.પ્રમુખ ધર્મેન્દ્રસિંહ બી. જાડેજાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સ્વભંડોળની આવક સામે 66,22,100 ખર્ચની જોગવાઇ કરવામાં આવી છે, જેમાં પંચાયત ક્ષેત્રે 1,25,000, આરોગ્ય ક્ષેત્રે 4,00,000 ,ખેતીવાડી 1,65,000 જાહેર બાંધકામ ,15,00,000 કુદરતી આફતક્ષેત્રે 10,25,000 રકમના ખર્ચની જોગવાઇ કરવામાં આવી છે. ઉપપ્રમુખ સવજીભાઇ ચાવડા, કારોબારી ચેરમેન અમીબેન ચાવડા, સા.ન્યા. સમિતિ ચેરમેન કારેટ છગનભાઇ, તા.વિ. અધિકારી એલ.એમ.તડવી હાજર રહ્યા હતા. બજેટ એસ.યુ.સંઘવાણી હિશાબનિશે રજૂ કર્યું હતું.

કંડલાના સંદર્ભમાં ટીમ અણ્ણાના વાસન પર પ્રહારો

વાસન કહે છે કે, તેમણે શિપિંગ મંત્રાલય સંભાળ્યું તે પહેલાં ગેરરીતિના આક્ષેપ છે

ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ

ટીમ અણ્ણાના મહત્ત્વના સભ્ય અરવિંદ કેજરીવાલે કંડલા પોર્ટના 16000 એકર જમીન કૌભાંડમાં શિપિંગ મંત્રી જીકે વાસન સામે ઓગસ્ટ સુધીમાં એફઆઇઆર દાખલ કરવાનું અલ્ટીમેટમ આપ્યા બાદ વાસને આ આક્ષેપોને આધારવિહોણા ગણાવતાં જણાવ્યું હતું કે, 2008માં આ ગેરરીતિ બહાર આવી, ત્યારે તેઓ આ મંત્રાલયના ચાર્જમાં ન હતા.

સમાચાર માધ્યમોના અહેવાલ પ્રમાણે કેજરીવાલે રવિવારે જાહેર કર્યું હતું કે, શિપિંગ મંત્રી જી.કે.વાસન (કંડલાના કેસ સંદર્ભે) સહિત 14 મંત્રી સામે ઓગસ્ટ સુધીમાં એફઆઇઆર દાખલ કરવામાં નહીં આવે તો રાષ્ટ્રવ્યાપી આંદોલન કરવામાં આવશે.

વાસને સ્પષ્ટતા કરી હતી કે, દિલ્હી હાઇકોર્ટમાં જાહેરહિતની અરજીમાં કરવામાં આવેલા 17 આક્ષેપમાંથી 14માં કોઇ નોંધપાત્ર પુરાવા મળ્યા નથી. બાકીના ત્રણના સંદર્ભમાં ખાતાકીય કાર્યવાહીની ભલામણ કરવામાં આવેલી છે.

તેમણે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે, કંડલા પોર્ટ ટ્રસ્ટના ચીફ વિજિલન્સ ઓફિસર દ્વારા 2008માં ગેરરીતિના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને ત્યારે તેઓ શિપિંગ મંત્રી ન હતા. તેમના કહેવા મુજબ કંડલા પોર્ટ પાસે 2.20 લાખ એકર જમીન છે અને તેમાંથી 16112 એકર જમીન 1960થી 30 વર્ષના સમયગાળા માટે પોર્ટના સત્તાવાળાઓ દ્વારા મીઠાના ઉત્પાદન માટે જમીન લીઝ પર આપવામાં આવી હતી.

વાસને એમ પણ જણાવ્યું હતું કે, પોતે મંત્રી બન્યા ત્યાં સુધી દર વર્ષે રૂા. 144 પ્રતિ એકરના ભાવે જે જમીન લીઝ પર અપાતી હતી તે તેમણે ઓકશન દ્વારા પ્રતિ એકરે 13570નો ભાવ કરાવ્યો છે.

ન્યૂઝ ઇનબોક્સ

મિનરલ વોટરના પાઉચમાં મરેલી માખી

મિનરલ વોટરના પાઉચ નામે લોકોને ગમે તેવું પાણી ધાબડી દેવામાં આવે છે. તેવા આક્ષેપો મિનરલ વોટર વેચતી કંપનીઓ પર વારંવાર ઉઠયા છે, ત્યારે એક નાગરિકે પાણીના પાઉચમાં માખી જોવા મળતા પાઉચ બનાવનારા એકમો કેવા બેદરકાર હશે તે દેખાઇ આવે છે.

ખેડોઇ નજીકની કંપનીમાં લેપટોપ ચોરાયું

ગાંધીધામ:અંજાર તા.ના ખેડોઇ પાસે આવેલી એક કંપનીની ખુલ્લી કેબિનમાંથી લેપટોપની ચોરી થયા બાદ સોમવારે પોલીસ ફરિયાદ કરાઇ હતી. તાલુકાના ખેડોઇ પાસે આવેલી માન ઇન્ડસ્ટ્રીઝની ઓફિસમાંથી શુક્રવારે રાત્રિ દરમિયાન રૂા. 25 હજારના લેપટોપની ચોરી થઇ હતી. સોમવારે ચોરીની ફરિયાદ અંજાર પોલીસને કરી હતી.

લાકડિયામાં હડકાયાં કૂતરાંને મોતને ઘાટ ઉતારાયું

લાકડિયા:લાકડિયામાં છેલ્લા બે દિવસથી હડકાયાં કૂતરાંનો ત્રાસ વધતાં સોમવારે ગામલોકોએ તેને મોતને ઘાટ ઉતારી દીધું હતું.સોમવારે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં હડકાયાં કૂતરાનું મોત થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આ પહેલાં આ કૂતરાએ શાળાએથી પરત ફરી રહેલી એક આઠ વર્ષની બાળકીને પગમાં બચકું ભર્યું હતું. જેને લાકડિયાની સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. આ સિવાય આ હડકાયાં કૂતરાંએ છેલ્લા બે દિવસમાં ગાય તથા વાછરડાને પણ બચકાં ભર્યાં હતાં. તેવામાં સોમવારે લાકડિયાના ચંડીનગરમાં લોકોને આ કૂતરું નજરે ચડતાં તેને મારી નાખવામાં આવ્યું હતું.

કપાયામાં પોલીસમાં જાણ કર્યા વિના મકાન ભાડે આપતા પકડાયા

ભુજ: મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામમાં જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાં મુજબ પોલીસને જાણ કર્યા વિના મકાન ભાડે આપનારા બે શખ્સ કાયદાના સાણસામાં આવી ગયા હતા. ડોશા આલા ગઢવી અને સામત નારણ ગઢવી સામે ગુનો નોંધી તેમની અટકાયત કરાઇ હતી. આ બેય શખ્સે પોતાના કબજાની ઓરડીઓ પરપ્રાંતીઓને ભાડે આપી હતી અને એ વિશે પોલીસને માહિતગાર ન કરીને જાહેરનામાંના ભંગ કર્યો હતો.



ભાસ્કર નોટિસ (દરરોજ)

જાહેર ખબર માટે સંપર્ક : ૯૯૭૯૬ ૩૩૫૫૫ ૯૯૨૫૧ ૬૧૦૮૮

ટાઇટલ કિલયરન્સ સર્ટિફિકેટ અંગે જાહેર નોટિસ

ભુજ મધ્યે સંસ્કારનગરનો પ્લોટ નં.૧૨૧ તે સિટી સર્વે વોર્ડનં. ૫ સિટી સ.નં. ૩૦/૧/૧૨૧ ચો.મી. ૩૩૪.૭૪વાળો પોતાના કબજા માલિકીમાં હોવાનું જણાવી શ્રી માવજી ભાણજી ગજ્જર રે. ભુજ-કચ્છવાળાએ ટાઇટલ કિલયરન્સ સર્ટિફિકેટ માગેલ છે. સબબ સદર મિલકતના તેમના ટાઇટલ અંગે કોઇને વાંધો હોય અગર અન્ય રીતે લેણું કે હક્કદાવો હોય તો આ નોટિસ પ્રસિદ્ધ થયેથી દિ. પાંચમાં લેખિત આધાર સાથે રજૂ કરવો.

તા.૨૬/૩/૨૦૧૨

ચંદ્રકાંત ડી. પંડ્યા
રાજેશ્વરી એમ. રાવલ, એમ.આર.માકાણી
એડવોકેટ્સ, શોપ નં. ૨ માનવદર્શન એપાર્ટમેન્ટ
નિર્મળસિંહવાડી, ભુજ-કચ્છ, મો.: ૯૪૨૬૩ ૮૩૪૯૭

અનુસંધાન

14 કરોડની લાંચની ઓફર

પહેલા પાનાનું...

ગયો છે આ બારામાં ટૂંક સમયમાં તપાસ પણ શરૂ કરી દેવાશે.

આ પહેલા સોમવારે સંસદના બન્ને ગૃહોમાં વી કે સિંહના ઘટસ્ફોટ અંગે જોરદાર હોબાળો મચ્યો હતો. જેને પગલે બન્ને ગૃહોની કાર્યવાહી બે વખત સ્થગિત કરવી પડી હતી. મુખ્ય વિરોધપક્ષ ભાજપ દ્વારા બન્ને ગૃહોમાં પ્રશ્નકાળ સ્થગિત કરાવીને ચર્ચા કરાવવા નોટિસ અપાઇ હતી. જેને સ્વીકારવામાં આવી ન હતી. ગૃહની કાર્યવાહી શરૂ થતા જ સમગ્ર વિપક્ષે આ મામલે સરકાર તરફથી જવાબ અપાય તેવી માગણી સાથે ભારે હોબાળો મચાવી દીધો હતો. હોબાળાને કારણે બન્ને ગૃહોની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઇ હતી. લોકસભામાં મંત્રાલયના પ્રશ્નોત્તરી માટે ઉપસ્થિત સંરક્ષણ મંત્રી એન્ટનીએ સંસદ સ્થગિત થતા જ પોતાના કાર્યાલયે ગયા હતા. અને વીકે સિંહના ઇન્ટરવ્યુની નકલ જોડીને સમગ્ર મામલાની તપાસ સીબીઆઇને સોંપી દીધી હતી.

છેવટ સુધી...

પણ પ્રશ્ન છે અને તેમણે પણ અમારી સાથે જોડાવું જોઇએ. અમદાવાદ ગોલ્ડ એસોસિએશનના સેક્રેટરી હરુભાઈ ઝવેરીએ સોનીઓ વતી છેક સુધી લડી લેવાનો નિર્ધાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, જ્યાં સુધી એક્સાઇઝનો કાળો કાયદો દૂર નહીં થાય ત્યાં સુધી હડતાળ અને આંદોલન ચાલુ રહેશે.મનોજભાઈ સોનીએ કહ્યું હતું કે, સરકારે જે પ્રકારની જોગવાઈઓ કરી છે, તેનાથી સોનામાં કાળું નાણું આવવાને બદલે અંડર ટેબલ પ્રવૃત્તિઓ વધશે. દિવ્ય ભાસ્કરના સ્ટેટ એડિટર અવનીશ જૈને સમગ્ર કાર્યક્રમની ભૂમિકા બાંધી હતી તથા ટોક શોના આયોજનનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. દિવ્ય ભાસ્કરના સીઓઓ સરસ સેઠીએ કહ્યું કે, ભાસ્કર દેશભરમાં તેમની સમસ્યાઓને વાચા આપતું રહેશે.

નાની બચતોના વ્યાજદરમાં...

બે વર્ષ માટેની થાપણોમાં પ્રત્યેક પર વ્યાજદરમાં 0.50 ટકાનો વધારો અનુક્રમે 8.2 ટકા અને 8.3 ટકા કરવામાં આવ્યો છે. માસિક આવક યોજના(એમઆઇએસ)નો વ્યાજદર 0.3 ટકા વધારીને 8.5 ટકા કરવામાં આવ્યો છે. જ્યારે જાહેર ભવિષ્ય નિધિ(પીપીએફ)નો વ્યાજદર 0.2 ટકા વધારીને 8.8 ટકા કરવામાં આવ્યો છે.જ્યારે બચત જમા ખાતા પર વ્યાજદર ચાર ટકા જ રહેશે. તેમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.

સસ્તી વીજળી ભૂતકાળ...

ચેરમેન પ્રમોદ દેવે જણાવ્યું હતું કે લોકો વીજળી ખરીદવા માટે વધારે કિંમત ચૂકવવા તૈયાર છે અને અંગે વધુ વિચાર કરવાની પણ જરૂર છે. સમારંભના સ્વાગત પ્રવચનમાં ભાસ્કર જૂથના ચેરમેન રમેશચંદ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે વીજળી આજે લોકોની લાઈફલાઈન બની ગઈ છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિને તેમની જરૂરિયાત મુજબ વીજળી મળે તે ખૂબ જરૂરી છે. આ કોન્ક્લેવનું આયોજન વીજળીના બહેતર ભવિષ્ય માટે રોડમેપ તૈયાર કરવાના ઉદ્દેશ્યથી થયું હતું. ભાસ્કર જૂથ દ્વારા સતત બીજી વખત આ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે વીજળી સીધી દેશના વિકાસ સાથે જોડાયેલી છે. વીજળી વગર ઉદ્યોગો ચાલી શકતા નથી અને ઉદ્યોગ વગર રોજગારીનું સર્જન થઈ શકે નહીં. તેમણે કહ્યું હતું કે આયાત કરેલા ઈંધણ અને કાચા માલના ભાવમાં વધારો થતાં વીજળીનું ઉત્પાદન ખર્ચ વધી રહ્યું છે. વીજળી પરિયોજનાની સ્થાપના દરમિયાન ભૂમિ અધિગ્રહણ જેવી પ્રક્રિયાઓના ઉકેલ આવવા સુધીમાં પણ અન્ય ચીજોના ભાવ વધી જાય છે. આવી સમસ્યાઓ ઉકેલવા માટે રાજ્ય સરકારોએ પણ આગળ આવવું જોઈએ. આવી સ્થિતિમાં પાવર કોન્ક્લેવ જેવા માધ્યમથી ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા લોકો કેન્દ્ર અને રાજ્ય સરકારોને તાર્કિક સૂચનો આપે તે જરૂરી છે. તેમણે કહ્યું કે વૈકલ્પિક ઊર્જાની પડતર કિંમત ઘટી રહી છે અને સરકાર સૌર તેમજ પવન ઊર્જાને સ્ટોર કરવાની ટેકનિક વિકસાવવામાં અગ્રેસર છે. અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે જવાહરલાલ નહેરુ નેશનલ સોલર મિશન હેઠળ પહેલા તબક્કામાં 1300 મેગાવોટ વીજળી ઉત્પાદનની તૈયારી છે. બીજા તબક્કામાં 4000 મેગાવોટ ઉત્પાદનનું લક્ષ્ય છે જેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

ભાસ્કર જૂથના ચેરમેન રમેશચંદ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે દેશના અમુક જ એવા શહેર છે જ્યાં વીજળીનું સંકટ નથી. દિલ્હી, મુંબઈ, સુરતને બાદ કરતા અન્ય શહેરોના લોકોને ઈન્વર્ટર, જેન સેટ જેવા બેકઅપ પર આધાર રાખવો પડે છે. તેમણે કહ્યું હતું કે લોકોએ સરકારી સ્ત્રોતોના મુક્તમને ઉપયોગની માનસિકતા બદલવી પડશે. પરંતુ સરકારે પણ સ્ત્રોતો પરથી તેમનો એકાધિકાર સમાપ્ત કરવો પડશે. સરકારે નિયામકરૂપે કામ કરવું જોઈએ. પ્રમોદ દેવે કહ્યું હતું કે દેશની 40 ટકા વસ્તી વીજળી વગર રહે છે જ્યારે 2012 સુધીમાં બધાને વીજળી પહોંચાડવાનું લક્ષ્ય હતું. ટેલિકોમ ક્ષેત્રની જેમ વીજળી ખરીદવાના મામલે પણ ગ્રાહકો સામે વિકલ્પો આવે તો તેમને સસ્તી વીજળી મળી શકે છે અને ગ્રાહક જરૂર પ્રમાણે વીજળીનો ઉપયોગ કરશે. દેશમાં પહેલી વખત કોઈ પંચવર્ષીય યોજના દરમિયાન વીજળી ઉત્પાદનની ક્ષમતામાં 50,000 મેગાવોટથી વધારે વૃદ્ધિ થઈ છે. બાયોમાસથી ઉત્પન્ન થતી વીજળી માટે બિહારમાં લોકો 10 રૂપિયા પ્રતિ યુનિટનો ભાવ ચૂકવે છે. આવી સ્થિતિમાં સ્પષ્ટ છે કે લોકો વધુ કિંમત ચૂકવવા તૈયાર રહે.

ઘણાં સરકારી ખાતાં...

કે માત્ર 100 કરોડની મહેસૂલ માટે તમે ક્યાં સુધી જઇ શકો છો. રાતે જેમ મચ્છરો લોહી ચૂસે છે તેવી રીતે આપણા દેશમાં કેટલાક વિભાગો પણ લોહી ચૂસે છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે 100 કરોડના મહેસૂલ માટે કોઇ અન્ય માર્ગ વિચારવો જોઇએ. આપણે(બિઝનેસમેન) તે ચૂકવીશું.

જયસ્વાલે સોમવારે કહ્યું હતું કે લોહી ચૂસી રહ્યા હોવા અંગેનું તેમનું નિવેદન ઘણા સરકારી વિભાગો સંબંધમાં હતું, નાણામંત્રાલય અંગે આ નિવેદન નહોતું કરાયું.દિલ્હીમાં સંસદ હાઉસ કોમ્પ્લેક્ષ ખાતે તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે કેટલીક ચેનલોએ એવું દેખાડ્યું હતું કે મેં નાણામંત્રાલય અંગે કેટલીક ટિપ્પણીઓ કરી છે, આ ચેનલોએ સાચું ચિત્ર નથી દર્શાવ્યું.

પ્રદીપ શર્મા સામે

છેલ્લા પાનાનું...

શક્યતા સૂત્રોએ વ્યકત કરી છે.અનેક કાનૂની કોઠાઓને પાર કરીને થોડા મહિનાઓ પહેલાં જ પાલારાની ખાસ જેલમાંથી જામીન ઉપર બહાર આવેલા રાજ્યના વરિષ્ઠ આઇપીએસ અધિકારી એવા એડિશનલ ડીજીપી કુલદીપ શર્માના નાના ભાઇ પ્રદીપ શર્મા માટે રાજ્યની મોદી સરકારે વધુ એક કાનૂની જંગ છેડી દીધી છે. સીઆઇડી ક્રાઇમના એડિશનલ ડીજીપી પૃથ્વીપાલ પાંડેએ પ્રદીપ શર્મા સામે સીઆઇડી ક્રાઇમ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હોવાની વાતને સમર્થન આપ્યું હતું. સીઆઇડી ક્રાઇમના ડીઆઇજી શશિકાંત ત્રિવેદીનો વધુ વિગતો માટે સંપર્ક કરતાં તેઓ મળી શક્યા નહોતા, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છના કલેકટર તરીકે પ્રદીપ શર્માએ જે-તે સમયે ગાંધીધામ તાલુકાના કિડાણામાં આઠ વ્યક્તિને 1.52 લાખ ચો.મી. જમીન ફાળવી હતી. તે સંદર્ભે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. સીઆઇડી ક્રાઇમ દ્વારા ગાંધીધામની કોર્ટમા કાર્યવાહી પણ કરવામાં આવી હોવાનું ઉમેર્યું હતું.

3. 4નો આંચકો...

નજીક 1.5ના હળવા કંપન બાદ બપોરે 11:02 વાગ્યે રિકટર સ્કેલ પર 3.4નો આંચકો આવ્યો હતો. તીવ્રતા એટલી વધુ હતી કે લાંબા સમય સુધી તેની ધ્રુજારી અનુભવી હતી અને ભયના માર્યા ઘરની બહાર દોટ મૂકી હતી.

ભુજમાં ગેરકાયદે રીતે સીમકાર્ડ વેચતી દુકાન પર SOGનો દરોડો

નાના કપાયામાં ગેરકાયદે રીતે સીમકાર્ડ વેચતો શખ્સ પકડાયો

ભાસ્કર ન્યૂઝ. ભુજ

નખત્રાણાના સુખપર(રોહા)માં સીમકાર્ડના ગેરકાયદે વિક્રય પર દરોડો પાડ્યા બાદ હવે પશ્ચિમ કચ્છની સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ દ્વારા શહેરના એક દુકાનદારને પણ આ પ્રકારના કેસમાં પકડી પાડ્યો હતો, તો હજી રવિવારે જ મુન્દ્રાની આઠ મોબાઇલની દુકાન પર પોલીસે દરોડો પાડીને એમાંથી 425 બોગસ સીમકાર્ડ કબજે કર્યા હતાં ત્યાં જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરીને બિન્દાસ્ત રીતે વેચાણ કરતો નાના કપાયાનો શખ્સ સોમવારે પકડાયો હતો. ભુજ પોલીસ સૂત્રોએ જણાવ્યા પ્રમાણે શહેરની મોડર્ન ટોકિઝ પાસે આવેલી મોબાઇલ શોપ પર એસઓજીએ રેડ કરી હતી, જેમાં દુકાનદાર રણજીત નાથારામ પ્રજાપતિ સીમકાર્ડનું વેચાણ કરીને ગ્રાહકોની નોંધણી કરતો નહોતો. જાહેરનામાના ભંગનો ગુનો નોંધ્યો હતો. નાના કપાયાનો શખ્સ પણ 47 સીમકાર્ડના 1985ના માલ સાથે કાયદાના સકંજામાં આવી ગયો હતો. પોલીસ સૂત્રોએ કહ્યું કે, નાના કપાયામાં શક્તિનગર શોપિંગ સેન્ટરમાં મોબાઇલ ઝોન નામની દુકાન પર સોમવારે સવારે ઇન્સ્પેક્ટરે સ્ટાફ સાથે છાપો માર્યો હતો, જેમાં મહેશ સામત ગઢવી(રહે. ભાડિયા, તા. માંડવી)ને પકડી પાડવામાં આવ્યો હતો. સીમકાર્ડ ખરીદનારા અંગે આ શખ્સ જાહેરનામાની સૂચના અનુસાર રજિસ્ટર રાખતો નહોતો.

ખબરદાર અબડાસામાં ઘોરાડના ફોટો ખેંચ્યા છે તો

ભુજ: કચ્છમાં જિલ્લાના વનતંત્ર દ્વારા અબડાસામાં દુર્લભ ઘોરાડ પક્ષીની ફોટોગ્રાફી પર આગામી સાત માસ દરમિયાન પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પશ્ચિમ વન વિભાગ-ભુજના નાયબ વન સંરક્ષક પી.એ. વિહોલે જણાવ્યું કે, જેનું અસ્તિત્વ જોખમમાં મુકાયેલું છે એ ઘોરાડના પ્રજનનકાળ દરમિયાન તેની ફોટોગ્રાફી કરવાથી ખલેલ પડે છે. નલિયાના ઘાસિયા મેદાનોમાં આવા બનાવો નોંધાયા છે. તેના સંવનનકાળ એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન કોઇ માણસ આ પંખીની ફોટોગ્રાફી કરતો નજરે પડશે તો વન્યજીવન રક્ષણ અધિનિયમ 1972 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આદિપુરમાં જુગાર રમતી ત્રણ મહિલા પકડાઇ

ગાંધીધામ:આદિપુરમાં સોમવારે સાંજના ભાગે પોલીસે દરોડો પાડી જુગાર રમતી ત્રણ મહિલાને પકડી પાડી હતી, જ્યારે બે મહિલા નાસી છૂટવામાં સફળ નિવડી હતી.

આદિપુર પોલીસે જણાવ્યું હતું કે, શહેરની ભાગેશ્વરી કોલોનીના બંગલો નં. 19ની સામે જુગાર રમતી લતીબેન રમેશ પ્રજાપતિ (કિડાણા), ધનુબેન ગોવિંદ મેમા જરૂ (ગળપાદર) તથા અરૂણાબેન કરસન ગોહિલ (મેઘપર બોરીચી)ને પોલીસે પકડી પાડી હતી, જ્યારે વીરીબેન કરસન ગોહિલ (આધોઇ) તથા તેની બહેનપણી વેલીબેન નાસી છૂટવામાં સફળ નિવડ્યા હતા.

કચ્છ સિનેમા

ભુજ : મોર્ડન
એજન્ટ વિનોદ - 12.40,3:30,6.30,9.40
સેવન સ્કાય મલ્ટીપ્લેક્સ
જોન કાર્ટર - 12.30,3.30,6.30,9.30
પાનસીંઘ તોમર - 12.30,6.30
એજન્ટ વિનોદ
12.45,3.30,3.45,6.45,9.30,9.45
સૂરમંદિર
એજન્ટ વિનોદ - 12.45,3.30
કહાની - 6.30,9.45
રવિ
મેં તો હૈયે લખ્યું સાઝણ તારું નામ
12.30, 3.30, 6.30,9.30
માધાપર : સિતારા
એજન્ટ વિનોદ - 12.45,3:45 6.45,9.45
માંડવી : લક્ષ્મી
એજન્ટ વિનોદ - 2.15,6:15, 9.15
આદિપુર : વિનય
એજન્ટ વિનોદ -10.30 am, 1.20, 3.15, 4.15,7.15,10.15,10.30 pm
કહાની - 3.45,6.45,10.00 pm
ધ હન્ગર ગેમ (મૌત કા ખેલ)
12.45, 6.00,8.15 pm
તેરે નાલ લવ હો ગયા - 1:00 pm
પીયુ તારા વિના મને એકલું લાગે
10.15 (શનિવારથી)
જીવન સાથી (સીંધી) - 10:30 am
ગાંધીધામ : ઓમ સિનેપ્લેક્સ
એજન્ટ વિનોદ - 9.30 am,12.45, 3.45,6.30,6.45,10.00,
કહાની - 12.30,3.30,9.45
મધુબન :
એજન્ટ વિનોદ 12.45,3.45,6.45,9.45
ધ હન્ગર ગેમ (હિન્દી) -1.00,4.00
કહાની - 12.30,3.30,6.30,9.30
અંજાર : લક્ષ્મી
રાધા તારા વિના મને ગમતું નથી 12.30
તેરે નાલ લવ હો ગયા -
3.30,6.30,9.30

Regional Distributor– DELTA PRIME MARKETING Pvt. Ltd, Ahmedabad For Distributors Inquiry- Mr.Sunil: 9824001660, Mr. Pawan: 9099961660, Brijesh: 9099934804 Spice Sales Head- Gujarat – Mr.JIVRAJ J.PATEL: Jivraj.patel@spicemobile.in Micro Distributor: Anjar/Gandhidham: Arihant Teleshop:-9925038591, Kothara:- Om Telecom -9879715798 For Trade enquiry contact – Mr.Brijesh Jadav (TM-Rajkot & Kutchh):- 9173733737, 9099934804. Spice authorized service centre: Toll Free: 1800 -300- 77423, sms SPICE SERVICE to 56300, 9925011620. Gandhidham :- Chauhan InfoTech :-9825800280, Bhuj :- Satu Communication :-9033167516

DELTA
कृप्या बॉक्स पर डेल्टा होलोग्राम देखकर स्टॉक खरीदें। इस स्टॉक पर गुजरात का 15% VAT कर शामिल है। गुजरात के TIN NO. के बिल का स्टॉक खरीदे। तथा राज्य के विकास में भागीदार बनें व बेहतर सर्विस पाये।

2012-03-27 -Divya Bhaskar -Bidada -Satpanth Samaj Protest [421]

તંત્રી લેખ

ભ્રષ્ટાચારનું દુઃસ્સાહસ

સંરક્ષણ મંત્રી એ.કે. એન્ટનીની પાસે દેશ એ જાણવાની અપેક્ષા જરૂર રાખશે કે તેમણે જનરલ વી.કે. સિંહ દ્વારા માહિતી અપાયાના તુરંત બાદ જ સીબીઆઈ તપાસનો આદેશ કેમ ન આપ્યો? સેના અધ્યક્ષે એવી માહિતી આપી હતી કે એક લોબિસ્ટ દ્વારા તેમને 14 કરોડની લાંચની ઓફર થઈ હતી. જનરલ સિંહે એક અખબારી ઈન્ટરવ્યૂમાં આ ખુલાસો કરતાં સરકારે સમગ્ર ઘટનાની સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. જોકે, લોકો જનરલ સિંહ પાસે એ પણ જાણવા માગે છે કે, જ્યારે તેમને આ ઓફર કરાઈ હતી ત્યારે તેમણે પોલીસમાં આ બાબતે શા માટે ફરિયાદ ન કરી? મુદ્દો સૈન્ય માટે વાહનો ખરીદવાનો છે. જનરલ સિંહે જણાવ્યું કે, દલાલે 600 વાહનોની ખરીદીને મંજૂરી આપવાના બદલામાં આ લાંચની ઓફર કરી હતી. દલાલ દ્વારા સીધી સૈન્ય અધ્યક્ષને ઓફર કરવાને કારણે જનરલ સિંહ તેનું આ દુસ્સાહસ જોઈને જ આશ્ચર્યચકિત રહી ગયા હતા. એ વાત પણ વધુ ચોંકાવનારી છે કે દલાલે સેના અધ્યક્ષ સામે જઈને કહ્યું હતું કે તેમના (જનરલ સિંહ) પહેલાં લોકો પૈસા ખાતા રહ્યા છે અને પછી પણ ખાતા રહેશે. જનરલ સિંહે એ રહસ્યોદ્ઘાટન પણ કર્યું છે કે, હલકી ગુણવત્તાનાં જે વાહનોની ખરીદી માટે એ દલાલ તેમને આટલી મોટી રકમની ઓફર કરી રહ્યો હતો, એવાં 7000 વાહનો અત્યારે સૈન્યમાં ઉપયોગમાં લેવાઈ રહ્યાં છે. આ વાત જ ઘણું કહી જાય છે. સૈન્યમાં ભ્રષ્ટાચાર છેલ્લાં કેટલાક વર્ષોમાં વધતો ગયો છે. સેનાના અધિકારીઓ દ્વારા પોતાના પદ અને મળેલાં અધિકારોનાં દુરૂપયોગના મામલા તાજેતરના વર્ષોમાં ઘણા જ ચર્ચિત રહ્યા છે. આથી જનરલ સિંહે જે ખુલાસો કર્યો છે, તેનાથી એ બાબત સ્પષ્ટ થાય છે કે ભ્રષ્ટાચાર કેટલી હદે અને કયા સ્તરે ફેલાઈ રહ્યો છે. હવે સરકારે સ્પષ્ટ કરવાનું છે કે તેની પાસે આ ગંભીર સમસ્યાનો સામનો કરવા માટે કઈ રણનીતિ છે? સૈન્યની પ્રતિષ્ઠા એક એવો સવાલ છે, જેની સાથે દેશ સમાધાન કરી શકે એમ નથી.

જીવન - પંથ | પં. વિજયશંકર મહેતા

શક્તિની ઉપાસના થકી દુર્ગુણો પર વિજય મેળવો

અત્યારે શક્તિપર્વનો સમય ચાલી રહ્યો છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં કેટલાંક પાત્રો એવા રહ્યા છે, જેમણે પોતાની શક્તિનો ખુબ સુંદર સદુપયોગ કર્યો છે. તેમાંનાં એક છે હનુમાનજી. સુદરકાંડમાં તેમની બુદ્ધિના જ નહીં, પરંતુ તેમની શક્તિના પણ સુંદર ઉદાહરણ જોવા મળે છે. આ નવરાત્રીમાં આપણે જપ-તપ, હવન-યજ્ઞ, ઉપવાસ કરી રહ્યા છીએ. શું આ બધું મોક્ષ મેળવવા માટે છે? નવરાત્રીમાં આપણે દુર્ગુણોનો સામનો કરવા માટે ઉપાસના કરવી જોઈએ. આ નવ દિવસની તૈયારી આખું વર્ષ કામ લાગશે. હનુમાનજીનું દરેક કામ ઉપાસના જેવું હતું. 'ઉઠી બહોરિ કિન્હિસિ બહુ માયા. જિતિ ન જાઈ પ્રભંજન જાયા.' મેઘનાદે ફરીથી ઊઠીને ઘણી માયા રચી, પરંતુ પવનપુત્રને તેનાથી પણ જીતી શકાયા નહીં. મેઘનાદ તેમના પર સતત પ્રહાર કરી રહ્યો હતો, પરંતુ હનુમાનજી હાથમાં આવતા ન હતા. આ પંક્તિઓ જણાવી રહી છે કે, હનુમાનજી પર દુર્ગુણોનું આક્રમણ થઈ રહ્યું હતું, તેમ છતાં તેઓ તેમનાં હાથમાં આવતા ન હતા. આપણા જીવનમાં પણ કેટલાય સ્વરૂપમાં મેઘનાદ આવશે. હનુમાનજીની જેમ આપણે એવી ઉપાસના કરીએ કે દુર્ગુણો આપણી નજીક જ ન આવે. હકીકતમાં હનુમાનજીએ યોગ દ્વારા એ સિદ્ધિ મેળવેલી હતી કે દુર્ગુણો જ્યારે તેમની પાસે આવે ત્યારે તેઓ ખુદ પોતાના અંદર જ પ્રવેશી જતા હતા. આને જ ધ્યાન કહેવાયું છે. તેને વિપશ્યના વિધિ કે સહજયોગ પણ કહેવામાં આવે છે. આ બધાનો અર્થ એવો થાય છે કે, આખરે તમારી જાત પાસે જ પાછા ફરવાનું છે. તમે અંદર ઉતરતાં જ બહારની વસ્તુઓ તમને શોધી નહીં શકે અને પછી તમે જ્યારે બહાર નીકળશો તો તમારી શક્તિ વધી ગયેલી હશે. દુર્ગુણો સામે તમે નિર્બળ નહીં થાવ.

humarehanuman@gmail.com

જીવનદર્શન

સંકટ સમયે કોઈને કરેલી મદદ જ સાચી સેવા છે

સંત વિનોબા ભાવેએ પોતાનું સમગ્ર જીવન લોકસેવામાં જ સમર્પિત કરી દીધું હતું અને ભારતીય સમાજને સુસંસ્કારોનો સરસ ઉપદેશ આપ્યો. બાળપણમાં તેમના માતા-પિતા તેમણે વિનાયકના નામથી ઓળખતા હતાશ પણ મહાત્મા ગાંધીએ એક વખત તેમના પિતાને પત્ર લખ્યો, જેમાં તેમના માટે વિનોબા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. ત્યારથી લોકો તેમને વિનોબા કહેવા લાગ્યા. વિનોબાને સેવા, ત્યાગ વગેરે સંસ્કારોનો વારસો પોતાની માતા પાસેથી મળ્યો હતો. તેનો એક પ્રસંગ અહીંયા છે. એક વખત વિનોબાના કોઈ પાડોશી બીમાર હતા. એવી સ્થિતિમાં વિનોબાની માતાએ પાડોશીની ખૂબ જ મદદ કરી. તે પોતાના ઘરે ભોજન બનાવ્યા પછી પાડોશીના ઘરે જઈને તેના માટે ભોજન બનાવતી અને તેની સેવા પણ કરતી. એક દિવસ વિનોબાએ પોતાની માતાને કહ્યું કે, 'માતા તમે કેટલા સ્વાર્થી છો કે પોતાના ઘરનું ભોજન પહેલાં બનાવો છે અને પછી પાડોશીના ઘરનું ભોજન બનાવો છો?' માતાએ જવાબ આપ્યો કે તું સમજતો નથી વિનોબા. જો પાડોશી માટે પહેલાં ભોજન બનાવીશ તો તે ઠંડું થઈ જશે તેથી ત્યાં પછી બનાવું છું. બીજાને સંકટ સમયમાં મદદ કરવાનો આ પુનિત ભાવ કાયમ માટે વિનોબાએ પોતાના હૃદયમાં ઉતારી દીધો. ત્યાર પછી તેમનું જીવન આ ભાવનું પ્રત્યક્ષ ઉદાહરણ બની ગયું. સાર એટલો જ છે કે સંકટના સમયે કરવામાં આવતી મદદ જ સાચી સેવા છે. તેથી તેને બાળકોના સંસ્કારના પાયામાં જ નાખી દેવી જોઈએ, જેથી તેમના આચરણનું અંગ બનીને સમાજને કંઈક સારું આપી શકે.

ભાસ્કર પીડિયા... | ઓપરેશન સ્ટાર્વેશન

જાપાની જહાજ વ્યવસ્થા તોડી પાડવા ચલાવાયેલું અભિયાન

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાના વાયુદળે કરેલા નેવલ માઈનિંગ ઓપરેશનને 'ઓપરેશન સ્ટાર્વેશન' નામ અપાયું હતું. જેનો હેતુ જાપાનના બંદરો અને તેના મુખ્ય જળમાર્ગો પર હવાઈ માર્ગે માઈન્સ ફેંકીને તેની શિપિંગ વ્યવસ્થાને બરબાદ કરવાનો હતો. તે માટે અમેરિકી વાયુદળની 313મી બોમ્બવર્ષક ટૂકડીનાં 160 બી-29 વિમાનો પસંદ કરાયાં હતાં. બી-29 વિમાનોમાં માઈન્સ લઈ જવા માટે કેટલાક સુધારા પણ કરાયા હતા. 27મી માર્ચ, 1945ના રોજ આ ઓપરેશનની શરૂઆત વિરોધી વિસ્તારમાં 1000 પેરાશૂટ દ્વારા ચુંબકીય અને ધ્વનિક ફ્યુઝયુક્ત માઈન્સ ફેંકાયા હતા. આગળ જતાં અમેરિકન વાયુસેનાએ અહીં એવાં માઈન્સ ફેંક્યા જે પાણીના દબાણને કારણે વિસ્ફોટ પણ કરી શકતાં હતાં. અમેરિકાના યુદ્ધક વિમાનોએ આ ઓપરેશન દરમિયાન 1529 ઉડ્ડયનો દ્વારા વિરોધી વિસ્તારના 26 મુખ્ય ઠેકાણાં પર 12,000 કરતાં વધુ માઈન્સ ફેંક્યા હતા. આ માઈન્સે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાની શિપિંગ વ્યવસ્થાને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું હતું. આ ઓપરેશનને કારણે વિશ્વયુદ્ધના અંતિમ છ મહિનામાં જાપાનના લગભગ 670 જહાજ ડૂબી ગયા હતા, જેનું કુલ વજન 12,50,000 ટન હતું.

કેવિન રેફર્ટી
લેખક વિશ્વબેન્કના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને પ્લેનવર્ડ્સ મીડિયાના એડિટર ઇન ચીફ છે.

વિકાસ માટેનો વિરોધાભાસ

શિલાઈની વિદાય ભલે જ અન્ય નેતાઓને નિરાશ કરી દે, પરંતુ અત્યારે તો એવા કોઈ નવા નેતાના ઉદયની સંભાવના દેખાતી નથી, જે ચીનને સંકટની આ ઘડીમાંથી બહાર લઈ જઈ શકે.

ચીનનો ફુગ્ગો ફૂટી જશે?

ચીન બે આંકડાનો વિકાસ દર હાંસલ કરવા માટે જે બણગાં ફૂંકતું આવ્યું છે, તેની સરખામણીએ 7.5 ટકા વિકાસ દર ઘણો ઓછો છે. જો બિજિંગ કેટલાક આક્રમક આર્થિક-રાજકીય સુધારા નહીં કરે તો વિકાસ દર ઘટીને 3 ટકા સુધીનો રહી જશે.

આ વતીકાલની આર્થિક મહાશક્તિ બનવા માટે મહેનત કરી રહેલા ચીનના નવા સ્વપ્નદૃષ્ટા ડેંગ શાઓપિંગ ક્યાં છે? આ વિચાર મને ત્યારે આવ્યો જ્યારે મેં ચીનની નેશનલ પીપલ્સ કોંગ્રેસમાં પ્રીમિયર વેન જિયાબાઓ દ્વારા ચાલુ વર્ષે 7.5 ટકાનો વિકાસ દર હાંસલ કરવાની જાહેરાત પર યાંત્રિક રીતે તાળીઓનો ગડગડાટ સાંભળવા મળ્યો. ચીન બે આંકડાનો વિકાસ દર હાંસલ કરવા માટે જે બણગાં ફૂંકતું આવ્યું છે, તેની સરખામણીએ આ વિકાસ દર ઘણો ઓછો છે. એ વાતનો સ્પષ્ટ સંકેત જોવા મળી રહ્યો છે કે ચીનની અર્થવ્યવસ્થાની ગતિ ધીમી પડી રહી છે અને કેટલાક અર્થશાસ્ત્રીઓ એવું પણ અનુમાન લગાવી રહ્યા છે કે, જો બિજિંગ કેટલાક આક્રમક આર્થિક-રાજકીય સુધારા નહીં કરે તો વિકાસ દર ઘટીને 3 ટકા સુધીનો રહી જશે. જોકે આ સંભવિત સુધારાથી ચીનની સત્તામાં રહેલો એ વર્ગ ભડકી જશે જેના કેટલાક અંગત સ્વાર્થ યથાસ્થિતિ જાળવી રાખવામાં છૂપાયેલા છે.

વિશ્વ બેન્કના વર્તમાન પ્રમુખ રોબર્ટ જોએલિકે બિજિંગમાં 468 પાનાંનો એક ધમાકેદાર રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે ચીને આર્થિક સુધારાનો માર્ગ અખત્યાર કરીને બજાર અર્થવ્યવસ્થાને કેટલાક નવા વચનો આપવા પડશે. હું તેને વિશ્વ બેન્કનો જ રિપોર્ટ કહેતો પરંતુ જોએલિકે ભાર મૂકીને જણાવ્યું હતું કે આ રિપોર્ટ વિશ્વ બેન્ક અને ચીનની સ્ટેટ કાઉન્સિલના વિકાસ સંશોધન કેન્દ્રનો સંયુક્ત પ્રયાસ હતો અને તેમાં પ્રીમિયર-ઇન-વેઈટિંગ લી. કેક્યાંગનો પણ સહયોગ હતો. જોએલિકે લીની પ્રતિબદ્ધતાનાં વખાણ કર્યા હતા અને વિશ્વ બેન્કની ટીમના લીડર વિક્રમ નેહરુનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ઉદ્દેશ્યોની સમાનતાને કારણે બેન્ક અને ચીન એક સંયુક્ત ટીમ બની ચૂક્યા છે. આ એક ચાસણી ચઢેલો રિપોર્ટ છે, જેમાં ચીનની સફળતાઓનાં વખાણ કરાયાં છે. રિપોર્ટનું શીર્ષક પણ ધ્યાન આપવા જેવું છે : 'ચીન 2030 : એક આધુનિક, સમરસતાપૂર્ણ અને રચનાત્મક ઉચ્ચ આવકવર્ગના સમાજનું નિર્માણ'.

સત્ય એ છે કે ચીન એક આર્થિક દીવાલ તરફ આગળ વધી રહ્યું છે. તેને અન્ય દેશોમાં મિડલ-ઈન્કમ ટ્રેપના નામે ઓળખવામાં આવે છે. કેન્દ્રીય પ્રભુત્વના જે મોડેલે ચીનને છેલ્લા ત્રીસ વર્ષોમાં આ સ્થાન સુધી પહોંચાડ્યું છે, તે હવે પોતાની અંતિમ સીમા સુધી પહોંચી ગયું છે. રિપોર્ટમાં ચીનની વર્તમાન પંચવર્ષીય યોજનાના પણ પડઘા છે, પરંતુ શબ્દોને આવકની અસમાનતા, પર્યાવરણ સુરક્ષા અને ઊર્જા નિયોજન જેવા આવરણ પહેરાવીને રજૂ કરાયા છે, જાણે કે ચીનની વર્તમાન વિકાસ સ્થિતિ તેને એકદમ આરામથી આ સમસ્યાઓથી મુક્ત કરી દેશે. વાસ્તવિક્તા તદ્દન વિપરીત છે. ચીને મોટા પ્રમાણમાં માળખાકીય સુધારા કરવા પડશે. તેણે રાજ્યસત્તાની કેન્દ્રીય ભૂમિકા પર પુનર્વિચાર કરવો પડશે, તેણે રાજ્યશાસિત ઉદ્યોગોનાં પગ કાપવા પડશે અને ઈનોવેશન, હરિફાઈ તથા ઔદ્યોગિકીકરણ પર ભાર મૂકવો પડશે, જેનું લક્ષ્ય આર્થિક વિકાસ હોય, નહીં કે રાજ્યતંત્રનું સશક્તિકરણ. રિપોર્ટમાં આર્થિક સુધારા માટે સૂચવેલા માર્ગ રાજ્યસત્તા અને પાર્ટીના અધિકારીઓની શક્તિઓમાં કાપ મૂકનારા છે આથી તેનો અમલ અશક્ય લાગે છે. સામે પક્ષે સરકાર પાસે પણ અપેક્ષા રાખાઈ છે કે તે બજારુ બાબતોમાં બિનજરૂરી હસ્તક્ષેપ ન કરે. ચાઈના બાયસ્ટેન્ડરે આ રિપોર્ટને 'આર્થિક કાર્યક્રમના વેશમાં રાજકીય ઘોષણાપત્ર' ગણાવ્યો છે, સાથે ઉલ્લેખ કર્યો છે કે આ રિપોર્ટ સુધારાવાદીઓના આત્મવિશ્વાસમાં વધારો કરે છે, જે રાજકીય સ્વાર્થોના હસ્તક્ષેપથી હતોત્સાહિત થઈ રહ્યા હતા. એક વાત તો સાચી જ છે કે ચીનમાં કોઈ પણ પ્રકારના સુધારાની વાત કમ્યુનિસ્ટ પાર્ટીના અસ્તિત્વને સીધો પડકાર છે. કોઈ એવા દેશ અંગે વિચારી પણ શકાય એમ નથી કે જેણે બજાર આધારિત અર્થવ્યવસ્થામાં સુધારા તો કર્યા હોય, પરંતુ વન-પાર્ટી સ્ટેટની વ્યવસ્થાને પણ જાળવી રાખી હોય. ચીને એ વાસ્તવિક્તાનો સામનો કરવો પડશે કે, આ રિપોર્ટમાં જે સ્વતંત્રતા અને સમાનતાનો ઉલ્લેખ કરાયો છે, તેને મેળવવા માટે કમ્યુનિસ્ટ પાર્ટીના અધિકારોમાં કાપ મૂકવો પડશે, જે અનંતકાળ સુધી આ વિશાળ અને જટિલ દેશ પર પોતાનું નિયંત્રણ જાળવી રાખવા માગે છે.

જો ચીને આર્થિક સુધારાનો માર્ગ અખત્યાર નહીં કર્યો તો તેના વિકાસની તેજ ગતિ તેને વિરોધાભાસોમાં લઈ જશે. અસમાનતા વધતાં જ વિકાસ ઘટી જશે અને તેની કાર્ય-સંસ્કૃતિને પણ અસર થશે. ચીનની વસ્તી એટલી ઝડપથી વૃદ્ધત્વ તરફ આગળ વધી રહી છે કે માત્ર પાંચ વર્ષમાં જ ચીનમાં નિવૃત્ત લોકોની સંખ્યા નવજાત શિશુઓ કરતાં વધુ હશે. આ વર્ષના અંતમાં બિજિંગમાં રાજકીય વ્યવસ્થામાં પરિવર્તન થવાનું છે. જે ચીન માટે પડકાર પણ છે અને અવસર પણ છે. ગયા અઠવાડિયાના નાટકીય ઘટનાક્રમ અંતર્ગત 25 સભ્યોના પોલિટબ્યૂરોના સભ્ય બો. શિલાઈને સસ્પેન્ડ કરી દેવાયા છે, જેમને વિશ્લેષકોએ નવા માઓવાદી નાયકની સંજ્ઞા આપી હતી. શિલાઈની વિદાય ભલે જ અન્ય નેતાઓને નિરાશ કરી દે, પરંતુ અત્યારે તો એવા કોઈ નવા નેતાના ઉદયની સંભાવના દેખાતી નથી, જે ચીનને સંકટની આ ઘડીમાંથી બહાર લઈ જઈ શકે. ડેંગની પોતાની મર્યાદાઓ છે અને આપણે એ યાદ રાખવું જોઈએ કે, વર્ષ 1989માં ટિનાનમેન ચોક પર સ્વતંત્રતાની અપેક્ષા સાથે વિદ્રોહ કરી રહેલા યુવાનો પર અત્યાચાર ગુજારનારાઓમાં તેઓ પણ અગ્રીમપંક્તિમાં સામેલ હતા.

પરદેકે પીછે | જયપ્રકાશ ચોક્સે ■ jpchowksey@yahoo.in

અનારકલી ડિસ્કો નહીં, કોર્ટમાં હાજર હો!

આખો દેશ એક ખૂલ્લી અદાલત છે, જ્યાં સદીઓથી કેસો પેન્ડિંગ પડ્યા છે અને ચુકાદા કરતાં લોકોને કોર્ટની કાર્યવાહીમાં વધુ રસ હોય છે.

ભારતીય કોર્ટોમાં અનેક મહત્ત્વના કેસો પોતાની રાહ જોઈ રહ્યા છે અને અનેક વ્યવસાયિક વિવાદ વિશેષજ્ઞો અનારકલી પર રાષ્ટ્રીય સમય બરબાદ કરવા માગે છે.

આ પણે દેશની ઊર્જાને વેડફવામાં માહેર છીએ અને બિનજરૂરી વિવાદ ઊભા કરીને મહત્ત્વની સમસ્યાઓને હાંસિયામાં નાખી દેવા માટે આશ્ચર્યજનક રીતે સામાન્ય બની જતા હોઈએ છીએ. મુંબઈની એક એનજીઓ, જે ભ્રષ્ટાચારના વિરોધમાં પોતે સક્રિય હોવાનો દાવો કરે છે, નિર્માતા સાજિદ નડિયાદવાલા પર કેસ દાખલ કરવા માગે છે કે, તેમની ફિલ્મ 'હાઉસફુલ-2'ના ગીત 'છોડ-છાડ કે અપને સલીમ કી ગલી, અનારકલી ડિસ્કો ચલી' ઈતિહાસનું વિકૃત સ્વરૂપ રજૂ કરે છે અને સલીમના ચરિત્રને પણ ખોટી રીતે રજૂ કરે છે. અનારકલી નામની કોઈ મહિલાનો ઈતિહાસમાં ઉલ્લેખ નથી અને ભારતીય ઈતિહાસના હિતેચ્છુઓ કદાચ કે.આસિફની 'મોગલ-એ-આઝમ'ના ઈતિહાસને સાચો સમજી રહ્યા છે.

ભારતીય કોર્ટોમાં અનેક મહત્ત્વના કેસો પોતાની રાહ જોઈ રહ્યા છે અને અનેક વ્યવસાયિક વિવાદ વિશેષજ્ઞો અનારકલી પર રાષ્ટ્રીય સમય બરબાદ કરવા માગે છે. આ જ રીતે આશુતોષ ગોવારિકરની 'જોધા અકબર' પણ રાજસ્થાનમાં પ્રદર્શિત થવા દેવાઈ ન હતી, જ્યારે ફિલ્મમાં રજૂ કરાયેલી રાજપૂત નાયિકા ગરિમા અને પરંપરાને મોગલ મહેલોમાં પણ સલામત રાખવામાં સફળ થાય છે.

શ્રીલાલ શુક્લની 'રાગ દરબારી'માં કંઈક આવો જ ઈશારો કરાયો છે કે આપણે ચર્ચા અને દલીલો કોર્ટની બહાર પણ કરીએ છીએ, પરંતુ ન્યાયસંગત આચરણ આપણા હાથની વાત નથી. આ આખો દેશ એક ખૂલ્લી અદાલત છે, જ્યાં સદીઓથી કેસો પેન્ડિંગ પડ્યા છે અને ચુકાદા કરતાં લોકોને કોર્ટની કાર્યવાહીમાં વધુ રસ હોય છે. ટીવી પર જ્યારે ચૂંટણીના વિશ્લેષણના કાર્યક્રમો શરૂ થયા હતા ત્યારે મનોહર શ્યામ જોશીએ તેની લોકપ્રિયતા જોઈને કહ્યું હતું કે કાલ્પનિક ચૂંટણીના વાસ્તવિક વિશ્લેષણના કાર્યક્રમ આખું વર્ષ ટીવી પર દર્શાવી શકાય છે અને દર્શકોમાં તેની માગ બનેલી રહેશે. આપણે ચૂંટણીમાં કબડ્ડી-કબડ્ડી રમવાનું પસંદ કરીએ છીએ પરંતુ મહત્ત્વના કહેવાતા પરિણામોમાં રસ ધરાવતા નથી. પોતાના સર્વસુવિધાયુક્ત ઘરમાં ટીવી પર ચૂંટણીનું વિશ્લેષણ જોનારો વ્યક્તિ કાર્યક્રમ તો સંપૂર્ણ રસ સાથે જોશે, પરંતુ મત આપવા નહીં જાય. હકીકતમાં ભારતીય રાજકારણ અને વહીવટમાં બ્રીફકેસ તથા સૂટકેસનું ઘણું મહત્ત્વ છે. લાંચના નાણાં પણ તેમાં જ આવે છે. મંત્રીઓ લાંચ આપનાર પર હંમેશાં વિશ્વાસ મુકતા હોય છે અને ક્યારેય પણ નોટો ગણતા નથી. રકમ વધુ હોય તો માત્ર સૂટકેસ ગણી લેતા હોય છે. સૂટકેસનું ઘણું મહત્ત્વ છે. જ્યારથી પતરાંની પેટીઓને બદલે ચામડાં, પ્લાસ્ટિક અને રેગ્ઝિનની સૂટકેસ આવી છે ત્યારથી આપણા હાવભાવ પણ બદલાઈ ગયા છે. આ સૂટકેસ આપણી માનસિક્તાનો એક ભાગ બની ગઈ છે. એ વાત જૂદી છે કે સૂટકેસમાં ક્યારેક આરડીએક્સ અને એલએસડી પણ આવે છે. ક્યારેક લાશના ટૂકડા પણ હોય છે. તેમ છતાં આપણે આરામથી દેશ-દેશ રમી લઈએ છીએ.

એક્સ્ટ્રા શોટ : સાજિદ નડિયાદવાલાએ વર્ષ 1992માં ફિલ્મ અભિનેત્રી દિવ્યા ભારતી સાથે લગ્ન કર્યા હતા, જેણે 5મી એપ્રિલ, 1993માં કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી.

એવું સાંભળવા મળ્યું છે કે આ સંગઠન ટૂંક સમયમાં જ અનારકલી ગીતને અદાલતમાં ઢસડી જશે, કેમકે આ ફિલ્મ પાંચમી એપ્રિલના રોજ રિલીઝ થઈ રહી છે. જરા વિચારો, જો કેસ 1લી એપ્રિલના રોજ અદાલતમાં આવી જાય અને સાજિદ નડિયાદવાલા તરફથી ખુદ અનારકલી કોર્ટમાં જઈને કહે કે, તેની ઈચ્છા તો ડિસ્કો જવાની જ છે, કેમકે સલીમની ગલી તો તેને સીધી પેલી જગ્યાએ લઈ જાય છે જ્યાં તેને ઈંટોમાં ચણી દેવાનો આદેશ મોગલ-એ-આઝમે આપ્યો છે અને ત્યાર બાદ સુરંગ દ્વારા બચાવવા માટે પણ ખુદ આવી ગયા. આપણે ત્યાં પણ આવું જ થઈ રહ્યું છે કે, કડક ન્યાય છે તો ગુનેગારને બચવા માટે અનેક છટકબારીઓ પણ છે.

મેનેજમેન્ટ ફંડા | એન.રઘુરામન

બાળકોને ખરા-ખોટાની સમજ નાનપણથી જ આપો

પહેલો કિસ્સો : જો તમે એફએમ રેડિયો સાંભળો છો તો એક જાહેરાત પર જરૂર ધ્યાન ગયું હશે. જેમાં એક શિક્ષક માતા કહે છે કે, તે સ્કૂલે જઈને હાજરી પૂરીને ઘરે પરત આવશે, જેથી તે ઘરનાં કેટલાંક કામ પતાવી શકે. આ સાંભળી તેની દીકરી કહે છે કે, હાજરી પૂર્યા બાદ છોકરાઓને નહીં ભણાવવા એ એક પ્રકારનો ભ્રષ્ટાચાર છે. આવી અન્ય એક જાહેરાતમાં સાત વર્ષીય બાળક તેના પિતાથી રેલવે ટીસી સમક્ષ પોતાની ઉંમર ઓછી બતાવવા બદલ નારાજ થઈ કહે છે કે, ટિકિટના પૈસા બચાવવા બાળકોની ઉંમર ઓછી કહેવી તે ભ્રષ્ટાચાર છે.

બીજો કિસ્સો : 20 વર્ષીય શરનજિત કૌર અમૃતસરમાં ફેશન ડિઝાઈનિંગના બીજા વર્ષની વિદ્યાર્થિની છે. આઠમા ધોરણની 18 વર્ષીય વિદ્યાર્થિની જસવિંદર કૌર 2007માં જુનિયર રાષ્ટ્રીય કબડ્ડી સ્પર્ધામાં પંજાબનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. 25 વર્ષીય રાજ કૌર મેડિકલ લેબ ટેક્નિશિયન છે, જેનાં લગ્ન બ્રિટનના એક બિનનિવાસી ભારતીય સાથે થયાં છે. હવે તે પણ પોતાનું બાકી જીવન લંડનમાં કામ કરતાં વિતાવવા માગે છે. કંવરદીપ સિંહ માત્ર 20 વર્ષની છે અને ચંદીગઢમાં 3-ડી એનિમેશન કોર્સ કરી રહી છે. તેનું સપનું આખા બોલિવૂડ પર છવાઈ જવાનું છે. આ બધાં જ બાળકો બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના બેનર હેઠળ સક્રિય રહેલા ખાલિસ્તાની આતંકવાદીઓનાં સંતાનો છે. આ દરેક ખાલિસ્તાનીનાં 1992થી 1994 દરમિયાન પોલીસ કે સૈન્ય કાર્યવાહીમાં મોત થઈ ચૂક્યાં છે.

પંજાબના આતંકથી પ્રભાવિત વિસ્તારોમાં 25 વર્ષ સુધી આતંકરોધી અભિયાન ચલાવનાર એસ.એસ. વિર્ક સાથે મારી મુલાકાત થઈ. તે દરમિયાન મેં અનેક બાળકોને પોતાના પિતાના મૃત્યુનો બદલો લેવાની કસમ ખાતા જોયાં, પરંતુ સમય જતાં તેમને ખરા-ખોટાની ઓળખ કરાવાઈ. તેમને મનોચિકિત્સકો અને કાઉન્સેલર્સે ખૂબ ધૈર્ય સાથે સારા-ખરાબની ઓળખ કરાવી. પરિણામે આજે 18-20 વર્ષ બાદ તે આશાથી છલોછલ અને સપનાં જોતી નવી પેઢી તરીકે ઉભરી. તે સમયની સાથે સાથે પોતાના જીવનને એક નવી દિશા આપી રહ્યાં છે. ફંડા એ છે કે, જો તમે તમારાં બાળકોને આતંકવાદ અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દે બાળપણથી જ જાગરુક બનાવવાનું શરૂ કરો છો તો એ રીતે તેમના રૂપમાં નવી પેઢી આશા અને સોનેરી ભવિષ્યના એક નવા યુગનો પ્રારંભ કરી શકે છે. ભ્રષ્ટાચાર અને આતંકવાદના સફાયા માટે આ જરૂરી છે.

■ raghu@bhaskarnet.com

કિડની બગાડીને જિંદગી ન બગાડશો

હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ પ્રત્યે બેદરકાર થાઓ એટલે કિડનીનો રોગ થાય. જગતમાં ડાયાબિટીસ વધી રહ્યો છે અને તેના 40 ટકા દર્દીની કિડની અંતે બગડે છે. ભારતના ડાયાબિટીસના 50 ટકા દર્દીને રોગની જાણ નથી. તેમાંના 40 ટકા કિડનીના રોગી બનશે.

યુ વરાજ સિંહ કે ફિલ્મસ્ટાર નરગીસ કે કોઈપણ ધનિકને કેન્સર કે કિડનીનો રોગ થાય તે માટે જ લાખ-દસ લાખ ખર્ચવાની ત્રેવડ તેમને હોય છે, પરંતુ કિડનીના દર્દમાં દર્દીએ જે માનસિક યંત્રણા, એકાંતરા કે બે-ત્રણ દિવસે ડાયાલિસિસની જંજાળ, ખાનપાનની સંભાળ વગેરેનો પણ સામનો કરવો પડે છે એટલે ફરી ફરી કિડનીનો રોગ શું કામ થાય છે તે તમામે જાણવું જરૂરી છે. યુવા-વાચકોએ ખાસ કારણ કે હવે કિશોરો પણ કિડનીના દર્દી થવા માંડયા છે.

મારા ગામની શાળામાં મારા પિતા અડધા વૈદ્ય જેવા હતા. વિદ્યાર્થીઓને ચોમાસામાં સુદર્શન ચૂર્ણ આપતા. ખાસ તો દરેક દોઢ કલાક પછી વિદ્યાર્થીઓને ''પાણી પેશાબ''ની રજા આપતા અને કોઈ કન્યા કે છોકરો પેશાબને દાબી ન રાખે તેની કાળજી રાખતા. પેશાબની હાજતને રોકવાથી કિડનીને જંતુ લાગવાનો ભય રહે છે.

વધુ પડતી પાલકની ભાજીને રંધાય કે આજકાલનાં 'પરદેશી' ટામેટાં વધુ ખવાય તો તેનાથી પથરી થાય છે અને વારંવાર થતી પથરી કિડનીને બગાડે છે. ઊંચું બ્લડ પ્રેશર રહેતું હોય કે ડાયાબિટીસ થાય તેની કિડની તો બગડે જ છે. 2012માં તાજેતરમાં વર્લ્ડ કિડની ડે ''ઉજવાયો તેને માટે સૂત્ર આપ્યું છે. - પ્રોટેક્ટ યોર કિડનીઝ બાય કંટ્રોલિંગ ડાયાબિટીસ એન્ડ હાઈ બ્લડપ્રેશર અર્થાત ડાયાબિટીસ પ્રત્યે બેદરકાર થાઓ એટલે કિડનીનો રોગ મહેમાન બને છે. સી. ડી.સી. નામની અમેરિકાની ન્યૂઝ એજન્સી કહે છે કે 2008માં અમેરિકામાં 48000 લોકો કિડનીના રોગથી મરેલા 2000ની સાલમાં જ આરોગ્ય સંસ્થાએ અમેરિકનોને ચેતવ્યા હતા કે 28 કરોડની વસતિમાં 2.6 કરોડ અમેરિકનોની કિડની બગડેલી હતી. 12 વર્ષ પહેલાં આટલો જંગી આંકડો હતો તો આજે તો દરેક ચોથો અમેરિકન કિડની રોગને પંથે છે. 2011માં સૂત્ર હતું.'' પ્રોટેક્ટ યોર કિડની સેવ યોર હાર્ટ.'' જો કિડનો રોગ થાય તો તેની પછી હૃદયરોગ તો ઊભો જ છે. લોહીમાં શર્કરા હોય, બ્લડ પ્રેશર હોય કે કોલેસ્ટરોલ વધ્યું હોય તો કિડની બગડે પછી હૃદય બગડે આજે આંકડો મળે છે તે પણ બ્રિટનનો છે. 30 લાખ બ્રિટિશરો ડાયાબિટીસને કારણે કિડનીના રોગના ઉમેદવાર છે. તમારો પેશાબ ડહોળો (ઘેરો) આવતો હોય કે ગંધ મારતો હોય કે કોઈ વખત લોહી જતું હોય કે પેશાબ વખતે બળતરા થતી હોય તેમ જ પેશાબની ખણસને રોકી શકાતી ન હોય તેટલી જલદ ખણસ લાગ્યા કરે ત્યારે સમજવું કે ''કિડની-મેડમ''વટકી રહ્યાં છે! અમેરિકામા માલુમ પડ્યું છે કે દરેક કિડનીનાં 10 નવા રોગમાંથી સાતને ડાયાબિટીસ કે હાઈપર ટેન્શન હતી. એ વર્ષે (2008)માં પાંચ લાખ અમેરિકનો ડાયાલિસિસ પર જીવતા હતા. અમદાવાદ- મુંબઈમાં કેટલાક મિત્રોના પરસેવા ગંધાય છે. પરફ્યુમથી ગંધ દબાવે છે. તેણે કિડની સારી કરવી જોઈએ. અમેરિકા પૈસામાં સમૃદ્ધ છે પણ આરોગ્યમાં ગરીબ જ નહીં સાવ કંગાળ છે. ઘણાનાં પરસેવા વાસ મારે છે. કિડનીની ટ્રીટમેન્ટ, કિડનીના સ્પેશ્યાલિસ્ટો અને ઉપચારની લખ લુટ જાહેરખબરો અને ખર્ચની વિગતો ખૂબ છપાય છે. ડો. વિદ્યા આચાર્યનું કહેવું છે કે ભારતમાં અને જગતમાં ડાયાબિટીસનો રોગ વધતો જાય છે અને ડાયાબિટીસવાળા 40 ટકા દર્દી તેની કિડનીને અંતે બગાડે છે.



નડિયાદ જેવા શહેરમાં કિડની ઈન્સ્ટિટ્યૂટ છે. આ શહેરમાં ઈન્ડિયન સોસાયટી ઓફ નેફ્રોલોજીએ પોતાની ઓફિસ રાખી છે. ભારતભરમાં કિડની સેન્ટરો જેવું નામ અને જ્યારે સપ્ટેમ્બર-1981માં કિડનીના રોગ વિષે 31 વર્ષ પહેલાં મારા વાચકોને ચેતવેલા ત્યારે કિડની સેન્ટર નામ સાંભળેલું નહીં. આજે ભારતમાં 166 જેટલાં કિડની સેન્ટરો ગામે ગામ થયાં છે. નડિયાદમાં કિડનીના રોગીની રજિસ્ટ્રી રખાય છે ત્યાં માલુમ પડેલું કે બગડેલી કિડનીવાળા 31.2 ટકાને ડાયાબિટીસ હતો. દક્ષિણ ભારતમાં આજે વધુમાં વધુ કિડનીના રોગ થાય છે. કારણ કે ત્યાં વડા સંભાર, અને બીજા હોટેલના નાસ્તામાં આજીનો મોટો તેમજ મીઠું વધુ પડતું વપરાય છે. કિડની રોગના વિશ્વ પ્રખ્યાત નિષ્ણાત ડો. વિદ્યા આચાર્ય કહે છે કે આ ગરીબ દેશ જ્યાં હવે ગરીબ અને મધ્યમવર્ગનાં લોકોને કિડનીની ટ્રીટમેન્ટનો જાલીમ ખર્ચ ન પોસાય ત્યાં કિડનીની કાળજી લેવા લોકોને અખબારોએ જાગૃત કરવા જોઈએ. દિ. ભાસ્કર બે લેખો દ્વારા તેની યત્કીંચિત ફરજ પૂરી કરે છે. ''સાયન્સ ડેઈલી''ના કહેવા મુજબ 2006માં જગતભરમાં 15.4 કરોડ લોકોને ડાયાબિટીસ હતો. આ ડાયાબિટીસ જગતભરમાં વકરીને 2025માં 38.6 કરોડ લોકોને થશે. એટલે કે આખા પાકિસ્તાન જેટલી વસતિના લોકોને ડાયાબિટીસ થશે અને તે તમામ કિડનીના રોગના ઉમેદવાર બનશે. 2010માં અમેરિકામાં જે પૈસાની છાકમછોળ છે ત્યાં કિડનીના વિવિધ ઉપચાર માટે 29 અબજ ડોલર ખર્ચાયેલા. આજે એ આંકડો વધી ગયો છે. ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ તેમજ ગરીબ આફ્રિકન દેશોની વસતિ જ્યાં કિડનીની ટ્રીટમેન્ટ પોતાની નથી, ત્યાં લાખ્ખો લોકો વગર ટ્રીટમેન્ટે મરે છે. 100 જેટલા ગરીબ દેશો જેની વસતિ કુલ્લે 60 કરોડ છે તેના કિડનીના દર્દી વગર ટ્રીટમેન્ટ 10 લાખની સંખ્યામાં દર વર્ષે મરે છે. વર્લ્ડ કિડની ડેના રોજ ડો. જ્યોર્જ બકરીસે જણાવ્યું કે ભારતનાં લોકો સાવધાન! 50 ટકા ભારતીઓને જેને ડાયાબિટીસ છે. તેને આ રોગની જાણ નથી. તેથી તેમાંના 40 ટકા કિડનીના રોગના ઉમેદવાર બની દેશ અને કુટુંબ માટે બોજા રૂપ બનશે. અસ્તુ. (થોડું લખ્યું તેને ઝાઝું કરી વાંચજો, સંભાળજો.)

પ્રકાશક, મુદ્રક આર. કે. ગુપ્તા દ્વારા માલિક મેસર્સ ડી.બી.કોર્પ. લિમિટેડ વતી ભુજોડી સર્વે નંબર ૧૫૮, ભુજ - અંજાર રોડ ખાતેથી મુદ્રિત તેમજ સ્વામિનારાયણ વાણિજ્ય સંકુલ, પહેલો માળ, હોસ્પિટલ રોડ, ભુજ - કચ્છથી પ્રકાશિત. એડિટર (ગુજરાત) : અવનીશ જૈન
ડેપ્યુટી એડિટર : વિપુલ વૈદ્ય* (*સમાચાર પસંદગી માટે પી.આર.બી.એક્ટ હેઠળ જવાબદાર) ફોન નં. ભુજ-(૦૨૮૩૨) ૩૯૮૮૮૮, ફેક્સ : (૦૨૮૩૨) ૨૫૫૧૮૦. RNI No. GUJGUJ/2007/21897

Digitially Archived by: www.realpatidar.com/library

2012-03-27 -Divya Bhaskar -Bidada -Satpanth Samaj Protest [421]

1685 **ડોલર** સોનાનો ભાવ મોડી સાંજે (ભારતીય સમય મુજબ) આંતરરાષ્ટ્રીય બજારમાં બોલાતો હતો જે આગલા બંધથી 23 ડોલર વધીને જોવાયો હતો. નિષ્ણાતો સોનામા ટૂંકા ગાળા માટે 10-20 ટકાના કરેકશનની આગાહી કરી રહ્યા છે.

માર્કેટ ડિજિટ્સ

માર્કેટ મોનિટર

બજાર	બંધ	તફાવત
બીએસઇ સેન્સેક્સ	17,052.78	▼ 1.78%
એસએન્ડપી નિફ્ટી	5,184.25	▼ 1.78%
CNX નિફ્ટી જૂનિ.	10,145.60	▼ 1.48%
S&P સીએનએક્સ ડેફ્ટી	3,492.75	▼ 2.27%
બીએસઇ - 100	8,968.22	▼ 1.83%
બીએસઇ - 200	2,112.12	▼ 1.81%
બીએસઇ - 500	6,619.91	▼ 1.75%

બીએસઇ ટોપ 5 ગ્રૂપ બી
સૌથી વધુ ફાયદાવાળા શેર

કંપની	બંધ	તફાવત
કેએસ ઓઇલ્સ	8.12	▲ 19.94%
યુરોટેક ઇન્ડ.	25.35	▲ 19.58%
નિલા ઇન્ફ્રા	2.35	▲ 19.29%
વન લાઇફ કેપિટલ	415.80	▲ 18.53%
રિબા ટેક્સ્ટાઇલ્સ	24.50	▲ 16.67%

બીએસઇ ટોપ 5 ગ્રૂપ બી
સૌથી વધુ નુકસાનવાળા શેર

કંપની	બંધ	તફાવત%
નિવ્યા ઇન્ફ્રા.	9.99	▼ -15.27
ગ્લિટેક ગ્રેના.	1.35	▼ -12.90
બસંત એગ્રો	3.80	▼ -11.63
એટીએન ઇન્ટ.	0.84	▼ -11.58
વીટીએક્સ ઇન્ડ.	13.25	▼ -11.07

બ્રાંડ ઇન્ડેક્સ

કંપની	બંધ	તફાવત
સીડી	6,377.24	▼ 1.42
પાવર	2,081.89	▼ 2.56
ઓટો	9,860.50	▼ 1.38
આઇટી	6,011.44	▼ 1.37
બેન્કેક્સ	11,570.74	▼ 2.44
ટેક	3,516.18	▼ 1.48
પીએસયુ	7,234.73	▼ 2.01
રિયલ્ટી	1,726.42	▼ 3.58
એફએમસીજી	4,385.59	▼ 0.40
ઓઇલ/ગેસ	7,910.02	▼ 1.85
મેટલ	10,978.06	▼ 2.19
સીજી	9,933.48	▼ 1.76

કરન્સી માર્કેટ

ચલણ	ખરીદ	ચલણ	ખરીદ
અમેરિકન ડોલર	51.27	સિંગાપોર ડોલર	40.62
પાઉંડ સ્ટર્લિંગ	81.43	જાપાનીઝ યેન	61.83
કેનેડિયન ડોલર	51.42	ચાઇનિઝ યુઆન	8.11
યૂરો	67.95	ઓસ્ટ્રે. ડોલર	53.75
સ્વિસ ફ્રાંક	56.36	**સૌજન્ય :** વાડીલાલ ફોરેક્સ	

સંસ્થાકીય કામકાજ

Date	Net (FII)	Net (DII)
21-3-12	651.70	-34.50
20-3-12	195.60	-74.20
19-3-12	185.80	-89.40
Mar,12	8,466.40	-1,100.80

MCXના કોમોડિટી વાયદા

પ્રોડક્ટ	બંધ	તફાવત
સોનું	28187.00	88.00
સોનું-મિની	28186.00	89.00
ગોલ્ડપેટલ	2802.00	10.00
ગોલ્ડ-પેટલ-દિલ્હી	2876.00	34.00
ગોલ્ડ-ગિની	22442.00	60.00
ચાંદી	57247.00	164.00
ચાંદીમાઇક્રો	57271.00	160.00
ચાંદી-મિની	57267.00	158.00
તાંબુ	435.75	3.60
તાંબુ-મિની	435.65	3.55
નિકલ	936.40	1.30
એલ્યુમિનિયમ	110.40	0.45

ન્યૂઝ બ્રીફ

સિટી કોમર્શિયલ બેન્કનો નવો નોલેજ વર્કશોપ

અમદાવાદ : સિટી ઇન્ડિયા કોમર્શિયલ બેન્કે અમદાવાદ ખાતેના નાના અને મધ્યમ બજારોના સાહસો માટે પ્રારંભિક નોલેજ વર્કશોપની જાહેરાત કરી છે. આ વિકસતા વિભાગમાં વધતી સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે સિટી કોમર્શિયલ બેન્ક આગામી બેથી ત્રણ વર્ષમાં આશરે 20 ટકા સીએજીઆર દ્વારા આવકમાં વધારો કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ સિવાય બેન્ક ચાલુ વર્ષના અંત સુધીમાં તેના ગ્રાહકોની સંખ્યા બમણી કરશે. બેન્ક દ્વારા આયોજિત વર્કશોપમાં નાના અને મધ્યમ કદના સાહસોને અગ્રણી બજાર વ્યૂહરચનાનો સંપર્ક અને વિવિધ વિષયોને આવરી લેતાં મંતવ્યો અને સૂચનો સાંભળવા અને તેની અંગેની માહિતી મેળવવાનું એક અનન્ય માધ્યમ છે.

આગળ શું ? | આજે બજેટ ઉપર થનારી ચર્ચા ઉપર નજર, નિફ્ટીમાં 94 પોઇન્ટનો કડાકો

બજેટના ભારથી સેન્સેક્સ 309 પોઇન્ટ તૂટ્યો

ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ

વૈશ્વિક શેરબજારની વિરુદ્ધ ભારતીય શેરબજારની ચાલ રહી હતી. સ્થાનિકમાં સંસદમાં આજે બજેટની ચર્ચા થવાની છે અને હાલ સરકાર ઉપર ચારે બાજુથી થઈ રહેલાં દબાણને કારણે રેલવે બજેટની જેમ કેટલીક ભલામણો પાછી ખેંચવાનું વધતું દબાણ જોતાં એફઆઈઆઈ નફો બુક કરવાના મૂડમાં જોવાઈ હતી. આગામી ગુરુવારે ડેરિવેટિવ્ઝમાં છેલ્લો દિવસ આવતો હોવાથી જાન્યુઆરીમાં લોંગ પોઝિશન ઊભી કરનારાઓની પણ વેચવાલી નીકળતાં ટ્રેન્ડ ખરાબ થઈ ગયો હતો. વધુમાં તેજીવાળામાં પણ રોલઓવર કરતાં પોઝિશન સ્કેવર અપ કરવાનો મૂડ હતો અને તેને કારણે સપ્તાહના પ્રથમ દિવસે જ સેન્સેક્સ ધડામ કરતો પડી ગયો હતો. હજી ગયા ગુરુવારે જ સેન્સેક્સમાં 403 પોઇન્ટનો કેલેન્ડર વર્ષ 2012નો બીજો મોટો કડાકો નોંધાયો હતો અને આજે વધુ 309 પોઇન્ટનો કડાકો આવતા હાલ રિટેલ ઇન્વેસ્ટરો તો બજારથી દૂર જ થઈ ગયા હોવાનું જોવા મળે છે. સેન્સેક્સમાં વધ્યા મથાળેથી 356 પોઇન્ટનું ગાબડું પડ્યું હતું અને 17052.78ના મથાળે બંધ રહ્યો હતો. નિફ્ટી 93.85 પોઇન્ટ ઘટીને 5184.25 બંધ રહી હતી.

નિફ્ટી ફરી 5,170ની નજીક આવીને બંધ રહી છે. 200 દિવસની મૂવિંગ એવરેજ આ લેવલ આસપાસ આવે છે. અગાઉ ત્રણ વાર આ લેવલ આસપાસ બજાર આવીને પાછું ફર્યું હોવાથી આ મથાળું બજાર માટે અત્યંત કટોકટીનું ગણી શકાય. જાણકારોના કહેવા પ્રમાણે મંગળવારે કોઇક અઘટિત ઘટના બનશે અને આ મથાળું તૂટશે તો નજીકમાં એક નાનકડું 5,080નું ટેકાનું મથાળું બને છે, ખાસ ટેકો ન પણ આપે. ત્યારબાદ 5,000નું મનોવૈજ્ઞાનિક લેવલ ધ્યાનમાં રાખવાનું રહેશે. સેન્સેક્સના બધા જ શેરો નીચે બંધ હતા અને માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 1.05 લાખ કરોડનું ધોવાણ થયું હતું. મંગળવારે સંસદમાં બજેટની ચર્ચા અને ત્યારબાદ કંપનીઓના પરિણામ બજારની આગામી ચાલ માટે ટ્રેન્ડ સેટર રહેશે. કંપનીઓના એડવાન્સ ટેક્સને કારણે કંપનીઓના નફામાં મોટી વૃદ્ધિ થવાની આશા જણાતી નથી અને તેની અસર હવે પછી જોવા મળશે. એશિયન માર્કેટમાં તાઇવાન સિવાયના અન્ય શેરબજારમાં સ્થિરતા હતી, જ્યારે યુરોપનાં શેરબજારમાં જર્મન કોન્ફિડન્સના આંકડા સુધારાના આવતા સ્થિરતાથી સુધારાનું વાતાવરણ હતું. અમેરિકામાં હાઉસિંગના જાહેર થનારા ડેટા ઉપર નજર હતી.

NCDEX/MCX/NSE/ BSE/CURRENCY
फ्रेंचायजी/ट्रेडिंग/ टर्मिनल के लिये संपर्क करें
इंडो थाई सिक्युरिटीज लि. कमोडिटीज प्रा. लि.
CALL : 099777 99919 098260 19761
NSE - INB/INF 230776739, BSE - INB01776731, MCX-SX - INE260776739, MCX-12040, NCDEX - 00068

નરમાઈ આંકડામાં.. રિઝર્વ બેન્કના સંકેતોથી પણ સેન્ટિમેન્ટ ડહોળાયું

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ હાલમાં સીઆરઆરમાં 0.75 પોઇન્ટ બેસિઝનો ઘટાડો કર્યા બાદ આજે વર્તમાન સ્થિતિમાં પ્રવાહિતા વધારવા પર વધુ ડોઝ આપવાની અને વ્યાજદરમાં મોટો ઘટાડો કરવાની કોઇ શક્યતા જણાતી નથી એવા સંકેતોને પગલે રિયાલ્ટી, પાવર, બેન્કએક્સ, મેટલ, કેપટિલ ગુડઝ સેગ્મેન્ટના શેરોમાં વધુ વેચવાલીનું દબાણ જોવાયું હતું. આગામી મહિનામાં 17મી એપ્રિલે મળનારી રિઝર્વ બેન્કની બેઠક આને કારણે અતિ મહત્ત્વની બનશે.

919/1955
શેરો વધનાર/ઘટનાર રહ્યા હતા

149/243
શેરો ઉપલી/ નીચલી સર્કિટને સ્પર્શ્યા

21/29
શેરો નવી ઊંચી/નીચી સપાટીએ બંધ રહ્યા

રિયાલ્ટી શેરો ઉપર મહારાષ્ટ્ર સરકારનો પ્રહાર

મહારાષ્ટ્ર સરકારે મુંબઈમાં થતા રિયાલ્ટી સોદા ઉપર સ્ટેમ્પ ડ્યૂટી વધારતા રિયાલ્ટી શેરોમાં મંદીનું મોજું ફરી વળ્યું હતું. રિયાલ્ટી આંક સૌથી વધુ 3.58 ટકા તૂટ્યો હતો. ડીબી રિયાલ્ટી 8.24 ટકા ઘટીને 86.25, એચડીઆઈએલ 7.02 ટકા ઘટીને 88.80, ગોદરેજ પ્રોપર્ટીઝ 3.38 ઘટીને 638.30, ફોનિક્સ મિલ 203.95 રહ્યો હતો.

વોલેટિલિટી ઇન્ડેક્સમાં 14.56 ટકાનો ઉછાળો

બજારની વર્તમાન સ્થિતિનો ચિતાર આપતો વોલેટિલિટી ઇન્ડેક્સ એટલે કે એનએસઇનો વીઆઇએક્સમાં આજે 14.56 ટકાનો ઉછાળો જોવાયો હતો. બજાર હાલ અત્યંત અસ્થિરતા વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. 2012ના વર્ષમાં આ સૌથી મોટો ઉછાળો છે અને તે 26.74 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

ડ્યૂટીમાં વધારો થતાં સોનાની આયાત બે વર્ષનાં તળિયે જવાની દહેશત

એજન્સી. મુંબઇ

વર્ષ 2011માં ભારતની સોનાની આયાત 969 ટનની થવા પામી હતી જેના બદલે તે ઘટીને વર્ષ 2012માં 655 ટનની થવાની શક્યતા છે. તેમ પ્રતિભાવ આપનારા 10 લોકોએ જણાવ્યું હતું. આ લોકોમાં આયાતકારો, ઝવેરીઓ તેમજ દલાલોનો સમાવેશ થાય છે.

ઇન્ડસઇન્ડ બેન્કના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ પિનાકિન વ્યાસે જણાવ્યું હતુ કે બજાર તરફથી સાંપડી રહેલા શરૂઆતી પ્રતિભાવો સારાં નથી. ત્રણ જ માસમાં જકાત વધારીને બમણી કરી દેવી તે ગ્રાહકો પચાવી નહીં શકે. વર્ષ 2012 દરમિયાન સોનાની આયાતમાં 30 ટકા સુધીનો ઘટાડો થઈ શકે તેમ છે.

નોંધનીય છે કે વર્ષ 2008માં સોનાના ભાવમાં 22 ટકાનો વધારો થયો તે વખતે લોકોએ સોનું વેચી નાખતા ભારતની સોનાની આયાત ઘટીને 535.88 ટનની થવા પામી હતી. સરકારે કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ ઘટાડવાના આશયથી સોનાની આયાત ઉપર લેવામાં આવતી જકાત બે ટકાથી વધારીને ચાર ટકાની કરી દીધી છે. જેના પરિણામે દેશભરના સોનીઓમાં રોષ ભભૂકી ઊઠ્યો છે અને તેમણે સરકારના આ નિયમ વિરુદ્ધ હડતાળ પાડી છે તેમ છતાં પણ નાણાપ્રધાન પ્રણવ મુખરજી ટસના મસ થતાં નથી.

બોમ્બે બુલિયન એસોસિયેશનના પ્રમુખ પૃથ્વીરાજ કોઠારીએ જણાવ્યું હતું કે માર્ચમાં આમ પણ હિસાબોની પતાવટ કરવાની હોય છે અને હડતાળના કારણે વેપારીઓને નુકસાન ગયું હોવાને કારણે જાન્યુઆરીથી માર્ચમાં દેશની સોનાની આયાત ઘટી છે. સોનાની કિંમતમાં થઈ રહેલા વધારાના કારણે આમ પણ દેશમાં સોનાની માગ ઘટી ગઈ છે. ગત વર્ષ દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા અને ફેબ્રુઆરી માસના અંતે તે 1,790 ડોલર પ્રતિ ઔંસના રહેવા પામ્યા હતા. કોઠારીએ જણાવ્યું હતું કે ગત વર્ષ દરમિયાન દેશમાં સારી એવી માત્રામાં સોનાની આયાત થવા પામી હતી પરંતુ જે રીતે કિંમતમાં અને માગમાં ઘટાડો થઈ રહ્યો છે તે જોતાં વર્ષ 2012માં સોનાની આયાતમાં ધરખમ ઘટાડો થવાની શક્યતા જોવાઈ રહી છે.

જાન્યુ.-માર્ચમાં સોનાની આયાત 56 ટકા ઘટી શકે

જાન્યુઆરીથી માર્ચ માસ દરમિયાન દેશની સોનાની આયાત 56 ટકા ઘટીને 125 ટનની થવા પામી છે જ્યારે ભારત સરકારે સોનાની આયાત જકાત બમણી કરીને ચાર ટકાની કરતાં વર્ષ 2012માં તેની આયાતમાં ત્રીજા ભાગનો ઘટાડો થવાની શક્યતા છે અને તેના કારણે ચીન ફરીથી વિશ્વનું સોનાનું સૌથી મોટું ખરીદાર બની શકે છે. ગત વર્ષે જાન્યુઆરી-માર્ચ 11 દરિમાયાન 283 ટન સોનાની આયાત થઇ હતી. આ વર્ષે છેલ્લા દસ દિવસથી સોનીઓની હડતાળના કારણે દેશભરના વેપારીઓને રૂ.10000 કરોડનું નુકસાન ગયું છે.

રૂપિયો તૂટીને દસ સપ્તાહના તળિયે

ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ

ભારે અફરાતફરીના વાતાવરણ વચ્ચે અમેરિકન ડોલર ફરી ભારતીય રૂપિયાને ભારે પડી રહ્યો છે. આજે 10 પૈસાના ઘટાડા સામે રૂપિયો ડોલર સામે 51.27/28ની સપાટીએ બંધ રહ્યો તે પહેલાં 51.48ની સપાટીએ પહોંચી ગયો હતો. વિદેશી રોકાણકારો ઉપર ટેક્સની દહેશત વચ્ચે શેરબજારોમાં ફરી વળેલા વેચવાલીના રોલરકોસ્ટર ઉપરાંત નાણાકીય વર્ષની આખરે આયાતકારોની ડોલરમાં ધૂમ ખરીદીના કારણે ડોલર એકલા માર્ચ માસમાં જ રૂ. 2.06 મજબૂત બન્યો છે. ફોરેક્સ નિષ્ણાતોના મતે ટૂંકા ગાળાની ચાલ દરમિયાન ડોલર રૂપિયા સામે રૂ. 52ની સપાટી ક્રોસ કરી જાય તો નવાઈ નહિ.

વૈશ્વિક રોકાણકારોને ભારતમાં વિશ્વાસ રહ્યો નથી : માલ્યા

પીટીઆઈ. નવી દિલ્હી

નાણાભીડમાં સપડાયેલી કિંગફિશર એરલાઇન્સ હાલમાં વિદેશી એરલાઇન્સને સ્થાનિક એરલાઇન્સમાં રોકાણ કરવાની છૂટ આપવામાં આવે તેવી વાટાઘાટો કરવામાં લાગેલી છે. પરંતુ વિદેશી રોકાણકારોને ભારતમાં રોકાણ કરવામાં બહુ વિશ્વાસ નથી તેમ જણાવીને એરલાઇન્સના માલિક વિજય માલ્યાએ વિવાદનો મધપુડો છેડ્યો છે.

વિજય માલ્યાએ ટ્વિટર ઉપર જણાવ્યું હતું કે ભારતની છાપ વિશ્વસ્તરે બગડી રહી છે. નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ બજેટ સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે વિદેશી એરલાઇન્સોને સ્થાનિક એરલાઇન્સમાં 49 ટકા સુધીનો

હિસ્સો ખરીદવાની મંજૂરી આપવામાં આવે તે અંગે સરકાર ગંભીરતાપૂર્વક વિચારી રહી છે. જોકે, માલ્યાએ તે અંગે શંકા વ્યક્ત કરી છે કે વૈશ્વિક રોકાણકારો ભારતનાં ઉડ્ડયન ક્ષેત્રે રોકાણ કરવા માટે તૈયાર થશે કે કેમ? કોઈ પણ વિદેશી રોકાણકારને લાગતું નથી કે ભારતમાં રોકાણ માટેની તકો રહેલી છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે બજેટ બાદ માલ્યાએ ટ્વિટર ઉપર લખ્યું હતું કે બજેટ સારું, સંતુલિત અને વ્યવહારુ છે.

શેરબજારોમાં અફરાતફરીથી સરકાર ચિંતિત

પીટીઆઇ. નવી દિલ્હી

દેશભરનાં શેરબજારોમાં વ્યાપી રહેલી અસ્થિરતા વિવિધ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક પરિબળોને કારણે છે અને મૂડીબજારની સંકલિતતા જળવાઈ રહે તે માટે એક સિસ્ટમ અમલમાં લાવવામાં આવશે તેમ સરકારે જણાવ્યું હતું.

2જી જાન્યુઆરી 2012થી 16મી માર્ચ સુધીમાં શેરબજારમાં 2.73 ટકાના ઘટાડાથી માંડીને 2.77 ટકાના વધારા સુધીની ચાલ જોવા મળી છે. જે પરિબળોના કારણે શેરબજારોમાં અસ્થિરતા જોવા મળી છે તેમાં કદાચ ઈરાનમાં વ્યાપેલી તંગદિલીને કારણે ઓઇલના વધતા જતા ભાવ, યુરોઝોનમાં વ્યાપેલી આર્થિક કટોકટી અને ચીનનો વિકાસદર મંદ પડવાની શક્યતા ગણાવી શકાય. તદુપરાંત ભારતમાં ઔદ્યોગિક વિકાસદર વધવાને કારણે, ફુગાવો ઘટવાને કારણે અને આરબીઆઈ દ્વારા સીઆરઆરમાં ઘટાડો કરીને નાણાવ્યવસ્થામાં રૂ. 80,000 કરોડ ઠાલવવામાં આવતાં પણ તેની અસર શેરબજારો ઉપર પડી છે. સેબી બજારની ગતિવિધિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યું છે. સિસ્ટમમાં એડવાન્સ રિસ્ક મેનેજમેન્ટ મિકેનિઝમ, વિવિધ પોઝિશન્સ ઉપરની મર્યાદા, માર્જિનની જરૂરિયાત અને સર્કિટ ફિલ્ટરનો સમાવેશ થાય છે.

બિઝનેસ પ્લસ

આરતી રોડવેઝ લિ. ટ્રાન્સપોર્ટના એમ.ડી.દીપક શાહને એક્સલેન્સી એવોર્ડ એનાયત કરાયો

આણંદ સ્થિત આરતી રોડવેઝ લિ.મીના દીપક શાહે 1984માં એક કન્ટેનરથી ટ્રાન્સપોર્ટ બિઝનેસ શરૂ કર્યો હતો. તેમની કોઠાબુદ્ધિ અને અનેક શિખરો આંબવાની ધગશથી તથા સ્વ. ચંદ્રકાન્તભાઈ રામચંન્દ્ર શાહના આશિર્વાદથી આજે દેશભરમાં ટ્રાન્સપોર્ટરોમાં આરતી રોડવેઝ 800 કન્ટેનર ટ્રક્સ ધરાવે છે અને ગ્રાહકલક્ષી સેવાઓ, પ્રામાણિકતા તથા અથાગ પુરૂષાર્થના પરિણામે તેમને દિલ્હી ખાતે ગત 19/12/11ના રોજ મહિન્દ્રા નેવી સ્ટાર ટ્રાન્સપોર્ટ એક્સલેન્સી એવોર્ડ 2011થી અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. તથા ક્રિસીલનું સૌથી ઉચ્ચસ્તરીય રેટિંગ પણ પ્રાપ્ત થયેલ છે. ચરોતરના ગૌરવ સમા આરતી રોડવેઝ લિ.ના એમ.ડી. દીપક શાહને એવોર્ડ સન્માનીત કરતા ભારત સરકારના ભારે ઉદ્યોગ મંત્રાલયના સચિવ એસ. સુદર્શન સાથે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા ડો. પવન ગોએન્કા, નલીન મહેતા સહિત દેશભરના ખ્યાતનામ ઉદ્યોગપતિઓ આ એવોર્ડ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતાં.



સિંગતેલ ₹ 2010ની નવી ટોચે

ભાસ્કર ન્યૂઝ. રાજકોટ

આજે સપ્તાહની શરૂઆતે સિંગતેલ રૂ.20 વધી રૂ.2010ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું. તેની પાછળ કપાસિયા-પામોલિનમાં પણ ઉછાળો હતો. એરંડા વાયદામાં ઘટાડાની ચાલ હતી જ્યારે મલેશિયા પામ વાયદો વધીને નવ મહિનાની ઊંચી સપાટીએ હતો. કાચામાલની મળતર ન હોવાનું કારણ આગળ ધરીને તેલિયારાજાઓ સતત ભાવ વધારી રહ્યા છે. આજે વધુ રૂ.20ના ઉછાળા સાથે છેલ્લા ચાર દિવસમાં જ ડબે રૂ.80નો ભાવવધારો થઈ ગયો છે. આજે સિંગતેલમાં 4-5 ટેન્કર અને કપાસિયા તેલમાં 80-90 ટેન્કરના કામકાજ હતા. સિંગતેલ લુઝ રૂ.1190-1195, તેલિયા રૂ.1826-1827, નવા ટીન 15 કિલો રૂ.20 વધી રૂ.2005-2010, 15 કિલો લેબલ ટીન રૂ.20 વધી રૂ.1985-1990, તેલિયા ટીન રૂ.1960-1980 અને લેબલ ટીનના રૂ.2040-2070ના ભાવ હતા.

ચાર દિવસમાં ₹80નો ઉછાળો, એક કિલોના રૂ.132

પિલાણ માટે મગફળીની ઓછી મળતરને કારણે સિંગતેલના ભાવ ભડકે બળી રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં ડબે રૂ.80નો તોતિંગ ભાવવધારો થયો છે. સરકારે હજી સુધી કોઇ પગલાં ન લેતા તેલિયારાજાઓ સતત ભાવ ઊંચકાવી રહ્યા છે. ગત વર્ષના 20 લાખ ટનના ઉત્પાદનની સામે ચાલુ વર્ષે ગુજરાતમાં 16 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું છે.વિદેશમાં સિંગદાણાની માગ સારી હોવાથી ઢગલાબંધ માલ વિદેશમાં ઠલવાઇ ગયો છે જેના કારણે પિલાણ માટે માલની મળતર રહેતી નથી. મિલર્સ આ કારણ આગળ ધરીને સતત ભાવ ઊંચકાવી રહ્યા છે. ઊંચા ભાવને કારણે સિંગતેલનો વપરાશ ઘટ્યો છે. સોમાના કહેવા પ્રમાણે ગુજરાતમાં સિંગતેલનો વપરાશ ઘટીને ત્રણ ટકા થયો છે અને ઉત્પાદન પણ ઘટી ગયું છે. સૌરાષ્ટ્રમાં હવે જે મગફળી છે તે સ્ટોકિસ્ટ, મિલર્સ અને મજબૂત ખેડૂતોના હાથમાં છે. તેલબજારના વેપારીઓના કહેવા પ્રમાણે સિંગતેલના ઊંચા ભાવને કારણે કપાસિયા, પામોલિન અને સનફ્લાવર સહિતના તેલનો વપરાશ વધ્યો છે.

સોનું ₹ 28400ની પાર, વિશ્વબજારમાં 1685 ડોલર

ભાસ્કર ન્યૂઝ. રાજકોટ

કિંમતી ધાતુઓમાં ઇનવેસ્ટમેન્ટ માગ વધતા વિશ્વબજારમાં મોડી સાંજે સોના ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો હતો. મુંબઇ ખાતે સોનું બુધવારના બંધ ભાવથી વધીને રૂ.28410ના ભાવે પહોંચ્યું હતું. હડતાળને કારણે રાજકોટ અને અમદાવાદની ઝવેરી બજાર બંધ રહી હતી. બુધવારના બંધભાવથી સોનું રૂ.420 વધી રૂ.28410 અને ચાંદી રૂ.858 વધી રૂ.56915ના સ્તરે હતી. વિશ્વબજારમાં હાજરમાં સોનું 25.42 ડોલર વધી 1686.20 ડોલર અને ચાંદી 59 સેન્ટ વધી 32.78 ડોલર પ્રતિ ઔંશ થઇ હતી.

વિવિધ બજાર

અમદાવાદ તેલબજાર

અમ. તેલીયાટીન	1960-1980
અમ. લેબલટીન	2040-2070
સનફ્લાવર	1180-1250
દિવેલ	1200-1270
વનસ્પતિ ઘી	980-1080
કોપરેલ	1230-1250
પામોલીન	1010-1040
કપાસિયા (જૂના)	1115-1130

રાજકોટ છેલ્લા ભાવ

તેલિયા ટીન	1826-1827
સીંગતેલ લૂઝ	1190-1195
કપાસિયા તેલ વોશ	657-660
એરંડા જૂન	3560
દિવેલ 10 કિલો	720
રાજકોટ મગફળી	1040-1041
જામનગર મગફળી	950-1075
જામનગર લુઝ	1200
જામનગર તેલિયા	1835-1875

ખાંડબજાર

અમદાવાદ M.30	2975-3100
અમદાવાદ S.30	2875-2950
ગુજરાત M.30	2875-2900
ગુજરાત S.30	2780-2830
કોલ્હાપુર M.30	2770-2840
કોલ્હાપુર S.30	2700-2760
બેલાપુર M.30	2810-2870
બેલાપુર S.30	2825-2875

કીમતી ધાતુ (ડોલરમાં)

સોનું	1685.80
ચાંદી	32.80
કોમેક્ષ સોનું	1685.10
કોમેક્ષ ચાંદી	32.81
પ્લેટીનમ	1643.00
પેલેડિયમ	664.00

(વાડીલાલ ફોરેક્સ ડિવિઝન

ચીમનભાઈ પટેલ માર્કેટ

20 કિલોના ભાવ

બટાકા	90-130
ડુંગળી મહારાષ્ટ્ર	90-130
ડુંગળી સૌરાષ્ટ્ર	60-110
કિલોના ભાવ	
બટાકા કિલોના	6-8
ડુંગળી કિલોના	5-8

શાકભાજી

રીંગણ	60-120
રવૈયા	60-140
કોબીજ	140-220
ફુલાવર	100-160
ટામેટા	100-240
દૂધી	100-220
ભીંડા	600-900
કાકડી	200-800
કારેલાં	360-600
ગવાર	600-1200
ગીલોડા	400-600
દેશી મરચાં	200-400
લીંબુ	900-1100
આદુ	240-320
કોથમીર	80-120
શીમલા મિર્ચ	200-600

ફૂલ બજાર

કિલોના ભાવ

ગુલાબ	25-40
તગર	120-140
પારસ	100-130
ડમરો	8-10
લીલી(એક જૂડી)	3-4
હજારીગલ(20 કિલો)	500-600

મુંબઇ ધાતુબજાર

તાબું કેબલ ભંગાર	478
તાબું વાયર બાર	506
તાબું ભંગાર ભારે	470
એલ્યુ. ઇંગોટ	133
કોપર આર્મિચર	462
જસત	130
તાંબુ વાસણ ભંગાર	437
સીસું	118
કોપર શીટ કટિંગ	456
ટીન	1325
પિત્તળ વાસણ ભંગાર	317
નિકલ	1098
પિત્તળ શીટ કટિંગ	326
એલ્યુ. વાસણ ભંગાર	110

વિવિધ બજારના ભાવ

બાવળા

ડાં. આઇઆર	220-280
ટુકડા દેશી	240-360
ટુકડા ઘઉં	228-266
એરંડા	666-673
ચણા	705-844
સફેદઘઉં	219-427
રાઇ	702-707
તુવેર	640
જવ	275-279
ડાં.ગુજ.17	240-277

શેરબજારના ભાવ

ભુજ સ્થાનિક બજારભાવ	
(૧૦૦ કિલોના)	
ઘઉં નવા	૧૪૦૦-૨૨૦૦
બાજરો	૧૩૫૦-૧૪૨૫
ચોખા આઇઆર	૧૬૫૦-૧૭૫૦
ચોખા બેગમી	૨૦૦૦-૨૧૫૦
ચોખા જીરાસર	૨૨૦૦-૪૦૦૦
મગ નવા	૪૭૦૦-૫૪૦૦
મગ ફાડા	૪૭૫૦-૪૯૦૦
મોગરદાળ	૫૩૦૦-૫૫૦૦
તુવેરદાળ	૫૧૦૦-૬૧૫૦
તુવેરદાળ રેંટિયો	૭૨૦૦-૭૫૦૦
ચણાદાળ	૪૭૫૦-૪૯૫૦
અડદદાળ	૪૮૦૦-૫૫૦૦
ખાંડ એસ	૨૯૮૦-૩૦૨૦
ખાંડ એમ	૩૦૪૦-૩૦૮૦
ખાંડ કટ્ટા	૩૦૦૦-૩૦૪૦
ટીનના ભાવ (વેટ સહિત)	
સીંગતેલ ૧૫ લિટર	૧૯૦૦-૧૯૨૦
સીંગતેલ ૧૫ કિલો	૨૦૦૦-૨૦૯૦
વેજીટેબલ ૧૫ કિલો	૧૦૭૦-૧૧૨૦
કપાસિયા તેલ	૧૧૪૦-૧૨૪૦
કપાસિયા તેલ ૧૫ લિટર	૧૧૬૫-૧૧૭૦
કોપરેલ ૧૫ કિલો	૧૩૧૦-૧૩૩૦
પામોલીન	૧૦૦૮-૧૦૧૦
સૂરજમુખી	૧૨૦૦-૧૨૮૦
સોયાબીન	૧૨૩૦-૧૨૫૦
૨૦ કિલોના ભાવ	
કોલ્હાપુરી ગોળ	૬૭૦-૭૫૦

યુપી	૫૩૦-૫૬૦
એક ગૂણીના ભાવ	
કપાસીયા ખોળ	૬૧૫-૬૨૫
ઝીણુ ભૂસું	૫૫૫-૬૩૦
બેસન ૫૦ કિલો	૨૪૫૦-૨૯૨૦
કપાસિયા જાડા (વેટ સહિત)	૮૦૦
ભુજ માર્કેટ યાર્ડ	
(૧૦૦ કિલોના ભાવ)	
મઠ	૨૦૦૦-૨૪૮૦
ગોવાર	૧૭૦૦૦-૨૪૦૦૦
મગ	૨૩૦૦-૪૪૦૦
(૪૦ કિલોના ભાવ)	
એરંડા	૧૩૦૬-૧૩૪૬
રાયડો	૧૩૯૧-૧૪૪૦
ખાદ્યાજીરુ	૩૬૨૦-૪૪૦૦
રાઇ	૧૬૮૦-૧૭૬૦
તલી	૨૧૦૦-૨૩૦૦
ભુજ શાક માર્કેટ	
૧ કિલોના ભાવ	
ડુંગળી	૪-૫
બટાટા	૫-૭
ટમેટા	૬-૧૨
મરચા	૧૮-૨૨
રીંગણા	૪-૫
કોબી	૪-૫
ફુલાવર	૧૦-૧૧
ધાણા	૫-૮
ભીંડા	૨૫-૪૦
કાકડી	૧૦-૧૨

પાલક	૪-૬
લસણ	૧૫-૧૮
લીંબુ	૪૦-૫૦
ગીસોડા	૨૫-૩૦
દૂધી	૮-૧૨
આદુ	૧૫-૧૮
કારેલા	૨૦-૨૫
સક્કરીયા	૧૦-૧૧
ચોળા	૨૫-૪૦
ગીલોડા	૧૮-૨૦
મરચા સિમલા	૨૦-૨૨
કેળા કાચા	૮-૧૦
કેળા પાકા	૯-૧૦
પપૈયા કાચા	૪-૫
અંજાર માર્કેટ યાર્ડ	
કપાસ	૧૬૭૦-૧૭૧૧
રાયડો	૧૩૫૦-૧૪૩૧
એરંડા	૧૩૧૧-૧૩૩૮
ધાણા	૧૬૫૦-૧૮૫૦
જીરુ	૩૬૦૦-૪૩૦૦
ગોવાર	૨૦૦૦૦-૨૩૩૦૦
મુન્દ્રામાર્કેટ યાર્ડ	
ગોવાર	૨૦૫૦૦-૨૩૫૦૦
મગ	૨૫૫૦-૪૦૫૦
એરંડા	૧૩૬૧-૧૩૯૮
રાપર માર્કેટ યાર્ડ	
ગોવાર	૩૮૫૧-૪૦૮૧
જીરુ	૧૭૬૧-૨૧૭૧
મગ	૫૦૦

ઇશબગુલ	૯૧૦-૯૭૭
એરંડા	૬૭૦
ભચાઉ માર્કેટ યાર્ડ	
એરંડા	૬૬૭-૬૭૯
ગોવાર	૪૨૦૦-૪૫૦૦
મગ	૫૮૨-૬૪૩
શાકજીરુ	૧૯૫૧-૨૧૦૦
મઠ	૪૭૪-૪૮૦
રાયડો	૬૫૦-૭૦૯
ગાંધીધામ બિલ્ટી	
એરંડા	૬૯૫
રાજકોટ દિવેલ	૭૨૦
રાજકોટ ખાંડી	૩૫૬૦
ઉંઝા માર્કેટ યાર્ડ	
જીરુ	૧૭૦૦-૨૯૩૫
વરિયાળી	૭૯૫-૨૧૨૫
ઇસબગુલ	૯૫૦-૧૨૦૦
સરસવ	૯૦૦-૧૨૦૦
રાયડો	૬૭૬-૭૭૩
તલ	૯૭૧-૧૨૨૦
માણાવદર	
કપાસ	૬૪૦-૮૭૭
ગાંસડી	૩૪૦૦૦-૩૪૨૦૦
કપાસિયા	૩૪૬-૩૫૨
સુરેન્દ્ર કપાસ	
ખુલી	૮૦૭.૩૦
વધી	૮૧૧.૦૦
ઘટી	૮૦૬.૮૦
બંધ	૮૦૮.૨૦

કચ્છી કંપની શેરબજાર	
૨૦ માઇક્રોન્સ લિ.	૮૧.૦૫
આરતી ડ્રગ્સ લિ.	૯૭.૯૫
આરતી ઇન્ડિયા લિ.	૫૯.૨૦
અદાણી પાવર લિ.	૬૬.૪૦
અલાઇડ કોમ્પ્યૂટર ઇન્ડ.	૨.૪૭
આશાપુરા માઇન લિ.	૧૧.૮૦
ઓસ્ટ્રલ કોક એન્ડ પ્રો.	૧.૩૭
ડેગર ફોર્સ્ટ	૪.૩૮
ઇલેક્ટ્રોથર્મ ઇન	૭૦.૯૦
યુરો સીરામીક લિ.	૧૦.૪૭
યુરો મલ્ટીવિઝન લિ.	૫.૫૦
એવરેસ્ટ કાંટો	૩૨.૦૫
એકસેલ ક્રોપ કેર	૧૧૮.૬૦
એકસેલ ઇન્ડસ્ટ્રીઝ	૭૦.૭૦
ગેલન્ટ મેટલ	૧૭.૩૦
જીનસ પાવર	૧૦.૬૩
ગોકુલ રિફોઇલ્સ	૭૬.૬૫
ગુજ.મિનરલડેવ	૧૭૪.૩૫
ગુજ. એનઆરઇ કોક	૨૧.૭૫
હરીયા એક્સપોર્ટ લી.	૩.૪૩
હિન્દુસ્તાન લિવર	૪૦૨.૩૦
ઇપ્કા લેબોરેટરી	૩૩૫.૫૦
જિંદાલ સો લિ.	૧૭૦.૦૦
કચ્છ મિનરલ્સ લિ.	૭.૭૨
કનોરિયા કેમિકલ્સ	૩૨.૦૫
કેશર એન્ટ.	૪૨.૨૦
માન ઇન્ડ. ઇન્ડિયા	૧૦૩.૦૫
માનકસીઆ લિ.	૫૪.૦૦

મુન્દ્રા પોર્ટ સ્પેશિઆ	૧૧૯.૯૫
નવનીત પબ્લિકેટ	૫૯.૦૦
પી એસ એલ લિ.	૬૦.૨૫
પ્રાજ ઇન્ડસ્ટ્રિઝ	૭૯.૦૦
રામકો ઇન્ડ.	૪૫.૪૦
રત્નમણિ મેટલ્સ	૧૦૭.૦૦
રૂચિ સોયા ઇન્ડસ્ટ્રિઝ	૯૧.૨૫
સાલ સ્ટીલ	૪.૬૯
સફારી ઇન્ડસ	૧૬૫.૩૫
સાંઘી ઇન્ડ.	૧૬.૯૫
સીન્ટેક્સ ઇન્ડ.	૮૧.૧૦
શ્રી અધિકારી બ્રધર્સ	૭૧.૫૫
સુઝલોન એનર્જી લિ.	૨૭.૨૫
ટાટા પાવર કો.	૯૫.૮૦
ટોક્યો પ્લાસ્ટ ઇન્ટી	૨૧.૨૫
વિડિયોકોન એપ્લા.	૧૪.૪૫
વિમલ ઓઇલ એન્ડ ફુડ	૫૦.૦૦
વેલસ્પન ગુજરાત	૧૩૮.૬૦
વેલસ્પન ઇન્ડિયા	૪૪.૧૫
વિદેશી હૂંડિયામણ	
ટ્રાવેલ્સ ચેક	
ડોલર	૫૦.૨૫-૫૧.૮૦
પાઉન્ડ	૭૯.૪૦-૮૨.૪૫
યુરો	૬૬.૪૫-૬૮.૮૫
કરન્સી	
ડોલર	૫૦.૬૦-૫૧.૯૫
પાઉન્ડ	૮૦.૦૦-૮૨.૬૫
યુરો	૬૬.૯૫-૬૯.૦૦
૧૦ ગ્રામ ગોલ્ડ કોઇન	૩૦૮૪૮

ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક
(સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડવલપમેન્ટ બેન્ક ઑફ ઇન્ડિયા એક્ટ ૧૯૮૯નાં અંતર્ગત સંસ્થાપિત કાર્પોરેશન)
SIDBI
નવજીવન અમૃત જયંતિ ભવન, પહેલો માળ, નવજીવન પી.ઓ., અમદાવાદ - ૧૪.
ફોનઃ ૨૭૫૪૧૫૪૮/૩૦૬૨/૬૩/૬૭, ફેક્સઃ ૨૭૫૪૧૦૮૬
વેબસાઇટ : www.sidbi.com

જાહેર નોટિસ

આથી જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે
મેસર્સ શહીબાબા સિન્ટેક્સ (ઇન્ડિયા) પ્રા. લિમિટેડ, એક કંપની જેની પોતાની રજિસ્ટર્ડ ઑફિસ ૧, હરિઓમ શિવશંકર સોસાયટી, સીટીએમ ચાર રસ્તા, અમરાઈવાડી, અમદાવાદ સાથે
(૧) **શ્રી નટવરલાલ કે. પટેલ, પુત્ર શ્રી કેશવલાલ પટેલ છે,** જેમની ઉંમ્ર ૬૩ વર્ષ છે અને છેલ્લું નિવાસ ૨, હરિઓમ શિવશંકર સોસાયટી, સીટીએમ ચાર રસ્તા, અમરાઈવાડી, અમદાવાદ.
(૨) **શ્રી મુકેશ આર. પટેલ, પુત્ર રમણભાઈ પટેલ,** જેમની ઉંમ્ર અને છેલ્લું નિવાસ, ૨૬, જ્યોતિકા પાર્ક સોસાયટી કલોલ, મહેસાણા અને
(૩) **શ્રી જગદીશ આર. પટેલ, પુત્ર શ્રી રમણભાઈ પટેલ,** ઉંમ્ર ૪૦ વર્ષ અને છેલ્લું નિવાસ, ૨૬, જ્યોતિકા પાર્ક સોસાયટી, કલોલ, મહેસાણા
જેઓ ડિરેક્ટર/ ગારેન્ટર છે, જેમણે ૭૮૪, રનકપુર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, સાંતેજ, મહેસાણામાં ટ્વિસ્ટેડ યાર્નનાં ઉત્પાદન માટેની યુનિટ સ્થાપિત કરવા માટે સિડબીથી ₹ ૭૩ લાખની ટર્મ લોન લીધેલ હતી. ઉપરોક્ત વ્યક્તિઓએ જે સરનામું આપેલ છે તેઓ ત્યાં ઉપલબ્ધ નથી અને ટ્રેસ પણ થયેલ નથી. કંપની/ ફર્મને અમારી બેન્કે નાદાર (ડિફોલ્ટર) કરેલ છે, જેથી સિડબીએ રિકવરી માટે પ્રક્રિયા કરેલ હતી, જે ઋણ વસૂલી અધિકરણ, અમદાવાદમાં પેન્ડિંગ છે.
અમે જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે ઉપરોક્ત વ્યક્તિઓ અને તેમની માલિકીની કોઈપણ સ્થાવર મિલ્કત માટેની માહિતી હોય તો અમારાં ઉપર દર્શાવેલ સરનામે જાણ કરશો અને જનતાનાં પૈસાની વસૂલી કરવામાં અમારી મદદ કરશો. વ્યક્તિનું નામ અને તેની માહિતી ગુપ્ત રાખવામાં આવશે. જાહેર જનતાને આ પણ અપીલ કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત વ્યક્તિઓથી મિલ્કત સંબંધિત કોઈપણ વ્યવહાર નહિં કરે.
સ્થળ : અમદાવાદ **સહી/-**
તારીખ : ૨૭-૩-૨૦૧૨ **શાખા ઇન્ચાર્જ, સીડબી**

Digitally Archived by: www.realpatidar.com/library

ન્યૂઝ ઇનબોક્સ

વન-ડે રેન્કિંગમાં ધોનીની આગેકૂચ

દુબઇ | ભારતીય સુકાની મહેન્દ્રસિંહ ધોની તથા ઓફ સ્પિનર અશ્વિને આઇસીસી વન-ડે રેન્કિંગના બેટ્સમેન તથા બોલર્સની યાદીમાં આગેકૂચ કરી છે. ધોનીને એક ક્રમાંકનો ફાયદો થયો છે અને અશ્વિન ચાર ક્રમાંક આગળ આવીને ટોપ ટેન બોલર્સમાં છઠ્ઠા ક્રમે પહોંચ્યો છે. ટીમ ચેમ્પિયનશિપમાં ભારત 117 રેટિંગ પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. સચિન તેંડુલકર બે ક્રમાંક આગળ આવીને 27મા તથા સુરેશ રૈના ચાર ક્રમાંક આગળ આવીને 32મા ક્રમાંકે પહોંચ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે શ્રેણી 2-2થી ડ્રો રહેતા ઓસ્ટ્રેલિયાને ચાર રેટિંગ પોઇન્ટનું નુકસાન થયું છે. બીજી તરફ વિન્ડીઝ ટીમે સાત રેટિંગ પોઇન્ટનો ફાયદો મેળવ્યો છે. તે હવે ન્યૂઝીલેન્ડ સામે 86 રેટિંગ પોઇન્ટ સાથે સાતમા ક્રમે છે. એશિયા કપ ગુમાવ્યા બાદ શ્રીલંકન ટીમ ઇંગ્લેન્ડ બાદ પાંચમા ક્રમે છે. શ્રીલંકા તથા બાંગ્લાદેશ સામે વિજય મેળવીને પાકિસ્તાનની ટીમ છઠ્ઠા ક્રમે છે.

વુડ્સે 30 મહિના બાદ ટાઇટલ જીત્યું

ઓરલેન્ડો | ટાઇગર વૂડ્સે પોતાની કારકિર્દીના સૌથી લાંબા ટાઇટલના દુકાળને પૂરો કરીને આર્નોલ્ડ પામર ગોલ્ફ ટૂર્નામેન્ટમાં ગ્રીમ મેકડોવેલ સામે પાંચ શોટ્સથી વિજય હાંસલ કર્યો હતો. 2009માં વુડ્સે વ્યક્તિગત જીવનમાં સેક્સ સ્કેન્ડલ્સ સપાટી પર આવ્યા બાદ આ 30 મહિનામાં પ્રથમ ટાઇટલ જીત્યું છે.

માઇકલ ક્લાર્કને પૂણેએ ઓફર કરી

મેલબોર્ન | ઓસ્ટ્રેલિયન ક્રિકેટ સુકાની માઇકલ ક્લાર્કને આઇપીએલની પાંચમી સિઝન માટે પૂણે વોરિયર્સ ફ્રેન્ચાઇઝી તરફથી ઓફર કરવામાં આવી છે પરંતુ કાંગારું ક્રિકેટરે હજુ તેનો સ્વીકાર કર્યો નથી. ક્લાર્કે જણાવ્યું હતું કે મારી મેનેજમેન્ટ કંપની પૂણે ફ્રેન્ચાઇઝી સાથે વાટાઘાટ કર્યા બાદ જ હું ઓફરને સ્વીકારીશ.

ઇજાગ્રસ્ત

તસવીર એએફપી

વેલિંગ્ટન ખાતેની ત્રીજી ટેસ્ટ દરમિયાન સાઉથ આફ્રિકન બોલર મોર્કેલના ઘાતક બાઉન્સરમાં ન્યૂઝીલેન્ડના રોઝ ટેલરને કાંડામાં બોલ વાગતાં તે ઇજાગ્રસ્ત બન્યો હતો.

દ. આફ્રિકન બોર્ડ આઇપીએલના નાણાં ચકાસશે

જોહાનિસબર્ગ | સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડ ઇન્ડિયન પ્રીમિયર લીગ દ્વારા તેને 20 કરોડ રેન્ડનું પેમેન્ટ કરવામાં આવ્યું છે કે નહીં તથા તેનું ઓડિટ કરાયું છે કે નહીં તેની તપાસ કરશે. આઇપીએલથી મળેલા નાણાં મોટો વિવાદ બન્યો છે અને આ કારણોસર સીએસએના સીઇઓ ગેરાલ્ડ મજોલાને શિસ્તભંગ કાર્યવાહીમાં ગેરહાજર રહેવાના કારણે બરતરફ પણ કરી દેવામાં આવ્યા છે. આ મુદ્દે સીએસએની અંદર લગભગ બે વર્ષથી ચાલી રહેલા વિવાદની સત્તાવાર તથા કાનૂની તપાસ કરવામાં આવશે. ભારતમાં યોજાયેલી ચૂંટણીઓને તથા સુરક્ષાને ધ્યાનમાં રાખીને આઇપીએલની બીજી સિઝનનું આયોજન સાઉથ આફ્રિકામાં કરવામાં આવ્યું હતું. આઇપીએલના બરતરફ કમિશનર લલિત મોદીએ સાઉથ આફ્રિકાના સિનિયર અધિકારીઓને જંગી રકમનું બોનસ આપ્યું હતું.

કોર્ટનો ચુકાદો | ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ક્રિસ કેઇન્સ સામે લંડનની કોર્ટમાં મોદી માનહાનિના દાવાનો કેસ હારી ગયા

લલિત મોદીને 73 લાખનો દંડ

પીટીઆઇ. લંડન

આઇપીએલના બરતરફ ભૂતપૂર્વ કમિશનર લલિત મોદીની મુશ્કેલીઓનો અંત આવી રહ્યો હોય તેમ લાગતું નથી અને તે ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ક્રિસ કેઇન્સ સામે માનહાનિનો દાવો હારી ગયા હતા. હવે મોદીએ કેઇન્સને લગભગ 73 લાખ રૂપિયા (90 હજાર પાઉન્ડ) ચૂકવવા પડશે. જ્યારે આ ચુકાદો આવ્યો ત્યારે બંને પક્ષ તરફથી લંડનની કોર્ટમાં કોઇ હાજર રહ્યું નહોતું. મોદી આ ચુકાદા સામે અપીલ કરી શકે છે. મોદીએ કેઇન્સ પર 2008ની આઇસીએલ મેચ દરમિયાન મેચફિક્સિંગમાં સંડોવણીનો આક્ષેપ કર્યો હતો. કોર્ટના ચુકાદા મુજબ વિવાદોથી ઘેરાયેલા મોદીએ આગામી 28 દિવસમાં કેઇન્સને 73 લાખ રૂપિયાની જંગી રકમનો એક હિસ્સો આપવો પડશે અને તેમની પાસે અપીલ કરવા માટે 20મી એપ્રિલ સુધીનો સમય છે. જ્યારે મોદીના વકીલે આ ચુકાદાને સ્થગિત કરવાનો આગ્રહ કર્યો ત્યારે કોર્ટે જણાવ્યું હતું કે તમારા અસીલે આ માટે કોર્ટને સંતોષજનક દલીલ આપવી પડશે.

કેઇન્સ આઇસીએલ ટ્વેન્ટી20 લીગમાં ચંદીગઢ લાયન્સની ટીમનો સુકાની હતો પરંતુ તેનો કરાર ટૂર્નામેન્ટની ત્રીજી સિઝનમાં 2008ના ઓક્ટોબરમાં સમાપ્ત કરવામાં આવ્યો હતો. તેને સત્તાવાર કારણ આપવામાં આવ્યું હતું કે કેઇન્સને ઘૂંટણની ઇજાનો ઘટસ્ફોટ નહીં કરીને કરારની શરતોનો ભંગ કર્યો હતો. કોર્ટના ચુકાદા બાદ મોદીએ તરત જ ટ્વિટર પર લખ્યું હતું કે મેં ચૂકાદો સાંભળ્યો છે અને હું તેની સામે અપીલ કરીશ. કેઇન્સે 2010માં મોદીએ કરેલા આક્ષેપ બાદ તેમની સામે માનહાનિનો દાવો માંડ્યો હતો. કેઇન્સે જણાવ્યું હતું કે મોદીના આક્ષેપો બિનપાયાદાર તથા અપમાનજનક છે જેના કારણે મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે.

શ્રીલંકાના ધબડકા બાદ મહેલા જયવર્દનેએ બાજી સંભાળી

પ્રથમ ટેસ્ટ : શ્રીલંકા 8/289, જયવર્દનેએ કારકિર્દીની 30મી સદી નોંધાવી, એન્ડરસનની ત્રણ વિકેટ

એજન્સી. ગોલ

સુકાની મહેલા જયવર્દનેએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કરી પોતાની કારકિર્દીની 30મી સદી ફટકારવા ઉપરાંત અહીં ઇંગ્લેન્ડ સામે રમાતી પ્રથમ ટેસ્ટના પ્રારંભિક દિવસે પોતાની શ્રીલંકન ટીમને શરૂઆતના સંકટમાંથી બહાર કાઢીને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી દીધી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર શ્રીલંકન ટીમે પ્રથમ દિવસે આઠ વિકેટે 289 રન બનાવ્યા હતા. રમતના અંતે જયવર્દને 168 તથા વેલેગેડેરા દસ રને રમી રહ્યા હતા. શ્રીલંકાની શરૂઆત નિરાશાજનક રહી હતી અને બીજી જ ઓવરમાં ઇંગ્લિશ બોલર એન્ડરસને સતત બે વિકેટ ઝડપીને યજમાન ટીમને મુશ્કેલીમાં મૂકી દીધી હતી. ચોથી ઓવરમાં શ્રીલંકાએ માત્ર 15 રનના સ્કોરે ત્રણ ટોચના બેટ્સમેન ગુમાવી દીધા હતા. ત્યારબાદ જયવર્દનેએ બાજી સંભાળીને સમરવીરા સાથે ચોથી વિકેટ માટે બાવન તથા ચંદીમલ સાથે પાંચમી વિકેટ માટે 61 રનની ભાગીદારી નોંધાવી હતી.

જયવર્દનેએ હેરાથ સાથે આઠમી વિકેટ માટે 61 રનની ભાગીદારી નોંધાવી હતી જેમાં હેરાથે માત્ર પાંચ રનનું યોગદાન આપ્યું હતું.

સ્કોરબોર્ડ

શ્રીલંકા પ્રથમ દાવ	રન	બોલ	4	6
થિરિમાને કો. સ્વાન બો. એન્ડરસન	3	12	0	0
દિલશાન કો. સ્ટ્રાઉસ બો. બ્રોડ	11	8	2	0
સંગાકારા કો. પ્રાયર બો. એન્ડરસન	0	1	0	0
જયવર્દને રમતમાં	168	290	20	3
સમરવીરા રનઆઉટ	20	82	3	0
ચંદીમલ કો. બેલ બો. પટેલ	27	48	2	2
એચ. જયવર્દને એલબી બો. એન્ડરસન	23	40	3	0
રણદીવ રનઆઉટ	12	15	1	0
હેરાથ એલબી બો. પટેલ	5	30	0	0
વેલેગેડેરા રમતમાં	10	18	2	0

એક્સ્ટ્રા : 10. કુલ : (90 ઓવરમાં, આઠ વિકેટે) 289.
વિકેટ : 1-11, 2-11, 3-15, 4-67, 5-128, 6-170, 7-191, 8-253.
બોલિંગ : જેમ્સ એન્ડરસન : 17-5-56-3, સ્ટુઅર્ટ બ્રોડ : 18-1-66-1, પાનેસર : 23-11-42-0, સ્વાન : 23-3-92-0, પટેલ : 9-1-27-2.

જયવર્દનેએ બ્રેડમેનની સદીનો વિક્રમ તોડ્યો

એજન્સી. ગોલ

શ્રીલંકન સુકાની મહેલા જયવર્દનેએ ઇંગ્લેન્ડ સામે સોમવારે ગોલ ખાતે પોતાની શાનદાર સદી નોંધાવીને કેટલીક નવી સિદ્ધિઓ હાંસલ કરી હતી જેમાં સર ડોન બ્રેડમેનની ટેસ્ટ સદીઓ તથા સુનિલ ગાવસ્કરના ટેસ્ટ રનના વિક્રમને તોડ્યા હતા. જયવર્દનેએ પોતાની કારકિર્દીની 30મી સદી નોંધાવીને બ્રેડમેનને પાછળ રાખી દીધા હતા. પોતાની આ ઇનિંગ્સ દરમિયાન જયવર્દનેએ ગાવસ્કરના 10,122 રનના વિક્રમને વટાવ્યો હતો. પોતાની 129મી મેચમાં તથા ગાવસ્કરની જેમ 214મી ઇનિંગ્સ રમી રહેલા જયવર્દને હવે સર્વાધિક રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં આઠમા સ્થાને પહોંચ્યો છે.

ગેઇલ આખરે ઝૂક્યો, વિન્ડીઝ બોર્ડ સાથે કરારબદ્ધ થયો

પીટીઆઇ. જૈમેકા

સ્ફોટક ઓપનર ક્રિસ ગેઇલ આખરે ઝૂકીને વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ સાથે કરારબદ્ધ થયો છે પરંતુ તેનું નેશનલ ક્રિકેટ ટીમમાં પુનરાગમન હજુ નિશ્ચિત નથી. ગેઇલે વિન્ડીઝ બોર્ડને એક પત્ર લખ્યો છે પરંતુ તેની માહિતીનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો નથી. વિન્ડીઝ ક્રિકેટ બોર્ડે યાદીમાં જણાવ્યું છે કે પ્રાઇમ મિનિસ્ટર રાલ્ફ ગોન્સાલ્વિસે ગેઇલના 'સાઇડ લેટર'ની કોપી આપી છે અને આ મુદ્દે ચર્ચાવિચારણા કરવામાં આવી હતી અને બોર્ડ ટૂંક સમયમાં પ્રાઇમ મિનિસ્ટરને વળતો જવાબ આપશે. ગેઇલ અને વિન્ડીઝ બોર્ડ વચ્ચે ગયા વર્ષથી મતભેદો ચાલી રહ્યા છે. ગેઇલે ગયા વર્ષે ટીવી પર આપેલી એક મુલાકાતમાં જાહેરમાં બોર્ડ તથા કોચ ઓટિસ ગિબ્સનની આકરી ટીકાઓ કરી હતી. તેના નિવેદન અંગે માફી માગવા માટે જણાવ્યું હતું. ગેઇલે માફી માગવાનો ઇનકાર કરતાં વિન્ડીઝ બોર્ડે આકરું વલણ અપનાવીને તેને ટીમમાંથી પડતો મૂક્યો હતો.

ફિલેન્ડર ત્રાટક્યો, સાઉથ આફ્રિકાએ વર્ચસ્વ જમાવ્યું

ત્રીજી ટેસ્ટ : મેટ્સ ફિલેન્ડરે ફાસ્ટેસ્ટ 50 વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી, ન્યૂઝીલેન્ડ 275, સાઉથ આફ્રિકાએ 199 રનની લીડ મેળવી

એજન્સી. વેલિંગ્ટન

ઝડપી બોલર વર્નોન ફિલેન્ડરે ઝડપેલી છ વિકેટની મદદથી સાઉથ આફ્રિકાએ અહીં ન્યૂઝીલેન્ડ સામે રમાતી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસની રમતના અંતે રમત પર પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું. ચોથા દિવસે ન્યૂઝીલેન્ડને તેના પ્રથમ દાવમાં 275 રનના સ્કોરે ઓલઆઉટ કર્યા બાદ સાઉથ આફ્રિકાએ તેના બીજા દાવમાં વિના વિકેટે 75 રન બનાવી લીધા હતા. રમતના અંતે પીટરસન 38 તથા સુકાની સ્મિથ 34 રને રમી રહ્યા હતા. આમ પ્રથમ દાવની 199 રનની સરસાઇ વડે સાઉથ આફ્રિકા કુલ 274 રન આગળ થયું છે. ન્યૂઝીલેન્ડે માત્ર એક રન માટે ફોલોઓનના સંકટને ખાળ્યું હતું.

ફિલેન્ડર ટેસ્ટ ક્રિકેટના 116 વર્ષના ઇતિહાસમાં સૌથી ટૂંકા ગાળામાં 50 વિકેટ ઝડપનાર પ્રથમ બોલર બન્યો છે. 26 વર્ષીય ફિલેન્ડરે તેની સાતમી ટેસ્ટમાં જ આ સિદ્ધિ મેળવી છે. ફિલેન્ડરે 81 રનમાં છ વિકેટ ખેરવી હતી. બીજી તરફ ન્યૂઝીલેન્ડનો સુકાની રોઝ ટેલર મોર્કેલના એક બોલે ઇજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો અને તે બીજા દાવમાં બેટિંગ કરી શકે તેવી ઓછી સંભાવના છે.

બેટલ ઓફ બ્લ્યૂઝ
133 વર્ષથી નોટઆઉટ

1879થી રમાતી રોયલ થોમિયન ક્રિકેટ એશિઝથી પણ જૂની છે

એક એવી ક્રિકેટ સિરીઝ છે જે 1879માં શરૂ થઇ છે અને હજુ પણ રમાતી આવે છે. પહેલા તથા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે ઓલિમ્પિક્સનું આયોજન શક્ય નહોતું બન્યું ત્યારે પણ આ સિરીઝ રમાતી હતી. માર્ચની દસમી તારીખે આ ટૂર્નામેન્ટની 133મી સિઝન પૂરી થઇ હતી. સંભવ છે કે આટલી જૂની શ્રેણીના આયોજક અંગે આપણો જવાબ કદાચ ઇંગ્લેન્ડ અથવા ઓસ્ટ્રેલિયા હશે પરંતુ સાચો જવાબ શ્રીલંકા છે. રોયલ કોલેજ અને સેન્ટ થોમસ કોલેજ વચ્ચે પ્રત્યેક વર્ષે સિરીઝની મેચ યોજાય છે.

શરૂઆત કેવી રીતે થઇ

ભારતની જેમ જ શ્રીલંકામાં પણ ક્રિકેટને અંગ્રેજો લઇને આવ્યા હતા. સૌથી પહેલાં કોલંબો સ્થિત સેન્ટ થોમસ સ્કૂલના બાળકોએ આ રમતની શરૂઆત કરી હતી. આ સ્કૂલમાં 1851થી ક્રિકેટ રમાય છે. 1877માં રોયલ કોલેજ અસ્તિત્વમાં આવી હતી.

સેન્ટ થોમસની ટીમ ટ્રોફી સાથે. મેચ ડ્રો રહી હતી અને ગયા વર્ષની ચેમ્પિયન હોવાના નાતે સેન્ટ થોમસ વિજેતા બની હતી.

33 વખત રોયલ કોલેજની ટીમ ચેમ્પિયન બની
34 વખત થોમસે ટાઇટલ જીત્યું
66 મુકાબલામાં કોઇ પરિણામ આવ્યું નથી
45 સદીઓ બની છે અત્યાર સુધીમાં

એશિઝ ત્રણ વર્ષ નાની છે

ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાતી એશિઝ શ્રેણીની શરૂઆત બેટલ ઓફ બ્લૂઝના ત્રણ વર્ષ બાદ 1882માં થઇ હતી. ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટની સત્તાવાર શરૂઆત 1980માં તથા ઓસી.માં શેફિલ્ડ શિલ્ડનો પ્રારંભ 1892માં થયો હતો.

શ્રેણીની 125મી ટૂર્ના.ના સન્માનરૂપે પોસ્ટ ટિકિટ

1934માં રણજી ટ્રોફી શરૂ

ભારતમાં પ્રથમ કક્ષાની ક્રિકેટ 1866થી રમાય છે પરંતુ તેમાં ઘણી સિરીઝ કેટલાંક વર્ષ બાદ બંધ થઇ ગઇ છે. રણજી ટ્રોફીનો પ્રારંભ 1934-35માં થયો હતો.

કન્ટેન્ટ : વિક્રમ પ્રતાપસિંહ

વેસ્ટ ઇન્ડીઝનું 17 વર્ષ જૂનું સ્વપ્ન ચકનાચૂર થયું

એજન્સી. ગ્રોસ આઇલેટ (સેન્ટ લ્યુસિયા)

સુકાની ડેરેન સેમ્મીએ તોફાની બેટિંગ કરી હોવા છતાં અહીં રમાયેલી પાંચમી અને અંતિમ વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ 30 રનથી વિજય મેળવતાં ઓસ્ટ્રેલિયન ટીમ સામે 17 વર્ષના લાંબા ગાળા બાદ વન-ડે શ્રેણી જીતવાનું વેસ્ટ ઇન્ડીઝે સેવેલું સ્વપ્ન ચકનાચૂર થયું હતું. જોકે પાંચ મેચની આ શ્રેણી 2-2થી ડ્રો રહી હતી. બંને ટીમો વચ્ચેની ત્રીજી વન-ડે ટાઇ રહી હતી.

ઓસ્ટ્રેલિયાના નવ વિકેટે 291 રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર વિન્ડીઝ ટીમ 47.2 ઓવરમાં 251 રનના સ્કોરે ઓલઆઉટ થઇ ગઇ હતી. માત્ર 50 બોલમાં છ બાઉન્ડ્રી તથા છ સિક્સર વડે તોફાની 84 રન નોંધાવનાર સેમ્મીને મેન ઓફ ધ મેચ તથા કિરોન પોલાર્ડને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સમાં ટોચના ત્રણ બેટ્સમેનોએ અડધી સદી નોંધાવી હતી. વોટસને 89 બોલમાં 66, વોર્નરે 69 તથા ફોરેસ્ટે 53 રનની ઇનિંગ્સ રમી હતી. વિન્ડીઝ તરફથી રોચે 53 રનમાં ત્રણ તથા આન્દ્રે રસેલે સર્વાધિક 61 રનમાં ચાર વિકેટ ઝડપી હતી. શ્રેણી જીતવાના લક્ષ્યાંક સાથે મેદાને પડેલી વિન્ડીઝ ટીમે 76 રનના સ્કોર સુધીમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.

દિવ્ય ભાસ્કર દ્વારા જનઆસ્થા માટે પ્રસારિત

સમગ્ર દેશમાં અને દુનિયામાં
સવા કરોડ હનુમાન ભક્ત એક સાથે કરશે

વ્યવસાયિક પ્રબંધન માં
શ્રી હનુમાન ચાલીસા મહાપાઠ

શ્રી રામનવમી - ૧ એપ્રિલ ૨૦૧૨, રવિવાર
સાંજે ૭ થી ૮ વાગ્યા સુધી
લાઇવ જુઓ dainikbhaskar.com પર



પં. વિજયશંકર મહેતા
ઉજ્જૈનની પ્રેરણા થી

જીવન પ્રબંધન સમુહ તથા
મહાપાઠ આયોજન સમિતિ દ્વારા આયોજીત

કાર્યક્રમમાં શ્રી હનુમાનચાલીસા નો પાઠ
તથા પં. વિજયશંકર મહેતા નું શ્રી હનુમાનચાલીસા અને
વ્યવસાયિક જીવન પર ૪૫ મિનિટ નું વ્યાખ્યાન થશે.
મુખ્ય કાર્યક્રમ રાયપુર (છત્તીસગઢ) માં આયોજીત થશે.



सफलता, सुख और शांति के देवता
हमारे हनुमान

આપના ક્ષેત્રમાં મહાપાઠ કરાવવા હેતુ સંપર્ક સૂત્રઃ

શિવનારાયણ મુંદડા	94252-02721	વિજય અગ્રવાલ રાયપુર	94252-02901
મોહન પવાર રાયપુર	94252-07638	સચ્ચિદાનંદ ઉપાસને છ.ગ.	94252-02652
મુકેશ શર્મા દિલ્હી	93500-55555	ડૉ. અજય મહેતા ભોપાલ	98260-23909
પુષ્કર બાહેતી ઉજ્જૈન	94250-91161	ઓ.પી. પસારી ઇન્દોર	98932-42580

આસ્થા અને
સંસ્કાર ચેનલ પર
લાઇવ ટેલીકાસ્ટ

ન્યૂઝ ઇનબોક્સ

મહર્ષ ઉર્ફે ભોલુ હત્યાકેસ : કુલદીપે છ વાર મોબાઇલ પર ખંડણી માગી હતી

realpatidar.com

મહેસાણા : વિસનગરના મહર્ષ ઉર્ફે ભોલુના અપહરણ બાદ હત્યાના બહુચર્ચિત કેસમાં પકડાયેલા આરોપી અક્ષય પટેલ અને કુલદીપ પંચાલના રિમાન્ડમાં અનેક બાબતો પ્રકાશમાં આવી છે. અપહરણ બાદ કુલદીપ પંચાલે મહર્ષ ઉર્ફે ભોલુના પિતા પ્રતિકભાઇ પટેલ સાથે છ વખત મોબાઇલ ફોન કરી ખંડણી 50 લાખની માંગી હતી. સામે પ્રતિકભાઇએ 10-15 લાખની સગવડ હોવાની વાત કરતાં આ શખ્સે દાદાને પૂછવું પડે તેમ કહી વાત ટાળતો રહ્યો હતો. શહેરના ચપ્પે ચપ્પે પોલીસ હોવાની વાત પણ તેણે કરી હતી. વાતચીતના એક્સક્લુઝીવ અંશો આ રહ્યા.

વિજાપુરમાંથી ચોરેલા ગેસના બાટલાનો એટીએમ તોડવામાં ઉપયોગ કરાયો

મહેસાણા : ગોઝારિયા ગામે ત્રણ દિવસ અગાઉ એટીએમ તોડવા જતાં લાગેલી આગમાં 13 લાખથી વધુ રકમ સળગી જવાના કિસ્સામાં પોલીસે દશથી વધુ વ્યકિતઓની પૂછપરછ હાથ ધરી છે. એટીએમ તોડવા માટે ઉપયોગમાં લેવાયેલો ગેસનો બાટલો વિજાપુરથી ચોરી થયાનું પ્રકાશમાં આવતાં તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન બનાવાયા છે.

બસમાંથી ₹45 લાખના દાગીના ચોરાયા

અમદાવાદ : આરબીઝેડ જ્વેલર્સનો કર્મચારી મુંબઈથી ₹45 લાખના બે કિલો સોનાના દાગીના લઈને લક્ઝરી બસમાં અમદાવાદ આવવા નીકળ્યો હતો, ત્યારે તેની બેગમાંના ડબામાંથી સોનાના દાગીના ચોરાઈ ગયા હોવાની ફરિયાદ તેણે નારણપુરા પોલીસ મથકે નોંધાવી હતી. મિત્રના ઘરે ઉતરેલા મહેશ કટારિયાએ બેગ ખોલીને જોયું તો ખબર પડી કે ડબામાં મૂકેલા દાગીના ગુમ છે.

ગીર જંગલમાં ઈનફાઈટમાં દીપડા અને દીપડીનાં મોત

જૂનાગઢ : ગીર જંગલનાં મેંદરડાનાં ડેડકડી રેન્જમાં ઝરખ અને માળીયા હાટીનાનાં બાબરાવીડી પાસે સિંહણ સાથેની ઈનફાઈટમાં દીપડો અને દીપડી મોતને ભેટ્યા હતા. મેંદરડા તાલુકા હેઠળની ડેડકડી રેન્જમાં રમેશભાઈ આંબાભાઈ સોજીત્રાનાં ખેતરમાં આજે નાના પ્રાણીનો શિકાર કરી દીપડો મારણ ખાઈ રહ્યો હતો ત્યારે ત્યાંથી નીકળેલા ઝરખે તેની પાસેથી મારણ ઝૂંટવી લેવાનાં પ્રયાસમાં બન્ને વચ્ચે ઈનફાઈટ જામી હતી જેમાં ઝરખનાં તીક્ષ્ણદાંત દીપડાનાં ગળાનાં ભાગે ખૂંપી જતા ભારે રક્તસ્ત્રાવ થવાથી મોત થયું હતું.

દરેડમાં ખેતીની જમીનનો કબજો કરી ખાલી કરવા 7 લાખ માગ્યા

જામનગર : જામનગરનાં એક સોની યુવાનની દરેડ પાસે આવેલી ખેતીની જમીનમાં ગેરકાયદે કબજો જમાવી લઈ બાદમાં આ જમીન ખાલી કરવા માટે યુવાન પાસેથી રૂા. સાત લાખની માગણી કરી ધાકધમકી આપવા અંગે મસીતીયાનાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા ચકચાર જાગી છે.

જૂનાગઢની મધ્યસ્થ બેંકમાં મતદાનમાં 17 માંથી 15 બેઠક આંચકી લેતી કોંગ્રેસ

જૂનાગઢ : જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલોને ભારે બહુમતી મળી છે. ગઈકાલે 17 બેઠકોની યોજાયેલી ચૂંટણીની આજે યોજાયેલી મતગણતરીમાં 15 બેઠકો કોંગ્રેસનાં ફાળે ગઈ હતી. જૂનાગઢ અને પોરબંદર જિલ્લાને આવરી લેતી જેડીસીસી બેંકની ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં 99 ટકા જેવું ભારે મતદાન થયા બાદ આજે મતગણતરી યોજાઈ હતી. જેમાં અ વિભાગની 13 માંથી 12 બેઠકો કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોનાં ફાળે ગઈ હતી. જ્યારે એકમાત્ર રાણાવાવની બેઠક પર ભાજપનાં ઉમેદવાર વિજયી બન્યા હતા. બ, ક અને ડ વિભાગની બેઠકો કોંગ્રેસ અને આઈ વિભાગની બેઠક ભાજપનાં ફાળે આવી હતી. આ રકાસને પગલે ભાજપની છાવણીમાં સોપો પડી ગયો હતો. જ્યારે માણસા ધારાસભાની બેઠક બાદ જેડીસીસી બેંકનો વિજય કોંગ્રેસ માટે વધુ એક માઈલસ્ટોન બની ગયો છે.

કચ્છના અખાતમાંથી 29 કારતૂસો સાથે એકે-47 રાયફલ મળી

માચ્છીમારી માટે બિછાવેલી જાળમાં માછલી સાથે મળી આવી : ડીઆરઆઇ અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

ભાસ્કર ન્યૂઝ. જામનગર

જામનગરના બેડીબંદર નજીક કચ્છના અખાતમાંથી 29 જીવતાં કારતુસો સાથે એક-47 રાયફલ મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઇ છે. માચ્છીમારી માટે બિછાવેલી જાળમાં માછલી સાથે આ રાફયલ મળી આવી હતી. બનાવ અંગે ડીઆરઆઇ અને પોલીસે તપાસ શરૂ કરી છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર બેડીમાં રહેતો મુસ્તફા સાલેમામદ માચ્છીમાર તા.23-3ના અલ-ઝમઝમ બોટ લઇને કચ્છના અખાતમાં માચ્છીમારી કરવા ગયો હતો. બેડી બંદર નજીક દરિયામાં 15 નોટીકલ માઇલ દુર તેમણે જાળ બિછાવી હતી. દિવસભર જાળ બિછાવ્યા બાદ રાત્રીના જાળ દરિયામાંથી કાઢતા તેમાં માછલી સાથે એકે-47 રાયફલ 29 જીવતા કારતુસો સાથે ફસાયેલી મળી આવી હતી. આથી માચ્છીમાર મુસ્તફાએ બોટના માલિક મુસાભાઇને આ બનાવની જાણ કરી હતી. મુસાભાઇએ તેના મિત્ર ગફારને જાણ કરતાં તેમણે ડીઆરઆઇને આ બનાવ અંગે જાણ કરતાં અધિકારીઓએ સ્થળ પર પહોંચી રાયફલનો કબ્જો લઇ પોલીસને જાણ કરી લોડેડ રાયફલ સોંપી હતી. આથી પોલીસે રાયફલનો કબ્જો સંભાળી ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. કચ્છના અખાતમાંથી મળી આવેલ રાયફલ પર કાદવ-કીચડ મળી આવતાં કારતૂસ કટાઇ ગયા હોવાથી આ રાયફલ ત્રણેક મહિનાથી પાણીમાં પડી હોવાનું તેમજ શીપની રક્ષા કરતાં શીપગાર્ડની હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસે વ્યકત કર્યું છે. જો કે, સંવેદનશીલ ગણાતા દરિયાઇ સીમામાંથી લોડેડ એક-47 રાયફલ મળી આવતાં સુરક્ષા એજન્સીઓ ધંધે લાગી છે.

સોમવારે વિધાનસભા ગૃહની કાર્યવાહી ત્રણ વાર મુલતવી રહી

ક્લિપિંગ્સકાંડના મુદ્દે હોબાળો તમામ કોંગી ધારાસભ્યો સસ્પેન્ડ

કોંગ્રેસના ધારાસભ્યો 'અશ્લીલ ફિલ્મો જોનારાને સસ્પેન્ડ કરો-ડિસમિસ કરો' લખેલા બ્લેક એન્ડ વ્હાઈ ખેસ સાથે ગૃહમાં આવ્યા

ભાસ્કર ન્યૂઝ. ગાંધીનગર

કોંગ્રેસી ધારાસભ્યોનો અનોખો વિરોધ

કોંગ્રેસના ધારાસભ્યો બ્લેક એન્ડ વ્હાઇટ ખેસ પહેરી 'અશ્લિલ ક્લીપિંગ્સ માટે ભાજપ અને એફ એસ એલનું મેચ ફીક્સીંગ, બીજેપી-બ્લ્યુ ફીલ્મ જોનારી પાર્ટી' જેવા સૂચક બેનરો દર્શાવ્યા હતા.

વિધાનસભામાં ભાજપના ધારાસભ્યો દ્વારા અભદ્ર ક્લિપિંગ્સ જોવાના મુદ્દે સપ્તાહના પ્રથમ દિવસે કોંગ્રેસે વિધાનસભાને ખોરવી હતી. કોંગ્રેસના ધારાસભ્યો વિરોધ વ્યક્ત કરવા માટે સોમવારે 'અશ્લીલ ક્લિપિંગ્સ જોનારાને સસ્પેન્ડ કરો-ડિસમિસ કરો' લખેલા બ્લેક એન્ડ વ્હાઇટ ખેસ સાથેની વિશેષ વેશભૂષા ધારણ કરીને ગૃહમાં આવ્યા હતા. કોંગ્રેસના સભ્યોના આ વિશિષ્ટ વિરોધ સામે સરકારના સિનિયર પ્રધાનોએ વિરોધ નોંધાવ્યો હતો અને ગૃહની કાર્યવાહી ત્રણ-ત્રણ વાર મુલતવી રહી હતી. અંતે સંસદીય પ્રધાને કોંગી સભ્યોના પ્રદર્શનને ગૃહની અવમાનનાનો કિસ્સો ગણાવીને કોંગ્રેસના તમામ સભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવાની દરખાસ્ત રજૂ કરતાં અધ્યક્ષે સતત ચોથા દિવસે કોંગ્રેસના તમામ સભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા. એક તબક્કે અધ્યક્ષે કોંગ્રેસને 'ઠપકો' આપીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શાસક પક્ષ દ્વારા તમામ કોંગી સભ્યોને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત રજૂ કરાઈ હતી. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળના પ્રારંભે જ કોંગ્રેસના સિનિયર નેતા અને પ્રદેશપ્રમુખ અર્જુન મોઢવાડિયા, પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, દંડક ઇકબાલ પટેલ સહિતના તમામ ધારાસભ્યોએ કોંગ્રેસના તિરંગા ખેસને સ્થાને સૂત્રો લખેલા 'ખેસ' સાથે ગૃહમાં બેઠક લીધી હતી.

રાજકોટમાં બાળકોને કિલપિંગ બતાવતો શખ્સ ઝડપાયો

આજી ડેમમાં સિક્યુરીટી સુપરવાઇઝર અને મહીલા ચેનચાળા કરતા પકડાયા

ભાસ્કર ન્યૂઝ રાજકોટ

શહેરના કેટલાક બગીચાઓમાં ગોરખ ધંધા થતા હોવાનું જગજાહેરછે. ત્યારે જ્યુબિલી બગીચામાં બાળકોને ભેગા કરી બીભત્સ કિલપિંગ દેખાડી રહેલા શખ્સને પોલીસે દબોચી લઇ તેની શાન ઠેકાણે લાવી દીધી હતી. તેમજ આજી ડેમ બગીચામાં બીભત્સ ચેનચાળા કરી રહેલા સિક્યુરિટી સુપરવાઇઝર અને મહિલા સિક્યુરિટી ગાર્ડ પકડાતા ચકચાર મચી ગઇ હતી.

જ્યુબિલી બગીચામાં એક શખ્સ બાળકોને એકઠા કરી બીભત્સ કિલપિંગ દેખાડી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસ દોડી ગઇ હતી. પોલીસ પહોંચતા જ બાળકો ભાગી ગયા હતા. પરંતુ કિલપિંગ દેખાડી રહેલો કોઠારિયા કોલોનીનો મહેન્દ્ર ગોપાલજી ઝાપડા (ઉ.વ.27) ઝડપાઇ ગયો હતો. ઝડપાયેલા મહેન્દ્રએ કેફિયત આપી હતી કે, પોતે બગીચામાં લટાર મારવા આવ્યો હતો. ત્યારે બગીચામાં કેટલાક બાળકોનો ભેટો થઇ જતા તેને પોતાના મોબાઇલમાં કિલપિંગ બતાવતો હતો. પોલીસે ગુનો નોંધી મહેન્દ્રની ધરપકડ કરી મોબાઇલ કબજે કર્યો હતો.

આવાજ અન્ય એક કિસ્સામાં થોરાળા પોલીસ મથકનો સ્ટાફ આજી ડેમ નજીક પેટ્રોલિંગમાં હતો. ત્યારે આજી ડેમ બગીચામાં ચેનચાળા કરી રહેલો એક પુરૂષ અને એક મહિલા મળી આવ્યા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ચેનચાળા કરતા ઝડપાયેલો સંતાનસિંગ શત્રુઘ્નસિંગ પરમાર દુધસાગર રોડ પરની બાલકૃષ્ણ સોસાયટીમાં અને મહિલા ભાનુ દિનેશ કુબાવત પડધરી રહે છે. સંતાનસિંગ સિક્યુરિટીમાં સુપરવાઇઝર તરીકે અને મહિલા તેની સાથે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરેછે. બંનેએ આજી ડેમ બગીચામાં રખેવાળી કરવાને બદલે ચેનચાળા કરતા પોલીસ મથકે પહોંચ્યા હતા.

અડવાણીએ જાહેરમાં નરેન્દ્ર મોદીના વખાણ કર્યાં

બાળકોના સર્વાંગી વિકાસ માટે દુનિયામાં ગુજરાત એવું પ્રથમ રાજ્ય બનશે જેણે 'ચિલ્ડ્રન યુનિવર્સિટી'ની કલ્પના કરી છે

ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ

શાંતિનિકેતન લિવિંગના ઉદ્દઘાટન પ્રસંગે ઘણા લાંબા સમય પછી લાલકુષ્ણ અડવાણી અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એક મંચ પર સાથે જોવા મળ્યા હતા. આ પ્રસંગે લાલકુષ્ણ અડવાણીએ જાહેરમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યાં હતાં અને જણાવ્યું હતું કે, ગુજરાતનાં જે કિંગ વ્યકિત છે. તેવા ગુજરાતનાં મુખ્યમંત્રી કે જેઓ અમેરિકાના 'ટાઈમ્સ' મેગેઝિનના કવરપેજ ચમકયા છે, જે આપણાં માટે ગર્વની વાત છે. અત્યાર સુધી આ બહુમાન મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલને મળ્યું છે.

શાંતિનિકેતન લિવિંગના ઉદ્દઘાટન પ્રસંગના કાર્યક્રમમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લાલકુષ્ણ અડવાણી એક સાથે સંકુલ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં પહેલાં તેઓએ સંકુલની મુલાકાત લીધી હતી, મુલાકાત લેતી વખતે બંને દિગ્ગજોએ સાથે ચાલવાને બદલે નરેન્દ્ર મોદી આગળ અને તેમનાંથી 20 ફૂટ પાછળ લાલકુષ્ણ અડવાણી ચાલતા હતા. એટલું જ નહિ, સ્ટેજ પર બેઠાં બાદ દોઢથી બે મિનિટની ઔપચારિક વાત કર્યા બાદ અડવાણીએ સંસ્થાના બ્રોસરમાં જ્યારે મુખ્યમંત્રીએ ટીવી સ્ક્રીન પર ધ્યાન કેન્દ્રિત કરીને જાણે એકબીજા સાથે વાત કરવાનું ટાળ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સમાજમાં પ્રવાહ બદલાઇ રહ્યો છે, તેનું પ્રતીક એટલે આ પ્રકારની પ્રવૃત્તિ. બૃહદ્ પરિવારને બદલે હવે સમાજમાં માઇક્રો ફેમિલીનું ચલણ વધ્યું છે. ત્યારે નવી વ્યવસ્થા કરી શકીએ જેમાં સમાજના એક મોટા વર્ગને સાચવી શકીએ. જનરેશનગેપનાં સંકટનાં સૌથી વધુ ભોગ વૃદ્ધો અને બાળકો બને છે. વૃદ્ધો માટે ગુજરાતમાં 160થી 170 જેટલા વૃદ્ધાશ્રમો છે.

પરંતુ, બાળકો માટે પણ આપણે વિચારવાનો સમય પાકી ગયો છે. જેથી બાળકોના સર્વાંગી વિકાસ માટે દુનિયામાં ગુજરાત એવું પ્રથમ રાજ્ય બનશે જેણે 'ચિલ્ડ્રન યુનિવર્સિટી'ની કલ્પના કરી છે અને માઇક્રો ફેમિલી હોવા છતાં બાળકોના વિકાસ માટે તમામ વ્યવસ્થા ઊભી કરાશે. એટલું જ નહિ, હાલમાં ગુજરાતમાં ત્યકતા, વૃદ્ધો અને નિરાધાર બાળકો અલગ-અલગ રહે છે, તેને બદલે હવે 'બાળ ગોકુલમ'ની યોજના હેઠળ ત્યકતાઓ, બાળકો અને વૃદ્ધો એક જ સંકુલમાં રહી શકે તેવી વ્યવસ્થા ઊભી કરાશે.

આ પ્રસંગે અડવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, શાંતિનિકેતન એક વૃદ્ધાશ્રમ નથી પણ એક નવો અનુભવ છે. આ પ્રયોગનું પરિણામ દસ વર્ષ પછી ખબર પડશે.

અમદાવાદમાં સિવિલ સહિતની હોસ્પિટલમાં ઓપરેશનો રદ કરાયાં

ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ

તબીબી અધ્યાપકોની હડતાળના પાંચમા દિવસે સિવિલ હોસ્પિટલ સહિત શહેરની કોર્પોરેશન સંચાલિત વિવિધ હોસ્પિટલોમાં પણ મોટા ભાગનાં ઓપરેશનો રદ કરવાની ફરજ પડી હતી. ઓપરેશન રદ થતાં અનેક દર્દીઓ હાલાકીમાં મુકાયા હોવાનું જાણવા મળ્યું છે. ગત તા. 22મી માર્ચથી યુજીસી મુજબના પગારધોરણની માગ સાથે તબીબી અધ્યાપકો હડતાળ પર ઉતરી ગયા હતા.

રાજકોટમાં બે ગઠિયા કારમાંથી ₹ 5.80 લાખ ઉઠાવી ગયા

ગરાસીયા યુવાન બેંકમાંથી નાણા ઉપાડીને નીકળ્યો અને ગઠીયા ખેલ પાડી ગયા

ભાસ્કર ન્યૂઝ રાજકોટ

રસ્તા પર ચલણી નોટો વેરી લોકોની નજર ચૂકવી મોટી રકમ તફડાવી જતા ગઠિયાઓએ સોમવારે પોલીસ કમિશનર કચેરી સામે આવેલી કોટક મહિન્દ્રા બેંક પાસે ખેલ પાડી એન્જિનિયર ગરાસીયા યુવાનની નજર ચૂકવી તેની કારમાંથી રૂા.5.80 લાખની રોકડ ભરેલું કવર તફડાવી જતા સનસનાટી મચી ગઇ હતી. ઘટનાને પગલે પોલીસે નાકાબંધી કરી હતી. પરંતુ ગઠિયાઓનો પતો લાગ્યો નહતો.

150 ફૂટ રિંગ રોડ પરની સોમનાથ સોસાયટીમાં રહેતા અને ગ્લોબલ કોમ્યુનિકેશનમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા રૂષિરાજસિંહ બિપીનચંદ્રસિંહ પરમાર (ઉ.વ.32) સવારે પોણા અગિયાર વાગ્યાના અરસામાં પોતાની કાર લઇને જિલ્લા પંચાયત ચોક પાસે આવેલી કોટક મહિન્દ્રા બેંકે ગયા હતા. અને પોતાની કાર નાથ સ્ટોલ પાસે આવેલા બરફના કારખાનાવાળા ગેઇટ પાસે રાખી હતી.

બરતરફીને પડકારતી મહિલા ફેકલ્ટીની રિટમાં NIDને કોર્ટની નોટિસ

ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ

ડિઝાઇન સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનની મહિલા ફેકલ્ટીએ તેને કિન્નાખોરી દાખવીને નોકરીમાંથી કાઢી મૂકવાના મામલાને પડકારતી રિટમાં કોર્ટે એનઆઇડીને નોટિસ પાઠવી છે. સંસ્થાના ગાંધીનગર ખાતેના વોર્ડન સામે જાતીય સતામણી અને અભદ્ર ટીપ્પણી અંગે ફરિયાદ કરતાં તેની સામે કિન્નાખોરી રાખી તેને કાઢી મૂકવામાં આવી છે. વધુ સુનાવણી 12મી એપ્રિલ પર મુલતવી રખાઈ છે.

શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ જોગ જાહેર નિવેદન

આથી જણાવવાનું કે, તા.૨૫-૦૩-૨૦૧૨ના રોજ બિડદા સમાજવાડી મધ્યે કંઠી વિભાગ લક્ષ્મીનારાયણ સમાજ માંડવી વિસ્તારના ભાઇઓની જાહેરસભા યોજવામાં આવેલ.

જેમાં અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખશ્રી તેમજ અન્ય કારોબારીના સભ્યો પણ ઉપસ્થિત રહેલ આ સભામાં પ્રવચનમાં સતપંથ સનાતન સમાજ વિરૂદ્ધ ધાર્મિક લાગણી દુભાય તેવા પ્રવચનો થયાં, જેમાં કહેવામાં આવ્યું સતપંથ સનાતન ધર્મ પાળતા ભાઇઓને આપણી સામાજિક સંસ્થામાંથી કાઢી નાખવા એવા ઉશ્કેરણીજનક પ્રવચન કરવામાં આવેલ, જેથી સતપંથ સનાતન સમાજના ભાઇઓની લાગણી દુભાઇ છે અમો અખિલ ભારતીય પાટીદાર સમાજના બંધારણ મુજબ સમાજમાં જોડાયેલ, છીએ અમોએ સમાજની મિલકતો ઉભી કરવામાં તન,મન,ધનનો સહયોગ આપેલ છે જેની તકતીઓ મોજૂદ છે અને ગત વર્ષે જે સમાજની હોદ્દેદારો માટેની ચૂંટણી નવા બંધારણ મુજબ મનસ્વી રીતે કરેલ છે જેને ચેરિટી કમિશનર રાજકોટમાં પડકારતાં તેને મનાઇહુકમ આપેલ તે અનુસંધાને હાઇકોર્ટ અમદાવાદમાં કેસ ચાલુ છે, એ કેસનું જજમેન્ટ આવે ત્યાં સુધી હાલના અખિલ ભારતીય પાટીદાર સમાજના પ્રમુખ, ટ્રસ્ટી કે કારોબારી સભ્યો કોઇને નિર્ણય લેવાનો અધિકાર નથી. બિડદા સભામાં જે નિર્ણયો હોદ્દેદારોએ લીધેલ છે, જે ગેરબંધારણીય છે, જેની કચ્છ કડવા પાટીદાર સમાજે નોંધ લેવા વિનંતી.

લિ. **શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ**

શ્રી કચ્છ કડવા પાટીદાર કંઠી વિભાગ જોગ જાહેર ખુલાસો

તા.૨૫-૦૩-૨૦૧૨ના બિડદા મુકામે કંઠી વિસ્તારમાં લક્ષ્મીનારાયણ ધર્મસભા તથા સમૂહલગ્ન સમિતિ સભાનું આયોજન કરેલ તે સભામાં અતિથિ વિશેષ તરીકે આવતા મહાનુભાવો તેમજ હોદ્દેદારો આ સભામાં પ્રવચનો દ્વારા સતપંથ સમાજના ભાઇઓની ધાર્મિક લાગણી દુભાય તેવા પ્રવચનો ન કરે તેના માટે માંડવી મામલતદાર અને માંડવી પોલીસ સ્ટેશનમાં તકેદારી માટે અરજી કરેલ હતી નહીં કે સભાને અટકાવા માટે.

અમોએ ધર્મસભા અને સમૂહલગ્નની સભા ઉપર અમોએ કોઇ રોક લગાવેલ નથી અમોને જાણવા મળેલ છે કે, હોદ્દેદારો અને કાર્યકરો સતપંથ સનાતન સમાજને બદનામ કરવા માટે સમાજના લોકોને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરી રહેલ છે જેની કચ્છ કડવા પાટીદાર સમાજે નોંધ લેવા વિનંતી.

લિ. સમગ્ર કચ્છ કડવા પાટીદાર સતપંથ હિતરક્ષક મંડળ

Bhavan's Shri H.J.Doshi Info. Tech. Inst.
(Affiliated to Sau. University Self Finance Computer College)

REQUIRE FOR BCA & PGDCA

• **PRINCIPAL (1 Post)**
01) M.E. (Comp. Sc., Tech / Info. Sc.) OR
02) MCA, M.Sc.(I.T.)(I.T.&C.A.) (A) Comp.. Sc. with Minimum 55% marks and NET which is not compulsory now. But in future it will be followed strictly. OR
03) B.E. (Comp. Sc./I.T.) with First Class. OR B.E. (I.T.) with first class
Experience : Min. 10 Years as a Lecturer & Ph.D. Degree

• **LIBRARIAN (1 Post)**
M. Lib. with 55% and Good Academic Record.

• **LECTURERS (5 Post)**
01) M.E. (Comp. Sc., Tech / Info. Sc.) OR
02) MCA, M.Sc.(I.T.)(I.T.&C.A.) Comp.. Sc. with Minimum 55% marks and NET which is not compulsory now. But in future it will be followed strictly. OR
03) B.E. (Comp. Sc./I.T.) with First Class.

Apply within 15 days with all necessary documents to the Chairman Bhartiya Vidya Bhavan, (Jamnagar Kendra), A.K. Doshi Mahilla College Campus, Jamnagar-361 008.
Through Registered A.D. post only
Chairman - Bhartiya Vidya Bhavan Jamnagar Kendra

WAPCOS LIMITED
(A Government of India Undertaking Ministry of Water Resources)

WAPCOS Limited a Mini Ratna Schedule 'B' ISO: 2008 Public Sector Consultancy Organisation needs **Engineer (Information Technology)** on regular basis. Interested candidates fulfilling the eligibility conditions may send their CV in the prescribed proforma to **Regional Manager (WR), WAPCOS Ltd., Regional Office, 702-704, 7th Floor, Abhishek complex, Sector-11, Gandhinagar 382011 within 15 days** from the date of release of the advertisement.

For details and proforma visit our website www.wapcosgandhinagar.com

POWERMAC
IMPROVE EFFICIENCY

Features & Advantages
• Korean Based Latest & proven technology
• Top & Bottom ring from Stainless Steel
• No Maintenance - rust Free, rain proof,
• Firratardant, Corrosion resistance
• Econnomical & Environmental friendly
• Available in different sizes and shapes
• Compreshensive 5 Year Oranti
• Assured 24 Hrs. 365 Days Free of cost Ventilation & Exhaust system
• Replace hot alr, humldity, stale alr, smoke & gas fumes with fresh ambient air.
• Increased life of roofing sheets.

POWERMAC TECHNOLOGY
Mfrs & Exporter : Air Ventilator
M.F.Earthing Electrode & Lightning Arrester F.R.P. Product,
+91-9099939973-72 Plot No. 2815, GIDC, Phase-IV, Wadhwancity-363035,
Dist : Surendranagar (Gujarat), Mail : powermactechnology@gmail.com

ADMISSION ANNOUNCEMENT
CENTRAL UNIVERSITY OF GUJARAT
ACADEMIC SESSION 2012-2013
Advertisement No. 45/2012-13

CENTRAL UNIVERSITY OF GUJARAT has been established by an Act of Parliament 2009 (No. 25 of 2009) and is fully funded by the Ministry of Human Resource Development, Government of India through UGC. **The University is presently located in Sector-30, Gandhinagar -382 030 (Gujarat).**
Applications are invited from eligible candidates for Entrance Examination in the following courses for Academic Year 2012-13.
M.Phil/Ph.D. in (a) Science, Society and Development (b) Comparative Literature (c) Society and Development (d) Hindi Language and Literature (e) Security Studies (f) Economics (g) Gandhian Thought and Peace Studies (h) Diaspora Studies (i) Environment and Sustainable Development (j) Chemical Sciences (k) Life Sciences (l) International Politics and Governance (m) Nano Sciences
Note: M.Phil/Ph.D. is an integrated programme.
M.A. Two Year in (a) Society and Development (b) English (c) Politics and International Relations (d) Gujarati Language and Literature. **M.Sc. Two Year in** (a) Industrial Chemistry (b) Life Sciences (C) Chemical Sciences **M.L.I.Sc.** (Master of Library & Information Science) **M.A. Five Year Integrated programme after 10+2 in** (a) Social Management (b) Chinese Language and Culture (c) German Studies **Six Month Certificate Course in** Analytical Techniques for Visually Challenged*
*Note: (No Written test only Interview) Course will start from 1st August 2012.
Last date for submission of duly filled-in application form is 4th May, 2012, The University will hold Entrance Examination on 2nd & 3rd June 2012. For application form and other details please visit University website i.e. www.cug.ac.in or check Employment News dated 31-03-2012 or contact through E-mail: admission@cug.ac.in

જિલ્લા રોજગાર કચેરી, ભુજ દ્વારા આયોજિત જોબફેર
(An ISO 9001:2008 Certified Organisation)

ભરતીમેળાની તારીખ	સ્થળ	સમય
૨૭/૩/૨૦૧૨	આલ્ફેડ હાઈસ્કુલ, જિલ્લા પુચાયત કચેરી પાસે, મહાદેવ નાકા બહાર, ભુજ-કચ્છ	સવારે ૧૧-૦૦ કલાકે

ગુજરાત રાજ્ય ઔદ્યોગીકક્ષેત્રે હરણફાળ ભરી રહયુ છુ. કચ્છ જિલ્લામાં નવા એકમો સ્થપાઈ રહયા છે, તથા ઔદ્યોગીક વિકાસ ઝડપથી થઈ રહયો છે. આ માટે સ્થાપિત એકમોમાં કુશળ,અધકુશળ કારીગરો, વહીવટી અથા ટેકનીકલ સ્ટાફની જરૂરીયાત અંગે સવે કરીને રોજગારીની દિશામાં વધુ એક સીમાચિહન પહેલરૂપે રોજગાર સપ્તાહ અંતગત ઔદ્યોગીક ભરતીમેળા યોજીને નોકરીદાતા તથા રોજગારવાચ્છુ વચ્ચે સેતુરૂપ બનીને ઉકત જણાવેલ તારીખ અને સ્થળોએ ભરતીમેળાનું આયોજન કરેલ છે.

કોણ સહભાગી થઈ શકશે.

નોકરીદાતાનું નામ	જરૂરી શૈક્ષણિક લાયકાત
(૧) કલાઉસ વોરેન ફીકચસ પ્રા.લી. મુ. લાખોદ	(બી.કોમ પાસ, પાંચ વષનો એકાઉન્ટીગ વકસનો અનુભવ ઉમર ૨૦ થી ૩૦ વષ)
(૨) શેર એ ગુજરાત સીકયુરીટી સવિસ ભુજ	(સીકયુરીટી ગાડ માટે ધોરણ ૮ થી ૧૨ પાસ, માત્ર પુરૂષ ઉમેદવારો ઉમર ૨૦ થી ૪૫ વષ) સુપરવાઈઝરી માટે બી.એ. બીકોમ પાસ (માત્ર પુરૂષ ઉમેદવારો) ઉમર ૨૦ થી ૪૫ વષ
(૩) જીંદાલ સો લીમી. (આઈ.ટી.આઈ. પાસ) મુ શમાઘોઘા તા. મુન્દ્રા	એપ્રેન્ટીસ (કોપા, ઈલેકટ્રીશીયન,ફિટર,ઈન્સ્ટુમેશન,મશીન ગ્રાઈન્ડર, ટનર,વેલ્ડર,વાયરમેન
(૪) શ્રી રેણુંકા સુગર લીમી. મુ. ભારાપર	એપ્રેન્ટીસશીપ ઈલેકટ્રીશીયન,ફિટર,ઈન્સટેમેશન, વેલ્ડર, વાયરમેન, બોયલર એટેન્ડન્ટ, (તમામ માટે આઈ.ટી.આઈ. પાસ)
(૫) પારલે પ્રોડકટસ પા.લી. મુ. લેર	આઈ.ટી.આઈ. ઈલેકટ્રીશીયન, ફિટર ઉમર ૨૨ થી ૪૦ વષ

રોજગારવાંચ્છુ ઉમેદવારોને ફાયદાઓ : ભરતી અંગેની સેવાઓ તદ્દન નિ:શુલ્ક છે. રોજગાર કચેરી ખાતે નોંધાયેલ જગ્યાઓ સહિત અન્ય જગ્યાઓ સામે રોજગાર વાંચ્છુઓને પ્રચારપત્રિકા રવાના કરવામાં આવેલ છે. જેથી મોટી સંખ્યામાં રોજગાર વાંચ્છુ ઉમેદવારો ઉપસ્થિત રહી નોકરીની પસંદગી માટે બહોળો અવકાશ મેળવશે. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી હોવા છતા લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો પણ હાજર રહી શકશે, નોકરીદાતાશ્રી અથવા તેમના પ્રતિનિધિશ્રી ઉકત રોજગાર ભરતીમેળાના સ્થળે ઉપસ્થિત શહીને ઉમેદવારોની પ્રિસ્ક્રુટીની કરશે. આશા છે કે આપ સહભાગી થશો.

અન્ય ભરતી. ભારતીય લશ્કરમાં ભરતી :- કચ્છ જિલ્લાના ઉમેદવારો માટે તા. ૨૧/૪/૨૦૧૨ના રોજ સવારે ૪-૩૦ થી ૮-૦૦ કલાક સુધી, સીટી પોલીસ હેડ કવાટસ રેસકોષ, રાજકોટ ખાતે. જગ્યાઓ સોલ્વન્ટ જનરલ ડયુટી (એસ.એસ.સી. પાસ ૪૫% સાથે, ૧૭.૬ થી ૨૧ વષ, ૧૬૮ સે.મી. ઉંચાઈ, છાતી ૭૭ થી ૮૨) સોલ્જર ટેકનીકલ અને સોલ્જર નસીંગ આસી. એચ.એસ.સી.સાયન્સ ૧૭.૬ થી ૨૩ વષ ૧૬૨ સે.મી. ઉંચાઈ, છાતી ૭૭ થી ૮૨ સેમી.) સોલ્જર કલાક એચ.એસ.સી. ૪૦%(અંગ્રેજી ગણીત અને એકાઉન્ટસ વિષય સાથે૧૭.૬ થી ૨૩ વષ ૧૬૨ સે.મી. ઉંચાઈ, છાતી ૭૭ થી ૮૨ સેમી.) અને સોલ્જર ટ્રેડમેન એસ.એસ.સી. પાસ, ૧૭.૬ થી ૨૩ વષ, ૧૬૮ સે.મી. ઉંચાઈ, ૭૭ થી ૮૨ સે.મી.છાતી,) **તમામ માટે વજન ૫૦ કિલો ગ્રામ**

લશ્કરમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ નિયત સમયે અને તારીખે તમામ અશલ પ્રમાણપત્રો /માકશીટ/સરપંચ/કાન્સીલરનો દાખલો/ અધિકારીનું પ્રમાણપત્ર/જાતિનું પ્રમાણપત્ર/ ૧૬ પાસપોટ સાઈઝના ફોટાગ્રાફ/ પોલીસ ખાતા તરફથી મેળવેલ ચારીત્રીયનો દાખલો વગેરે સાથે ઉપસિથત રહેવું.

જે નોકરીદાતાઓએ અગાઉથી ખાલી જગ્યાઓ રોજગાર કચેરી ખાતે નોધાવેલ નથી તેઓશ્રી પણ ભરતીમેળામાં ઉપસિથત રહી શકશે. અને પસંદગીની કાયવાહી કરી શકશે.

રોજગાર અધિકારી (જનરલ)
ભુજ-કચ્છ
નામાનિ/કચ્છ/૨૩૨/૨૦૧૨

ટેન્ડર નોટીસ
યુ.એન.મહેતા ઇન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર
(બી.જે. મેડીકલ કોલેજ, અમદાવાદ સાથે સંલગ્ન)
સિવિલ હોસ્પિટલ, અસારવા, અમદાવાદ-૩૮૦૦૧૬ ગુજરાત
ફોન-(૦૭૯) ૨૨૬૮૨૩૯૫, ૨૨૬૮૪૨૨૦, ૨૨૬૮૪૨૦૦ ફેક્સ - (૦૭૯) ૨૨૬૮૨૦૯૨
email : unmicrc@gmail.com website : www.unmicrc.org

હૃદયરોગની સુપર સ્પેશ્યાલીટી સંસ્થા માટે એક વર્ષના કરારથી નીચે દર્શાવેલ આઇટમ માટે મેન્યુફેક્ચર, ઓથોરાઇઝ ડીલર, એજન્સી, ડીસ્ટ્રીબ્યુટર્સ પાસેથી ટેન્ડરથી ભાવ મંગાવવામાં આવે છે.
(૧) ડ્રગ અને મેડીસીન (ઇન્જેક્શન, આઇઓનીક-નોન આઇઓનીક ડાઇ, સોલ્યુશન, સર્જીકલ, વેક્સીન વગેરે) (૨) સર્જીકલ, મેડીકલ, એનેસ્થેટીક, ઇ.સી.જી., ટી.એમ.ટી. હોલ્ટર, હીમોડાયાલીસીસ, પેશન્ટ આઇ.ડી. બેન્ડ, કન્ઝ્યુમેબલ્સ આઇટમ (૩) આર.ઓ. પ્લાન્ટ માટેના કેમિકલ્સ (૪) ઇ.ટી.ઓ. અને ઓટોક્લેવ કન્ઝ્યુમેબલ આઇટમ (૫) બિલ્ડીંગ મેઇન્ટેનન્સ કોન્ટ્રાક્ટ અને બિલ્ડીંગ મટીરીયલ્સ સપ્લાય (૬) સેનેટરી અને હાર્ડવેર આઇટમ્સ (૭) ઝેરોક્ષ મશીન મૂકી ઝેરોક્ષ કોપી કાઢી આપવા માટે (૮) કેન્ટીન કોન્ટ્રાક્ટ (દર્દીઓ, દર્દીઓના સગાઓ અને સંસ્થાના સ્ટાફ માટે ભોજન-નાસ્તા માટે)
પોતાના લેટરપેડ ઉપર ટેન્ડર ફોર્મ મેળવવા માટેની અરજી દરેક ટેન્ડર માટે રૂા.૫૦૦/- (અંકે રૂપિયા પાંચસો પૂરા) નોન રીફંડેબલ રોકડેથી ભરીને સંસ્થાના સ્ટોર્સ વિભાગમાંથી રૂબરૂ મેળવી શકાશે.
● ટેન્ડર ફોર્મ મેળવવા માટેની છેલ્લી તારીખ - ૦૭-૦૪-૨૦૧૨ (સવારે ૧૧.૦૦ થી સાંજના ૫.૦૦ કલાક)
● ભરેલ ટેન્ડર ફોર્મ પરત કરવા માટેની છેલ્લી તારીખ - ૧૩-૦૪-૨૦૧૨ (સાંજના ૫.૦૦ કલાક)
ભરેલા ટેન્ડર ફોર્મ સીલબંધ કવરમાં રૂબરૂમાં, રજીસ્ટર્ડ પોસ્ટ એડી અથવા સ્પીડ પોસ્ટ થી દર્શાવેલ સમય મર્યાદામાં મળી જાય તે રીતે મોકલી આપવાના રહેશે. સમય મર્યાદા બાદ મળેલ ટેન્ડર ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. જે તે આઇટમોની વિગત અને શરતો ટેન્ડર ફોર્મમાં દર્શાવેલ છે. વધુ વિગત માટે સંસ્થાની વેબસાઇટ www.unmicrc.org જોવા વિનંતી.
- નિયામક
ક્રમાંક/સંમાનિ/અબદ/૨૦૯૮/૨૦૧૨

જાહેરાત
સંકલિત બાળ વિકાસ યોજના, લખપત મુ.દયાપર

સંકલિત બાળ વિકાસ યોજના ઘટક લખપત તાલુકાના નીચે જણાવેલ ગામોમાં ચાલતા આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી વર્કર/હેલ્પર તરીકે માનદવેતનમાં તદ્દન હંગામી ધોરણે ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે.
(૧) આંગણવાડી વર્કર/હેલ્પર માટે ઉમેદવાર સ્થાનિક હોવી જરૂરી છે.
(૨) ઉમેદવારની પસંદગીમાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને નિમણૂકમાં અગ્રતા આપવામાં આવશે અને વર્કર માટે ઓછામાં ઓછું-૧૦ પાસ હોવું જરૂરી છે. તથા હેલ્પર માટે ઓછામાં ઓછું ૭ પાસ હોવું જરૂરી છે.
(૩) ઉમેદવારની ઉંમર ૧૮થી ૩૩ વર્ષની વચ્ચેની હોવી જરૂરી છે.
(૪) ઉમેદવાર પરિણીત હોવી જરૂર છે.
(૫) પરણિત મહિલાઓ પાસેથી સાદા કાગળમાં અરજી જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-૨૦ સુધીમાં રજિ.પો.એડીથી સંકલિત બાળ વિકાસ યોજનાની કચેરી દયાપર તા.લખપત અજય બંગલો મળે તે રીતે પ્રમાણિત કરેલ જરૂરી પ્રમાણપત્રો, રાશનકાર્ડ ચૂંટણીકાર્ડ, મેરેજ સર્ટિ. વગેરે સાથે રહેશે.
(૬) જાહેરાત અગાઉ આવેલ તમામ અરજીઓ ફાઇલે કરવામાં આવેલ છે તેથી અગાઉ અરજી કરેલ અરજદારોએ ફરીથી અરજી કરવાની રહેશે.
(૭) અધૂરી વિગતોવાળી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી જે માટે કોઇ પત્રવ્યવહાર કરવામાં આવશે નહીં.

વર્કરની ખાલી જગ્યાઓ
(૧) જુમારા (૨) ખીરસરા (૩) અકરી (૪) બૈયાવો (૫) પાનધ્રો-૩ (૬) સોતાવાંઢ (૭) ખડક (૮) અમિયા (૯) જાડવા (૧૦) મીઢિયારી

હેલ્પરની ખાલી જગ્યોઓ
(૧) પીપર (૨) ખીરસરા (૩) રામાણિયા (૪) મુધવાય (૫) ગુનેરી (૬) પાનધ્રો-૨ (૭) ગુનાઉ (૮) મોરી (૯) તહેરા (૧૦) બીટિયારી (૧૧) ખડક (૧૨) સુજાવાંઢ (૧૩) મુડિયા (૧૪) સામજિયારા (૧૫) સુભાષપર (૧૬) પાનધ્રો-૩ (૧૭) માતાનામઢ-૩ (૧૮) સોતાવાઢ (૧૯) અમીયા (૨૦) જાડવા (૨૧) વિરાણી (૨૨) દયાપર-૨ (૨૩) સિયોત (૨૪) માણકાવાંટ (૨૫) કપુરાશી-૨ (૨૬) અકરી (૨૭) બૈયાવો (૨૮) મુધાન

મીની આંગણવાડી
(૧) સાનધ્રોવાંઢ (૨) ઘગ્રડવાંઢ (૩) મોરગર (૪) ઓડીવાંઢ (૫) કોરા(દયાપર)

સંકલિત બાળવિકાસ અધિકારી
મુ.દયાપર તા.લખપત
નામાનિ/કચ્છ/૨૩૩/૨૦૧૨

2012-03-27 -Divya Bhaskar -Bidada -Satpanth Samaj Protest [421]

ફેક્ટ ફાઈલ આસામના પોલીસ વિભાગમાં વિવિધ હોદ્દા ઉપર 5000 જગ્યાઓ ખાલી છે, અત્યારે 42000 પોલીસકર્મી છે.

હેલ્થ કેપ્સુલ

એસ્પ્રિનથી કેન્સરને રોકવામાં મદદ મળે

realpatidar.com

મેલબોર્નઃ એસ્પ્રિન અને અન્ય ઘરેલુ દવાઓનો ઉપયોગ કરવાથી કેન્સરને આગળ વધતું રોકવામાં સફળતા મળે છે. તે ટ્યૂમરને પોષણ આપતા રસ્તાઓમાં અડચણ પેદા કરે છે. જેનાથી ટ્યૂમર શરીરના અન્ય હિસ્સામાં ફેલાઇ શકતી નથી. આ દાવો મેલબોર્નના પીટર મૈક કૈલમ કેન્સર સેન્ટરના વૈજ્ઞાનિકોએ કર્યો હતો. સંશોધકો સ્ટીવન સ્ટૈકર અને સહયોગીઓએ લિન્ક નોડ્સની કેન્સર સામેની પ્રતિક્રિયા પર સંશોધન હાથ ધર્યું હતું. તેમને અભ્યાસ બાદ જાણવા મળ્યું હતું કે એસ્પ્રિન આ નોડ્સને પહોળી થતાં રોકે છે. જેનાથી ટ્યૂમર સુધી પર્યાપ્ત પોષણ મળી શકતું નથી. આ શોધથી પ્રોસ્ટેટ અને બ્રેસ્ટ કેન્સર માટે નવી દવાઓ બનાવી શકાશે.

ફ્લૂથી થતાં મૃત્યુ વારસાગત હોઇ શકે, જિન જવાબદાર

લંડનઃ વૈજ્ઞાનિકોએ અભ્યાસ બાદ શોધી કાઢ્યું હતું કે અમુક લોકોના મોત ફ્લૂથી થતાં હોય છે, જ્યારે અમુક લોકો સામાન્ય દવાઓથી પણ ઠીક થઇ જાય છે. બ્રિટિશ અને અમેરિકી સંશોધકોએ એવો દાવો કર્યો છે કે તેની પાછળ જિન જવાબદાર છે. વૈજ્ઞાનિકોએ 2009માં સ્વાઇન ફ્લૂથી પીડાતા લોકોનો કેસ સ્ટડી કર્યો હતો. જેમાંથી અમુક લોકોને માત્ર સામાન્ય તાવ, શરદી, ખાંસી અને છીંક જેવી પરેશાની થવા પામી હતી. જ્યારે અમુક લોકોના મોત થઇ ગયા હતા. સંશોધકો પોલ કેલ્લમે જણાવ્યું હતું કે આઇટીએફઆઇટીએમ-3 નામના આ જિન ફ્લૂથી બચવા માટે હોય છે. જ્યારે આ જિન શરીરમાં વધારે હોય છે ત્યારે ફ્લૂથી મોત ન થાય. આ સંશોધનમાં બર્ડ ફ્લૂ જેવી બીમારીઓ માટે નવી દવાઓ બનાવી શકાશે.

એન્ટીબાયોટિક દવાઓથી બાળકોમાં દમની આશંકા વધે

કોલંબિયાઃ યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયાના વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો હતો કે એન્ટીબાયોટિક દવાઓથી બાળકોમાં દમની આશંકા વધી જવા પામે છે. દુનિયાભરમાં એક કરોડ લોકો દમથી પીડાય છે. દરેક દસકામાં તેના દર્દીઓની સંખ્યા 50 ટકા વધી જવા પામે છે. માઇક્રોબાયોલોજિસ્ટ બ્રેટ ફિલાલેએ જણાવ્યું હતું કે આપણા પેટમાં અંદાજે એક હજાર અબજ બેક્ટેરિયા હોય છે. આ આપણી પાચન વ્યવસ્થાને સારી રીતે કામ કરવા માટે નિયંત્રિત કરે છે. પરંતુ અમુક એન્ટીબાયોટિક દવાઓથી આ બેક્ટેરિયા પર નકારાત્મક પ્રભાવ પડે છે. જેનાથી અસ્થમાની આશંકા વધી જાય છે. કનાડિયન હેલ્થ રિસર્ચના માર્ક ક્કિલેટે જણાવ્યું હતું કે નાના-નાના જીવાણુઓ ઇન્સાનોના સ્વાસ્થ્યમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

દાંતમાં સડો થાય તો હૃદયને ખતરો

આયરલેન્ડઃ દાંતમાં સડો થાય તો તેનાથી જે કીટાણુ પેદા થાય તેનાથી હૃદયને નુકસાન થઇ શકે છે. મોઢામાંથી આ કિટાણુઓ લોહીમાં ભળી જઇ શકે છે. જેનાથી હૃદયની અંદર મોજુદ કોશિકાઓમાં સોજો આવી શકે છે. જેનાથી મોત પણ આવી શકે. આ સ્થિતિને એન્ડોકાર્ડાઇટિસ કહે છે. સામાન્ય રીતે એન્ડોકાર્ડાઇટિસને સર્જરી અથવા તો અધિક તીવ્રતા ધરાવતી એન્ટીબાયોટિક દવાઓથી મટાડી શકાય છે. પરંતુ કિટાણુઓ પર હવે આ દવાઓની અસર થતી નથી. સંશોધકો પૈકીના રોયલ કોલેજ ઓફ સર્જન્સના હૈલન પીટરસને જણાવ્યું હતું કે આ બિમારીથી પીડાતા 30 ટકા લોકોના મોત થઇ જાય છે. જે લોકોના પેઢામાં લોહી આવવાની સમસ્યા હોય તેવા લોકોને વધુ ખતરો રહે છે.

એપલ સામે 83 વર્ષની વૃધ્ધાએ રૂા.5 કરોડનો દાવો માંડ્યો

ન્યૂયોર્કમાં એપલ સ્ટોરના કાચના દરવાજા સાથે ટકરાતાં વૃધ્ધાનું નાક ભાંગી ગયેલું : 10 લાખ ડોલરનું વળતર માગ્યું

પીટીઆઇ. ન્યૂયોર્ક

ન્યૂયોર્કના એપલ સ્ટોરમાં કાચની દીવાલ (દરવાજો) સાથે અથડાઇને પોતાનું નાક તોડી ચૂકેલી એક મહિલા ગ્રાહકે હવે આ ટેક્નોલોજી જાયન્ટ સામે 10 લાખ ડોલર(આશરે રૂા.5 કરોડ)ના વળતર માટે કોર્ટમાં દાવો માંડ્યો છે.

બનાવ આમ તો 13 ડિસેમ્બરનો છે જ્યારે 83 વર્ષીય વૃધ્ધા એવલીન પાસવોલ (ફર કંપનીની પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ)એપલ સ્ટોરમાં આઇ ફોન પાછો આપવા ગયા હતા. તેને ખબર ન હતી કે તે કાચની દીવાલ સાથે અથડાઇ રહી છે. અકસ્માત બાદ તેને નાકમાં ફ્રેક્ચર થયું હતું. હવે રહી રહીને તેણે યુએસ ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ ફેડરલ કોર્ટમાં વળતર માટે કેસ દાખલ કર્યો છે.

આ બારામાં ધ ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ દાવેદાર ગ્રાહકે એવલીને અદાલતી અરજીમાં જણાવ્યું છે કે, ન્યૂયોર્કના મેનહટ્ટનના આ એપલ સ્ટોરમાં પ્રવેશદ્વારે કાચની દીવાલ એવી રીતે છે કે વયસ્ક ગ્રાહકોને દેખાય નહીં. આ એક રીતે આવા ગ્રાહકો પર જોખમ છે.

'એપલે ધ્યાન રાખવું જોઇએ કે વયોવૃધ્ધ પણ તેના ગ્રાહકો છે'

અદાલતી અરજીમાં એમ પણ જણાવ્યું છે કે, એપલના મોટાભાગના ગ્રાહકો ટિન-એજ અને કોલેજ સ્ટુડન્ટસ છે છતાં કંપનીએ ધ્યાન રાખવું જોઇએ કે કેટલાક વયોવૃધ્ધ પણ તેમના ગ્રાહકો છે.

તિબેટિયનનું આત્મવિલોપન

તસવીર એએફપી

તિબેટમાંથી દેશવટો ભોગવતા તિબેટીયનોએ નવી દિલ્હીમાં સોમવારે રેલી યોજીને ચીનના રાષ્ટ્રપતિ હૂ જિન્તાઓની આગામી ભારતયાત્રાનો વિરોધ કર્યો હતો. એક તિબેટીયન દેખાવકારે આત્મવિલોપન કરી લીધું હતું. તે ખુદને આંગ ચાંપી ભડ ભડ સળગ્યો હતો.

વર્તમાનમાં પણ મહાકાવ્યોની ઉપયોગિતા બરકરાર : ગુલઝાર

મહાભારત જેવા ઐતિહાસિક મહાકાવ્યોને માત્ર ભૂતકાળ પૂરતા સિમિત ન ગણવા મશહુર ગીતકારનો નિર્દેશ

પીટીઆઇ. નવીદિલ્હી

લેખો, કાવ્યોનું ભાષાંતર થાય એ જરૂરી

ગુલઝારે આ તકે જણાવ્યું હતું કે આજે મોટાભાગના લોકો એક કે બે ભાષા જ જાણતા હોય છે, આથી અન્ય ભાષામાં થતાં ખેડાણને રસિકો સાથે પહોંચાડવા માટે ભાવાનુવાદ કે ભાષાંતર થાય તે જરૂરી છે અને તેમાં લેખકો કે કવિઓને વાંધો હોવો જોઇએ નહીં.

બોલિવૂડના અમુક ચુનંદા ગીતકારોમાં જેમનું નામ મોખરે આવે તેવા લીજેન્ડરી ગીતકાર ગુલઝારે જણાવ્યું હતું કે આપણા ઐતિહાસિક વારસા સમાન મહાકાવ્યો કે જે ભૂતકાળમાં સાંપ્રત મહત્ત્વ ધરાવતા હતા, તે આજના મોડર્ન યુગમાં પણ એટલા જ ઉપયોગી છે.

ગુલઝારે તેમના મિત્ર પવન કે વર્માના પુસ્તક યુધિષ્ઠિર અને દ્રૌપદીના હિન્દીમાં ભાષાંતર વખતે ઉપરોક્ત બયાન આપ્યું હતું, અને સાથોસાથ ઉમેર્યું હતું કે મહાકાવ્યો આજના સમયમાં પણ એ વખત જેટલી જ ઉપયોગિતા ધરાવે છે.

મહાભારતના અતિ મહત્ત્વના ગણાતા એપિસોડની પસંદગી કરીને પવન વર્માએ યુધિષ્ઠિર અને દ્રૌપદી નામના કાવ્યસંગ્રહ તૈયાર કર્યા હતા. જેમાં પાંડવો અને યક્ષ વચ્ચેના રસપ્રદ વાર્તાલાપને સોનેટમાં મઢી દેવામાં આવ્યા છે. લેખક કમ ડિપ્લોમેટ વર્માએ મહાભારતના આ પ્રસંગને જરા જુદી રીતે રજૂ કર્યો છે.

ગુલઝારે આ તકે જણાવ્યું હતું કે આજની અત્યંત ઝડપી લાઇફમાં મહાકાવ્યો આપણી જિંદગીથી અત્યંત દૂર જતા જાય છે અને આજના યુવાનો તેના મહાત્મ્યથી વિમુખ થતા જાય છે, જે વાજબી નથી. પવને મહાભારતના જે એપીસોડની પસંદગી કરી છે તે વધુને વધુ લોકો સુધી પહોંચે તે આવશ્યક છે.

ગુલઝારે આ તકે પોતાની તાજેતરમાં લોન્ચ થયેલી નિગ્લેટેડ પોએમ્સ નામના પુસ્તકના અમુક અંશો પણ વાંચી સંભળાવ્યા હતા. આ પુસ્તકમાં જિંદગીના નાના-મોટા તમામ બનાવોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ટાઇગર શ્રોફ 'આશિકી-ટુ'નો હીરો નથી : જેકીનો ખુલાસો

થોડા દિવસ પહેલા ટાઇગર અને મહેશ ભટ્ટ વચ્ચેની મુલાકાતથી આવું ધારી લેવામાં આવ્યું હતું

પીટીઆઇ. મુંબઇ

થોડા દિવસ પહેલા ભાવિ અભિનેતા ટાઇગર શ્રોફ ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટને મળ્યો હતો. આથી, ટાઇગર 'આશિકી-ટુ' નો હીરો બની ગયો છે તેવી ચર્ચાએ બોલિવૂડમાં જોર પકડ્યું છે. ટાઇગરના પિતા જેકી શ્રોફે ખુલાસો કર્યો છે કે, ભટ્ટ સા'બને ટાઇગર અન્ય કામથી મળ્યો હતો. હીરો બનવા માટે ટાઇગર હજુ એક-બે વર્ષ નાનો છે.

1990ની સફળ ફિલ્મ આશિકીની રિમેક અથવા સિક્વલ બનવાની છે તેવી ચર્ચા છેલ્લા કેટલાક માસથી ચાલે છે.

એવામાં ટાઇગરની ભટ્ટ સાથેની મુલાકાતથી ધારી લેવામાં આવ્યું કે તે આશિકીની સિક્વલનો હીરો નક્કી થઇ ગયો છે. અસલ ફિલ્મમાં રાહુલ રોય હીરો હતો. આમિર ખાન દ્વારા ટાઇગર શ્રોફનું બોલિવૂડમાં લોન્ચિંગ થશે.

ટાઇગરનો જન્મ થયો ત્યારે જ સુભાષ ઘાઇએ તેને સાઇન કરેલો !

વર્ષો જૂની વાત છે. ટાઇગર શ્રોફનો જન્મ થયો ત્યારે નિર્માતા-નિર્દેશક સુભાષ ઘાઇએ જેકી શ્રોફ સાથે મૌખિક કરાર કરી ટાઇગરને લોન્ચ કરવા વચન આપ્યું હતું. ઘણા ઓછાને ખબર હશે પણ, જેકીની પત્ની આયેશાનું કન્યાદાન સુભાષ ઘાઇએ કર્યું છે. ફિલ્મ 'હીરો' થી જેકીને બ્રેક આપનાર ઘાઇ જ તો હતા.

ગેરકાયદે દવા પરીક્ષણ મામલે સુપ્રીમે સરકારનો કાન આમળ્યો

એજન્સી. નવીદિલ્હી

સુપ્રીમ કોર્ટે સોમવારે દેશમાં કરાતા ગેરકાયદે દવા પરીક્ષણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આવા પરીક્ષણને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા અદાલતે કેન્દ્ર સરકારને તાકીદે યોગ્ય પગલાં લેવા આદેશ કર્યો છે.

જસ્ટિસ આર. એમ. લોઢા અને એચ. એલ. દત્તુની બેંચે કહ્યું હતું કે, લોકો મરી રહ્યા છે. આ સૌથી દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. આમ, સુપ્રીમે ગેરકાયદે દવા પરીક્ષણ મામલે સરકારનો કાન આમળ્યો હતો.

ભારતમાં ક્લિનિકલ રિસર્ચ કરતા બિન સરકારી સંગઠને કોર્ટમાં એક જનહિત અરજી દાખલ કરી હતી. સુપ્રીમે કેન્દ્ર સરકાર અને એમસીઆઇને આ મુદ્દે છ અઠવાડિયામાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે. કેસની આગલી સુનાવણી 13 જુલાઇના રોજ થશે. આઇએસસીઆર દ્વારા કોર્ટમાં જનહિત અરજી દાખલ કરવામાં આવી છે.

મોના કપૂરના અંતિમ સંસ્કાર

ફિલ્મ નિર્માતા બોની કપૂરની પૂર્વ પત્ની અને ફ્યુચર સ્ટુડિઓની માલિક મોના કપૂરનું કેન્સરની બીમારીથી રવિવારે નિધન થયું. સોમવારે તેના અંતિમ સંસ્કાર વેળાએ મલાઇકા અરોરા, અરબાઝ ખાન, સલમાન ખાન, શબાના આઝમી, જાવેદ અખ્તર, વિનોદ ખન્ના, અનિલ કપૂર, સોનમ કપૂર, અભિષેક બચ્ચન વિગેરે હાજર હતા. 1996માં બોની કપૂરે શ્રીદેવી સાથે લગ્ન કરી લેતાં તેણે મોના કપૂરથી છૂટા છેડા લઈ લીધા હતા. તેમના પુત્ર અર્જુન કપૂરની ફિલ્મ રિલિઝ માટે તૈયાર છે.

રા-વનની એનિમેટર ચારૂ ખંડાલ કાર અડફેટે ઘાયલ

ભાસ્કર ન્યૂઝ. મુંબઈ

રા-વન ફિલ્મની એનિમેટર ચારૂ ખંડાલ રવિવારે એક પૂરઝડપે આવતી કારને અડફેટે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ કેસમાં પોલીસે ચાલકની ધરપકડ કરી હતી. જોકે બાદમાં તે જામીન પર છૂટી ગયો હતો.

રવિવારે 26 વર્ષીય ચારૂએ શનિવારે રાત્રે મિત્રો અને કુટુંબીઓ માટે પાર્ટી રાખી હતી. આ પાર્ટી મોડી રાત સુધી ચાલી હતી. આ પછી તે, તેની બહેન રિતુ અને મિત્ર વિક્રાંત ગોયલ રિક્ષામાં ઓશિવરામાં ઘરે જવા માટે નીકળ્યાં હતાં.

એક હોંડા સિટી કારે પૂરપાટ વેગે આવીને રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. રિક્ષા ઊથલી પડવાને લીધે ચારીને ગંભીર ઈજા પહોંચી હતી. રિતુ અને વિક્રાંત પણ ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલસ કરવામાં આવ્યા હતા.

ટાઇટેનિકની થ્રી-ડી આવૃત્તિ યુવા અને વયસ્ક બન્ને વર્ગને ગમશે

ટાઇટેનિક થ્રી-ડી જોતાં એવું જ લાગે છે કે જાણે પહેલીવાર આ ફિલ્મ જોતા હોઇએ : નિર્માતા

પીટીઆઇ. નવીદિલ્હી

15 વર્ષ બાદ ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ 'ટાઇટેનિક' થ્રી-ડી ફોર્મેટમાં સિનેમાઘરોમાં રિલિઝ થશે. નવી દિલ્હી આવેલા ફિલ્મના નિર્માતા જોહન લેન્ડોએ કહ્યું કે, થ્રી-ડીમાં ટાઇટેનિક જોતા એવું લાગે છે કે જાણે પહેલી વાર આ ફિલ્મ જોતા હોઇએ. ટાઇટેનિકનું થ્રી-ડી વર્ઝન યુવાન અને વયસ્ક બન્ને વર્ગના દર્શકોને ખૂબ જ ગમશે. હું તો ટાઇટેનિક થ્રીડીમાં જોવા ભારે ઉત્સાહી છું.

ટાઇટેનિક થ્રી-ડીના પ્રમોશન માટે ભારત આવેલા જોહને વધુમાં કહ્યું કે, આ ફિલ્મ જોયા બાદ દર્શકોને માલૂમ પડશે કે દરેક ફિલ્મો સિનેમાઘરમાં જઇને શું કામ જોવી જોઇએ? જોહનને હજુ એ ઘડી યાદ છે જ્યારે 1997ની શ્રેષ્ઠ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ તેણે મેળવ્યો હતો.

નિર્માતા જોહન લેન્ડોને ઉમ્મીદ છે કે, ભારતમાં ટાઇટેનિકને નવું ઓડિયન્સ મળશે. 1997માં રિલિઝ થયેલી ફિલ્મને સારો આવકાર મળ્યો હતો. ત્યાર બાદ લોકોએ ડીવીડી પર આ ફિલ્મ જોઈ છે પરંતુ સિનેમાઘરમાં જઇને તેની થ્રી-ડી આવૃત્તિ જોવાનું વધુ ગમશે.

ટાઇટેનિકના થ્રી-ડી ફૂટેજ જોઇને કેટ બોલી ઊઠી 'ઓહ્ માય ગોડ'

ટાઇટેનિકના 18 મિનિટના થ્રી-ડી ફૂટેજ ફિલ્મના હીરો હીરોઇન લિઓનાર્દો દકેપ્રિઓ અને કેટ વિન્સ્લેટે અલગ અલગ જોયા હતા. કેટ તો થ્રી-ડી જોઇને બોલી ઊઠી 'ઓહ્ માય ગોડ' ઉલ્લેખનીય છે કે ટાઇટેનિક બાદ કેટ અને લિઓની કારકિર્દી જે ઊંચકાય તેની કોઇ સીમા નથી.

અશ્રુભીની શ્રદ્ધાંજલિ

આપની અણધારી વિદાયથી અમો ખૂબઉંડા દુઃખની લાગણી અનુભવિએ છીએ. આપના આત્માને પ્રભુ પરમ શાંતિ અર્પે એવી પ્રાર્થના

સ્વ. સોમીબેન ગોવિંદ ચૌહાણ ઉ.વ. ૪૫
સ્વ.તા. ૨૨/૩/૨૦૧૨

શોકાતુર

•ગોવિંદ વી. ચૌહાણ (કોલી)-પતિ
•વાલાભાઇ વસતા ચૌહાણ-જેઠ
•ભુપતભાઇ ધનાભાઇ ચૌહાણ-ભત્રીજો
•જેસંગભાઇ ધનાભાઇ ચૌહાણ-ભત્રીજો
•દાનુભાઇ ધનાભાઇ ચૌહાણ-ભત્રીજો
•મોમાયાભાઇ ધનાભાઇ ચૌહાણ-ભત્રીજો
•કેશુભાઇ વાલાભાઇ ચૌહાણ-ભત્રીજો
•પરબત ધનાભાઇ ચૌહાણ-ભત્રીજો
•દિનેશ ડાયાભાઇ ચૌહાણ-ભત્રીજો
•પિયુષ ડાયાભાઇ ચૌહાણ-ભત્રીજો
•બાબુભાઇ ડાયાભાઇ ચૌહાણ-ભત્રીજા
•રાજેશભાઇ વાલાભાઇ ચૌહાણ-ભત્રીજો
•જયેશ ગોવિંદભાઇ ચૌહાણ-પુત્ર
•લક્ષ્મીબેન ગોવિંદભાઇ ચૌહાણ-પુત્રી
•ધના વસતા ચૌહાણ(કોલી)-જેઠ
•અનિતાબેન ભૂપતભાઇ ચૌહાણ-પૌત્રી
•બાબુ મોતીભાઇ દુદાસણા-ભાઇ
•રમેશ મોતીભાઇ દુદાસણા-ભાઇ
•રામો મોતીભાઇ દુદાસણા-ભાઇ
•ભીમા વીસા દુદાસણા-ભાઇ
•સામા વિસા દુદાસણા-ભાઇ
•કરશન વિસા દુદાસણા-ભાઇ
•નરેશ,હિતેશ,ચંદ્રેશ,ધ્રુવ, અભય,અમિત,હર્ષદ-પૌત્ર

સદગીતની આગરી ૨૯/૩/૨૦૧૨ તથા મોરીયાઃ૩૦/૧૨/૧૨,મુ. ડાવરી તા. રાપર-કચ્છ

આપના પ્રિયજનોની
બેસણું
ઉઠમણું
શ્રદ્ધાંજલિ
પ્રાર્થનાસભા
દુઃખદ અવસાન
ની કલર જાહેર ખબર (અંદરના પાને)
૫x૨/૧૦x૧ ફક્ત રૂા.૧૫૦૦
૧૦x૨ ફક્ત રૂા.૩૦૦૦
સ્કીમ સિવાયની જાખનો ભાવ રૂા.૨૨૫/-
દિવ્ય ભાસ્કર
-: ભુજ ઓફીસ :- સંપર્કઃ ૩૦૮૨૨૩, ૯૯૭૯૬ ૩૩૫૫૫
-: ગાંધીધામ ઓફીસ :- સંપર્કઃ ૨૨૬૬૮૮, ૯૯૦૯૯ ૪૪૦૭૨

જેમ્સ કેમેરોન પહોંચ્યા દરિયાના તળિયે!!

35, 756 ફિટ સમુદ્રમાં ડાઇવિંગ અત્યાર સુધી માત્ર બે જ સાહસિક કરી શક્યા હતા

પીટીઆઇ. હ્યુસ્ટન

'અવતાર'ના નિર્દેશક જેમ્સ કેમેરોને છેક દરિયાના તળિયે ડાઇવિંગ કરવાનો અનોખો અનુભવ મેળવ્યો હતો. જ્યાં અત્યાર સુધી માત્ર બે જ ડાઇવર જઇ શક્યા છે. આ ઊંડાઇ 35, 756 ફિટ હતી. પેટાળમાં પહોંચીને કેમેરોનના પ્રથમ ઉદ્ગાર હતા ''ઓલ સિસ્ટમ્સ ઓકે'' તેમણે ગુઆમ ટાપુના પેસિફિક આઇસલેન્ડમાં નેશનલ જિઓગ્રાફિક સોસાયટીના સૌજન્યથી 57 વર્ષીય જેમ્સ કેમેરોન આ સાહસ ખેડી શક્યા હતા. વન-મેન સબમરિનની મદદથી આશરે 7 માઇલ સમુદ્રના પેટાળમાં એક્સ્પ્લોરિંગ-ફિલ્મિંગનું કામ કર્યું હતું. આ કામ ખૂબ જ કપરું હતું. સમુદ્રમાં હજ્જારો ફિટ પેટાળમાં જતા તેમને 2 કલાક લાગ્યા હતા.

12 ટનની વન-મેન સબમરિનનો ઉપયોગ કર્યો

જેમ્સ કેમેરોનની આ સાહસયાત્રા માટે નેશનલ જિઓગ્રાફિક સોસાયટીના નિષ્ણાતોએ વન-મેન સબમરિન તૈયાર કરી હતી. જેનું વજન 12 ટન હતું. લાઇમ-ગ્રીન કલરની આ વન-સીટર સબમરિનનું નામ હતું-ડીપ સી ચેલેન્જર.

પ્રથમ વખત 1960માં બે વ્યક્તિએ આવું સાહસ ખેડેલું

પ્રથમ વખત 1960માં બે વ્યક્તિએ આવું સાહસ ખેડ્યું હતું. સ્વિસ એન્જિનિયર જેક્સ પિકાર્ડ અને યુ. એસ. નેવી કેપ્ટન ડોન વોલ્શે દરિયાના પેટાળમાં 7 માઇલ સુધી જવા લગભગ પાંચ કલાક લગાડ્યા હતા. તેઓ ત્યાં માત્ર 20 મિનિટ રોકાઇ શક્યા હતા.

ટાઇટેનિક માટે 33 વખત સમુદ્રમાં ડાઇવિંગ કર્યું હતું

ઘણા ઓછાને ખબર છે કે, જેમ્સ કેમેરોનને બાળપણથી જ દરિયાઇ સૃષ્ટિ અને તેને લગતા વિષયોમાં રસ છે. તેમણે આ સાહસ અગાઉ 72 વખત દરિયાના પેટાળમાં ડાઇવિંગ કર્યું હતું. જે પૈકી 33 વખત ટાઇટેનિક માટે ડાઇવિંગ કર્યું હતું. તેમણે ટાઇટેનિક બનાવતા પહેલાં જબરું સંશોધન કર્યું હતું. આ માટે તેઓ જ્યાં ટાઇટેનિક જહાજ ડૂબ્યું હતું.

Digitially Archived by: www.realpatidar.com/library

2012-03-27 -Divya Bhaskar -Bidada -Satpanth Samaj Protest [421]

ફાયર સાથે 'ફાઇટિંગ'

તસવીર મનોજ રાઠોડ

મેઘપર બોરીચી પાસે આવેલી એક ટિમ્બર કંપનીમાં સોમવારે આગ લાગી ગયા બાદ આગે અન્ય બે કંપનીને પણ પોતાની લપેટમાં લઇ લીધી હતી. આગને કાબૂમાં લેવા માટે અગ્નિશામક દળના કર્મચારીઓને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આસપાસની કંપનીના કામદારો પણ આગને બૂઝાવવા માટે આવ્યા હતા.

મેઘપરની ત્રણ ટિમ્બર કંપનીમાં શોર્ટ સર્કિટથી ભયંકર આગ

એક કંપનીમાં લાગેલી આગ બીજા બે બેન્સામાં પણ પ્રવેશ્યા બાદ ત્રણથી ચાર કલાકની જહેમત પછી માંડ કાબૂમાં આવી : મોટું નુકસાન

ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ

આદિપુરની ભાગોળે મેઘપર બોરીચી પાસે ગળપાદર માર્ગ પર આવેલી ત્રણ ટિમ્બર કંપનીમાં સોમવારે બપોરના ભાગે શોર્ટ સર્કિટથી લાગેલી આગે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્રથમ એક જ બેન્સામાં આગ લાગ્યા બાદ પવનના પગલે આગ તેને અડીને આવેલા બીજા બે બેન્સામાં ફેલાઇ ગઇ હતી. ચાર જેટલાં ફાયર ફાઇટરે આગને માંડ માંડ કાબૂમાં લીધી હતી.

સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ગળપાદર માર્ગ પર આવેલા શ્રી વિષ્ણુ ટિમ્બરમાં સોમવારે બપોરના 1:25 વાગ્યાના અરસામાં લાકડાં કાપવાની કરવતનું મશીન ચાલુ હતું. તેવામાં જ શોર્ટ સર્કિટ થતાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. લાકડાંના ભૂસાંમાં આગ લાગતાં આ નાની આગે જોતજોતામાં ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પવનના લીધે બાજુમાં આવેલી અન્ય બે ટિમ્બર કંપનીમાં પણ આગ ભભૂકી ઉઠી હતી. બાજુમાં આવેલા વાસુભાઇના બેન્સામાં તથા એમ.પી. ગુપ્તાના બેન્સામાં પણ આગ ફેલાઇ ગઇ હતી. જેના પગલે પ્રથમ ગાંધીધામ નગરપાલિકા બાદ અંજાર નગરપાલિકા, વેલસ્પન કંપની તથા કેપીટીના ફાયર ફાઇટર ઘટનાસ્થળ પર ધસી આવ્યાં હતાં. સાંજે પાંચથી છ વાગ્યાના અરસામાં આગ માંડ માંડ કાબૂમાં આવી હતી. વિષ્ણુ ટીમ્બરના માલિકના જણાવ્યા પ્રમાણે તેઓને આ આગથી એકથી સવા કરોડનું નુકસાન પહોંચ્યું છે.

અંજારથી લઇને આદિપુર સુધી ધુમાડા દેખાયા

સોમવારે બપોરના લાગેલી આગ ખૂબ જ ભયાનક હતી. આગના કારણે ઉત્પન્ન થયેલા ધુમાડા અંજારની સાથે આદિપુર સુધી નજરે પડ્યા હતા. મેઘપર બોરીચી પાસે આવેલી સોસાયટીના રહેવાસીઓ પણ આગને નિહાળવા માટે ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા.

ગાંધીધામમાં ₹ 18 હજારનો દારૂ પકડાયો

ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ

ગાંધીધામના ચૂંગીનાકા ફાટક પાસે છકડા વડે દારૂની ડિલિવરી આપવા આવી રહેલા આદિપુરના એક બૂટલેગરને પોલીસે પકડી પાડ્યો હતો. આરોપીના કબજામાંથી અંગ્રેજી શરાબની જુદી જુદી બ્રાન્ડના શરાબ તથા બિયરનો જથ્થો જપ્ત કરાયો હતો.

આદિપુરના વોર્ડ 6/બી ખાતે આવેલા સંત કંવરરામ ખાતે રહેતા નથુરામ કાનજીમલ મનસુખાણી નામનો બૂટલેગર દારૂ લઇને નીકળ્યો હોવાની બાતમીના આધારે પોલીસની ટીમ ચૂંગીનાકા ફાટક પાસે વોચમાં હતી. આ દરમિયાન પોલીસે નં. જીજે 12 એવી 4350 સાથેના છકડાને રોકતાં અંદરથી પોલીસને અંગ્રેજી શરાબની રૂા. 16800ની 48 બોટલ તથા બિયરના 12 ટીન મળી આવ્યાં હતાં. કુલ 18 હજારનો શરાબ મળી આવતાં પોલીસે નથુરામ કાનજીમલ મનસુખાણીની પણ ધરપકડ કરી હતી.

એસબીઆઇના ટેક્સ બાબતે પાલિકાના કર્મચારીઓ અને શાસકપક્ષ વચ્ચે ફરી શીતયુદ્ધ

કર્મચારીઓ તથા નગરસેવક સામસામે

શાસકપક્ષના નેતાના મતે બેંકને પાણીના વેરામાંથી માફી અપાઇ છે : તો બીજી બાજુ કર્મચારીઓના મતે પાણી બેંકને મળે છે

ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ

બેંકનું જોડાણ કાપતા કર્મચારીઓ. મનોજ રાઠોડ

ગાંધીધામ નગરપાલિકાના કર્મચારી તથા ભાજપના નગરસેવકો ફરી આમને-સામને આવી ગયા છે. સોમવારે એસબીઆઇના બાકી બચતા વેરાની ઉઘરાણી માટે નગરપાલિકાની ટીમ બેંકના પાણીના કનેકશન કાપવા માટે પહોંચી હતી. તે જ સમયે શાસકપક્ષના નેતા દોડી આવી વેરો ન ભરવાનું જણાવતાં મામલો બિચક્યો હતો. જોકે, પાલિકાએ પાણી કનેકશન કાપ્યા બાદ સાંજ સુધી બેંકે રૂા. ચાર લાખનો ચેક જમા કરાવી દીધો હતો.

મળતી વિગતો મુજબ સોમવારે નગરપાલિકાની ટીમ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના વેરા પેટે બાકી બચતા રૂપિયાની ઉઘરાણી માટે પહોંચી હતી. બેંકના મેનેજર ચેક આપવા માટે તૈયાર થઇ ગયા હતા તે જ સમયે નગરપાલિકા શાસકપક્ષના નેતા પરેશ ઠક્કર પહોંચી ગયા હતા અને આ વિસ્તારમાં નગરપાલિકાનું પાણી આવતું જ ન હોવાથી વર્ષ 2009ના ઠરાવ પ્રમાણે તેઓને પાણી પેટે ટેક્સ ચૂકવવાનું આવતું નથી તેવું જણાવ્યું હતું, તો કર્મચારીઓ ટેક્સ લીધા વગર પાછા જવાના મૂડમાં ન હતા અને જેના પગલે બેંકનું પાણીનું કનેકશન કાપી નાખ્યું હતું. મોડી સાંજે બેંકે પાલિકાની ટીમને રૂા. ચાર લાખનો ચેક આપી દેતાં પાણી કનેકશન રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. જોકે, બેંકે વાંધા સાથે આ પેમેન્ટ કર્યું હોવાનું પણ જાણવા મળે છે.

આ અંગે પરેશ ઠક્કરે જણાવ્યું હતું કે, સેક્ટર 9,10,11 અને 12માં નગરપાલિકા પાણી આપતી નથી. જેના પગલે વર્ષ 2009માં આ વિસ્તારમાં પાણીની ડિમાન્ડ રદ્દ કરવાની મંજૂરી આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જેના અનુસંધાને બેંકને અગલા વર્ષે પણ પાણી વેરામાંથી મુક્તિ અપાઇ હતી. આ વર્ષે પણ નગરપાલિકાના જ એક કર્મચારીએ બેંકને પાણી વેરામાંથી મુક્તિ આપવામાં આવશે તેવી લેખિતમાં નોંધ કરી હતી. તેમ છતાં સોમવારે પાલિકાની ટીમ વેરો ઉઘરાવવા માટે પહોંચી ગઇ હતી. તો બીજી બાજુ સુધરાઇના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, શાસકપક્ષને નેતા અવારનવાર તેઓની કામગીરીમાં હસ્તક્ષેપ કરે છે અને પાલિકાની વેરા વસૂલાત ઝુંબેશને યોગ્ય રીતે ચલાવવા દેતા નથી. રહી વાત બેંકની તો ચીફ ઓફિસરના આદેશથી જ તેઓએ આ પગલું ભર્યું હતું. બેંકને નગરપાલિકા પાણી આપે જ છે તેવું ખુદ બેંકના મેનેજર જણાવી રહ્યા છે.

ન્યૂઝ ઇનબોક્સ

ગાંધીધામ રેલવે સ્ટેશન સલાહકાર સમિતિમાં વરણી

જીતેન્દ્ર જૈન

યજુવેન્દ્રસિંહ

ગાંધીધામ : ગાંધીધામ રેલવે સ્ટેશનની ઉપભોક્તા સલાહકાર સમિતિમાં કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના જીતેન્દ્ર સી. જૈનની વરણી કરવામાં આવી છે. ગત ટર્મમાં આદિપુર રેલવે સ્ટેશનનું વિસ્તરણ, વધુ રેકની ફાળવણી જેવા મુદ્દાઓ જાડેજાએ ઉઠાવ્યા હતા. જૈન અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના ક્ષેત્રિય પ્રભારી છે. આ ઉપરાંત અમરચંદ સિંઘવી સ્કૂલની પ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલા છે.

ગાંધીધામ પાસેના ગામડાઓને ગટર જોડાણ કેમ આપ્યાં?

ગાંધીધામ: ગાંધીધામની આસપાસના કેટલાંક ગામડાંમાં આવેલી સોસાયટીઓને સુધરાઇના કર્મચારીઓ અને ભૂતકાળના એક અધિકારી દ્વારા ગેરકાયદે જોડાણ આપી દેવામાં આવ્યાં હોવાથી તેને કાપવા માટે સુધરાઇમાં કોંગ્રેસના નગરસેવક સમીપ જોશીએ ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરી છે. એક પત્રમાં જોશીએ જણાવ્યું હતું કે, ગાંધીધામની આસપાસના ગામડાંની અમુક સોસાયટીઓએ ગેરકાયદે ગટર કનેકશન લીધેલાં હતાં, તેમાંથી અમુક હાલે ચીફ ઓફિસર અમીત પંડયાએ કાપ્યાં પણ છે. જોશીના જણાવ્યા મુજબ તે સમયના ચીફ ઓફિસર તલાટીએ નગરપાલિકાના ઇજનેર પ્રકાશ જુરાણીએ તથા તે સમયના શાસકોએ ગાંધીધામ તાલુકાના અંતરજાળના રેવન્યુ સર્વે નં. 10/1 અને 10/2માં આવેલા અર્બુદાનગરનું ગેરકાયદે કનેકશન આદિપુરમાં સ્ટેટ હાઇવેની નીચેથી જોડી છે. તેમણે ગેરકાયદે કનેકશન તાત્કાલિક કાપી નાખવા અનુરોધ કર્યો હતો.

બર્નિંગ રિક્ષા : ગાંધીધામના ટાગોર રોડને અડીને આવેલા સર્વિસ માર્ગ પર સોમવારે સવારના ભાગે એક ઓટોરિક્ષા અચાનક જ સળગીને સ્વાહા થઇ ગઇ હતી. ચાલકનો બચાવ થયો હતો. મીઠુ ચૌહાણ

જીગરજાન દોસ્ત 'જીગર' જુગ જુગ જીવો

જીગર તારાચંદભાઈ છેડા
પ્રમુખ,
કચ્છ જિલ્લા ભાજપ યુવા મોરચો

ભારતીય જનતા પાર્ટીના કચ્છ જિલ્લાના યુવા મોર્ચાના અધ્યક્ષ જીગરભાઇ તારાચંદભાઇ છેડા દૃઢ વિશ્વાસ, નિર્ધાર અને પ્રમાણિકતા સાથે યુવાનીને જીવનની કારકિર્દીને વળાંક આપવા માટે મહત્ત્વની સમજી રહ્યા છે. ભુજમાં જીવદયા અને માનવસેવા સાથે સતત અગ્રેસર એવા સર્વ સેવા સંઘના પ્રમુખ અને પીઢ નેતા તારાચંદભાઇ અને શહેરના પૂર્વ નગરપ્રમુખ હંસાબેનના બીજા નંબરના પુત્ર જીગરભાઇની આજે ૨૯મી વર્ષની વર્ષગાંઠ છે. ૨૭મી માર્ચ ૧૯૮૪ના દિવસે જન્મેલા જૈન સમાજના આ સેવાભાવી યુવાનેતા યુવાનીની શરૂઆતથી જ પોતાના વ્યક્તિત્વને રાજકારણ સાથે સમાજકારણમાં જોડી દેવાનો વારસો બખૂબી નિભાવી રહ્યા છે. શ્રીનગરના લાલ ચોકમાં તેમની યુવા ટીમ સાથે ત્રિરંગો ફરકાવીને યુવાની સાથે દેશભક્તિનું જોમ દર્શાવી દીધું હતું. ડ્રીમ્સ ફાઉન્ડેશન દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે કચ્છના ગ્રામીણ યુવાનોને પ્રોત્સાહન આપવા માટે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટ હોય એ તેમના માટે સફળતાના પરિબળ સાબિત થયાં છે. રાજકીય વારસો ધરાવવા ઉપરાંત સેવાનો વારસો પણ મેળવનારા આ યુવા નેતાએ સામાજિક સેવા સાથે ધંધા વ્યવસાયમાં પણ કાઠું કાઢ્યું છે. જિલ્લા ઉપરાંત રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન કરવા કચ્છના યુવાનોમાં એકતા ઉભી કરવાનું કામ પણ રાજકારણના માધ્યમથી પાર પડાઇ રહ્યું છે. શરમાળ સ્વભાવ ધરાવતા યુવાન જીગર છેડાની વાત કરીએ તો પિતાના પગલે આગળ વધવાનો દૃઢ વિશ્વાસ તેમનામાં કેળવાયો છે. તો રામજન્મ ભૂમિના સ્થળ પર રામમંદિરના વાસ્તવિક દર્શન એ તેમનું સ્વપ્ન છે. યુવા ટીમને સફળ નેતૃત્ત્વ તેમનો ગુણ રહ્યો છે અને તેમના સાથીઓના સહકાર અને શુભકામનાઓ તેમની પ્રગતિમાં યશભાગી બન્યા છે. હેપી બર્થ ડે.. સાથે લખ લખ વધાઇચું....

Digitially Archived by: www.realpatidar.com/library

બંદૂકના ચાર રાઉન્ડ છાતીમાં ધરબી દઇને ઠંડે કલેજે મર્ડર કરી દેવાયું

આધોઇમાં યુવાનની ગોળી મારીને હત્યા

અગાઉ મારામારી તથા ચોરી સહિતના ગુનાઓમાં પકડાઇ ગયેલા શખ્સની હત્યા નીપજાવ્યા બાદ લાશને શિવમંદિર પાસે મૂકી દેવાઇ : અગાઉની મારામારીનું મનદુ:ખ રાખી હત્યા કરાઇ હોવાની શંકા

ભાસ્કર ન્યૂઝ . આધોઇ, લાકડિયા

ભચાઉ તાલુકાના આધોઇ ખાતે સોમવારે શિવમંદિરના પગથિયાં પાસે જ એક યુવાનની બંદૂકની ગોળીઓ વડે હત્યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. અગાઉ મારામારી તથા ચોરીના બનાવોમાં પકડાઇ ગયેલા આ શખ્સની કોણે હત્યા કરી તે અંગે પોલીસ મોડેક સુધી મગનું નામ મરી પાડી રહી નથી.

મળતી વિગતો મુજબ આધોઇ ખાતે આવેલા સેક્ટર-1ના શિવમંદિરની સામે સોમવારે વહેલી સવારે ગામના જ ઘનશ્યામસિંહ જાલુભા જાડેજા (કોજાણી) ઉ.વ.23 પર કોઇ અજાણ્યા આરોપીઓએ ચાર રાઉન્ડ ફાયર કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. હત્યા બાદ મૃતકની લાશને મંદિરના પગથિયાં પર મૂકી આરોપીઓ નાસી ગયા હતા. સોમવારે વહેલી સવારે મંદિરમાં દર્શન માટે આવેલા ભક્તોને આ લાશ નજરે પડતાં પોલીસને જાણ કરાઇ હતી.

હત્યાના પગલે સમગ્ર આધોઇ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી, તો હત્યાના સમાચાર મળતાં જિલ્લા પોલીસ વડા ચિરાગ કોરડિયા, ભચાઉના ડીવાયએસપી ડી.એલ. ડોડિયા, આધોઇ પીએસઆઇ બી.એમ. લશ્કરી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતકના ગળા તથા છાતીના ભાગે બંદૂક અથવા પિસ્તોલ વડે ચાર જેટલી ગોળીના નિશાન જોવા મળ્યાં હતાં. મૃતકને કુલ કેટલી ગોળી લાગી છે તેની જાણ માટે લાશને લાકડિયા સીએચસીમાં ખસેડવામાં આવી હતી.

ખૂબ જ ચકચારી એવી મર્ડરની આ ઘટના અંગે આધોઇ પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર બી.એમ. લશ્કરીએ જણાવ્યું હતું કે, જેનું ખૂન થયું છે તે મૃતક આમ તો રિઢો ગુનેગાર હતો. આ યુવાન સામે અગાઉ પણ ભૂતકાળમાં પણ અનેક મારામારીના બનાવો નોંધાયા હતા. મારામારીની સાથે મૃતક પર ચોરી કરવાના, શરાબ પીવાના ગુનાઓ પણ નોંધાયા હતા, ત્યારે પ્રાથમિક તબક્કે કોઇ જૂની મારામારીનું મનદુ:ખ રાખી અથવા આ શખ્સથી કંટાળેલા કોઇ શખ્સે તેની હત્યા નીપજાવી હોય તેવી પોલીસને શંકા છે.

ખૂનની આ ચકચારી ઘટના બાદ પોલીસે મરનાર ક્ષત્રિય યુવાન સાથે સંકળાયેલી ભૂતકાળની ઘટનાઓ અંગે વ્યક્તિઓ અંગે ગુપ્ત રાહે છાનબીન શરૂ કરી દીધી છે. જોકે, વધુ કોઇ ખુલાસો થઇ શક્યો નથી.

ઘટનાસ્થળે લાશની તપાસ કરી રહેલી પોલીસ - **રાયશી રાઠોડ, કેશવ મછોયા**

એક માસ પહેલાં જ મારામારી થઇ હતી

નોંધનીય છે કે, એક માસ અગાઉ જ મૃતક યુવાન પર મુસ્લિમ ટોળાંએ હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. આ મારામારીમાં મૃતકને હાથમાં પ્લાસ્ટર પણ આવ્યું હતું. આ પ્લાસ્ટર છોડાવ્યા બાદ તે તંદુરસ્ત બની બજારમાં પણ ફરતો હતો.

રવિવારે પણ બોલાચાલી થઇ હતી

ગામના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ મરનારા યુવાન સાથે રવિવારે સાંજે તેમના વિસ્તારના વડીલોની બોલાચાલી થઇ હતી. આ બનાવમાં વાહનોના કાચ પણ તૂટ્યા હતા, ત્યારે પોલીસ તથા સ્થાનિક લોકોને હત્યા પાછળ આ બનાવ પણ હોઇ શકે છે તેવી શંકા છે.

લાશને જામનગર મોકલાઇ

લાશને પીએમ માટે લાકડિયા સીએચસીમાં લઇ જવામાં આવી હતી, જ્યાં મોડી રાત્રિ સુધી પીએમ ચાલ્યું હતું. મૃતકના શરીરમાં ગોળીના ચાર નિશાન જોવા મળ્યાં હતાં. સરકારી તબીબને લાશમાંથી માત્ર એક જ ગોળી મળી આવતાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું. તબીબે ભારે જહેમત કરી હોવા છતાં અન્ય ગોળી ન મળતાં અંતે લાશને જામનગર મોકલવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

ગાંધીધામના કિડાણાના મીઠાના પ્લોટ અંગે CIDએ FIR દાખલ કરી

પ્રદીપ શર્મા સામે વધુ એક કેસ દાખલ કરી પકડી લેવાનો તખ્તો ઘડાયો

ભુજની કોર્ટમાંથી જ આજે પ્રદીપ શર્માને અરેસ્ટ કરાય તેવી સંભાવના

ભાસ્કર ન્યૂઝ. ભુજ

કિન્નાખોરીની પર્યાય બની ચૂકેલી રાજ્યની ભાજપશાસિત મોદી સરકારે ફરી એકવાર કચ્છના પૂર્વ કલેક્ટર અને સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી પ્રદીપ શર્મા સામે વધુ એક કેસ દાખલ કર્યો છે.

કચ્છના ગાંધીધામ તાલુકાના કિડાણા ખાતે મીઠાના પ્લોટ ફાળવવા અંગેના પ્રકરણમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા ગત શુક્રવારે શર્મા સામે આ અંગે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આજે મંગળવારે ભુજની કોર્ટમાં અન્ય એક કેસના સંદર્ભમાં શર્મા હાજર થવાની સંભાવના છે, ત્યારે સીઆઇડી ક્રાઇમ દ્વારા ભુજ કોર્ટના પ્રાંગણમાંથી જ તેમની ધરપકડ કરે તેવી

અનુસંધાન પાના નં.6

શર્મા બંધુઓને હેરાન કરવાનો કારસો ?

જામીન ઉપર છૂટતી વખતે કોર્ટે આપેલા નિર્દેશ મુજબ પ્રદીપ શર્માને દર અઠવાડિયે હાજરી આપવાની હોય છે. તેથી તેઓ દર સોમવારે સીઆઇડી ક્રાઇમમાં ગાંધીનગર ખાતે હાજરી આપવા જતા હોય છે. ગત શુક્રવારે એફઆઇઆર દાખલ કર્યા બાદ સીઆઇડી ક્રાઇમ ધારે તો તે જ દિવસે કે, પછીના દિવસે અથવા સોમવારે જ્યારે પ્રદીપ શર્મા ગાંધીનગર પોલીસ ભવનમાં સીઆઇડી ક્રાઇમની ઓફિસમાં હાજરી આપવા માટે ગયા, ત્યારે તેમની ધરપકડ કરી શકાય તેમ હતું, પરંતુ સીઆઇડીએ શર્માની હજુ સુધી ધરપકડ કરી નથી. હવે જ્યારે મંગળવારે ભુજની કોર્ટમાં એસીબીના એક કેસમાં રિમાન્ડના પ્રકરણ સંદર્ભે પ્રદીપ શર્મા કચ્છ આવી રહ્યા છે, ત્યારે તેમને કોર્ટના પ્રાંગણમાંથી જ પકડી લેવાનો કારસો ઘડવામાં આવ્યો હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના સૌથી વરિષ્ઠ આઇપીએસ અધિકારી કુલદીપ શર્માએ પ્રમોશનના મુદ્દે રાજ્યની મોદી સરકાર સામે જંગ છેડ્યો છે. કુલદીપ શર્માએ દિલ્હી કેટ ઉપરાંત અન્ય અદાલતમાં પણ રાજ્ય સરકાર સામે કેસ દાખલ કર્યો છે, પરિણામે દિલ્હીમાં કુલદીપ શર્માનું કંઇ ન બગાડી શકતી રાજ્યની ભાજપ શાસિત સરકાર તેમના નાના ભાઇ પ્રદીપ શર્મા સામે એક પછી એક તીર ચલાવી રહી હોવાનો ગણગણાટ પણ આઇએએસ, આઇપીએસ લોબીમાં સંભળાઇ રહ્યો છે.

અભિનંદન "સંતાનપ્રાપ્તિ"

આથી અમો **મધુબેન પરેશભાઈ ભીખાભાઈ ઢોલરીયા** રહે. બેડીપરા, ભાવનગર રોડ, પરેશ ઈન્ડસ્ટ્રીઝ, રાજકોટ. મો.નં.૯૨૨૮૪ ૬૩૨૩૭ તથા ૮૦૦૦૭ ૮૮૪૨૦ આથી અમો ડૉ. પંકજભાઈ પટેલને લાખ લાખ અભિનંદન પાઠવીએ છીએ કે અમારા લગ્ન થયાને ૫ વર્ષમાં સંતાનમાં બે બેબી હતી. અમે ત્રીજા સંતાન માટે ઘણા ડૉ.ની દવા લેતા હતા પણ સફળતા મળતી ન હતી. પણ જનસેવા હોસ્પિટલના ડૉ.પંકજભાઈ પટેલની સલાહ-સારવાર લેવાથી અમારે ઘરે ત્રીજા સંતાનનું પારણું બંધાયું હતું. જેથી અમારા ઘરમાં ખુશીનું સામ્રાજ્ય છવાયું હતું. આથી અમો ડૉ.શ્રીને અભિનંદન પાઠવીએ છીએ. **આ જનસેવા હોસ્પિટલ, શ્રી સિદ્ધેશ્વર હનુમાનજી સેવા સંકુલ-કુલકી ચોકડી વઘાડા વિરમગામથી ૧૪ કિ.મી. માંડલ તરફ આવેલ છે. જેના મો.નં.9426372904, 9904915210 છે.**

ભચાઉ નજીક 3.4નો આંચકો લોકો ભયથી ઘર બહાર દોડયા

ભાસ્કર ન્યૂઝ. ભુજ

ભૂકંપના આંચકાઓથી ધ્રુજતી વાગડની ધરતી આજે ફરી 3.4ની તીવ્રતાના આંચકાથી ધ્રુજી ઉઠી હતી. ભચાઉ નજીક આવેલા આ આંચકાની તીવ્રતા છેક ભરૂડિયા સુધી અનુભવાઇ હતી અને લોકો ભયના માર્યા ઘરની બહાર દોડી ગયા હતા.

તાજેતરમાં જ 3ની તીવ્રતા ઉપરના ઉપરાઉપરી આવેલા આ ત્રીજા આંચકાએ લોકોમાં ચિંતા જગાવી છે. આઇએસઆર ગાંધીનગરના જણાવ્યા પ્રમાણે રાત્રે 12:09 વાગ્યે ભચાઉ

અનુસંધાન પાના નં.6

DTH પર Zee TV જોવા માટે ટ્યૂન ઈન કરો: Dish TV (Channel no. 100 and 110), Tata Sky (Channel no. 117), Airtel Digital TV (Channel no. 102), Videocon d2h (Channel no. 103), Big TV (Channel no. 209) and Sun Direct (Channel no. 308).